

## નૈવ વિશ્વસિતવ્યં સ્તોકેડપિ કષાયશે કિન્તુ મિથ્યાદુષ્કૃતાદિભર્જિટિયેવ તતો નિવર્ત્તનીયમ् ।

વિશેષાવશ્યક ભાષ્ય

- ૩૩. ૧૩૨૪

ક્યાં ભરોસો કરીએ છીએ આપણે

આગાની ચિનગારીનો ?

ક્યાં આપણે ઉપેક્ષા કરીએ છીએ

નાનકડા પણ સાપોલિયાની ?

ક્યાં આપણે બેફિકર રહીએ છીએ

નાનકડા પણ રોગ પ્રત્યે ?

પણ અનંતજ્ઞાનીઓ અહીં આપણું ધ્યાન

એક અલગ જ બાબત તરફ દોરી રહ્યા છે.

‘કષાયનું કદ નાનું છે

એમ સમજુને ન તો એનો તું ભરોસો કરતો કે

ન તો એની તું ઉપેક્ષા કરતો,

ન તો એને તું મામૂલી માની બેસતો કે

ન તો એને તું તુચ્છ માની બેસતો.

કારણ કે એનું પોત ચિનગારીનું છે.

નાનકડી એક જ ચિનગારીમાં જેમ

લાખો-કરોડો જીવોની સ્મરણયાત્રા કાઢી નાખવાની

પાશવી ક્ષમતા પડી છે,

તેમ નાનકડા એક જ કષાયમાં તારા કરોડો-અબજો વરસોના સંયમપર્યાયને

નિરર્થક અને નુકસાનકારી બનાવી દેવાની પાશવી ક્ષમતા પડી છે.

એક જ વખતના મામૂલી પણ કષાયમાં

લોચ-વિષારાદિના તેં વેઠેલાં કષ્ટોને,

લોહી-પાણી એક કરીને તેં કરેલા સ્વાધ્યાયને,

શરીરને કૃશ બનાવી દેતી તેં કરેલ તપશ્ચયાને મૂલ્યહીન બનાવી દેવાની ભયંકર ક્ષમતા ધરી છે.

તારી પાસે જો દાસ્તિનો ઉઘાડ હોય,

પ્રભુવચનો પર તારી જો શ્રદ્ધા હોય,

દુર્ગતિના જાલિમ દોષોથી તારી જાતને તું જો દૂર રાખવા માગતો હોય,

આજે શબ્દોમાં રભી રહેલ મોક્ષના સુખને

તું જો અનુભૂતિનો વિષય બનાવવા માગતો હોય,

મોક્ષ ન મળે ત્યાં સુધી તારા માટે

તું જો સદ્ગતિની પરંપરા નક્કી કરી દેવા માગતો હોય તો

એના શ્રેષ્ઠ વિકલ્પો બે જ છે.

શું જીવનમાં કે શું મનમાં, કષાયને તું સ્થાન આપ જ નહીં.

સત્ત્વની કચાશના કારણે

નિમિત્તને આધીન બનીને તારાથી કારારેક

કષાય થઈ પણ જતો હોય અથવા તો

સામે ચડીને તું કષાય કરી બેસતો પણ હોય

તો તું તુર્ત જ એનું મિથ્યા મિ દુક્કડ માગી લઈને

એનાથી પાછો ફરી જા.

શું કહીએ તને ?

અપમાનો વેઠવા પડતાં હોય તો એ વેઠી લેજે.

અહું તૂટો હોય તો તૂટવા દેજે અને

કદાચ જીવન પર ખતરો આવી જતો હોય તો એને સ્વીકારી લેજે

પણ કષાયને તો તું તારું મન આપતો જ નહીં.

અનંતકાળથી આ સંસારમાં તને રખડતા રાખવાનું કામ

જે કષાયોએ કર્યું છે

એ કષાયોમાં મિત્રબુદ્ધિ ?

એ કષાયોમાં સુરક્ષાબુદ્ધિ ?

એ કષાયોમાં હિતબુદ્ધિ ?

એ કષાયોમાં ઉપકારીબુદ્ધિ ?

યાદ રાખજે, આ જ તો મિથ્યાત્વ છે.

કપડાંથી તું સંયમી અને મનથી તું મિથ્યાત્વી ?

**चिरपरिचितमपि सूत्रार्थं यः शून्यहृदयतया न स्मरति  
स शिष्यो न योग्यः शिष्यत्वस्यापि, गुरुत्वं तु दूरेणैव तस्य ।**

विशेषावश्यक भाष्य

— १४४३

ભલે ને વિદ્યાર્થી જબરદસ્ત હોશિયાર છે,  
પોતે જે કાંઈ ભાડી ગયો છે  
એને સ્મૃતિપથ પર અકબંધ કરી દેવા એ  
સતત પ્રયત્નશીલ બન્યો જ રહે છે.  
ધંધાના ક્ષેત્રમાં એ વેપારીની નામના  
ભલેને ‘કુશળ ખેલાડી’ ની છે,  
પોતાના ધંધાને જમાવેલો રાખવા  
એ સતત નફા-તોટાનું સરવેયું કાઢતો જ રહે છે.  
કિકેટના જગતમાં એનું નામ ભલેને કરોડોના મુખે ચડી ગયું છે,  
પોતાની ‘ગુડવિલ’ ટકાવી રાખવા  
એ ‘નેટ પ્રેક્ટિસ’ કરતો જ રહે છે.  
મુનિ !  
તારી પાસે વરસોનો સંયમપર્યાય છે. કબૂલ !  
લોચ-વિહારાદિનાં કષ્ટો તને કોઠે પડી ગયા છે. કબૂલ !  
તપશ્ચર્યા તારે મન ડાબા હાથનો ખેલ બની ગઈ છે. કબૂલ !  
સૂત્ર અને એના અર્થ તારા માટે ચિર-પરિચિત બની ગયા છે. કબૂલ !  
પણ યાદ રાખજે, તારી પાસે જો એ સૂત્રાર્થનું પુનરાવર્તન નથી,  
પ્રમાદને પરવશ બનીને, સુખશીલવૃત્તિનો શિકાર બનીને,  
જાતની સ્મરણશક્તિ પર વધુ પડતો ભરોસો રાખીને  
તું જો નિષ્ઠુર હદ્યનો શિકાર બનીને સૂત્રાર્થના સ્વાધ્યાયને  
એક બાજુ પર મૂકી બેઠો છે.  
‘હું ધારું ત્યારે સૂત્રાર્થને ઉપસ્થિત કરી શકું છું

એવા જ્યાલમાં પ્રમાદને આધીન બનીને તું વિકથાદિમાં વ્યસ્ત બની ગયો છે  
તો યાદ રાખજે,  
તારી પાસે રહેલ ‘શિષ્યપણું’ તો ગાયબ છે જ પણ  
કદાચ તારી પાસે ‘ગુરુપદ’ આવી ગયું હોય તો  
એ તો તારાથી ક્યારાનું ય દૂર થઈ ગયું છે.  
સ્વાધ્યાય એ જ જેના જીવનનો પ્રાણ હોય,  
પ્રભુનાં વચ્ચનો એ જ જેના જીવનની એક માત્ર મૂકી હોય,  
સૂત્રાર્થસ્મરણ

એ જ જેના મનને વશમાં રાખવાનો એક માત્ર શ્રેષ્ઠ વિકલ્ય હોય  
એવો મુનિ જો સૂત્રાર્થના સ્મરણને, સ્વાધ્યાયને,  
પરાવર્તનને, અનુપ્રેક્ષાને એક બાજુ મૂકી દેશે તો  
એ મુનિનું ‘મુનિપણું’ ટકશે શી રીતે ?

યાદ રાખજે,  
આ જગતમાં કેટલાક એવા જીવો પણ છે કે  
જેઓ પાસે ‘આંખ’ જરૂર છે  
અને છતાં તેઓ ‘આંધળા’ છે.  
‘જબ’ જરૂર છે છતાં  
તેઓ ‘મુંગા’ છે અને  
‘કાન’ જરૂર છે છતાં  
તેઓ ‘બહેરા’ છે.

તારા માટે એવું તો ન બનવું જોઈએ કે  
તારા શરીર પર સંયમીની જહેરાત કરતાં ‘કપડાં’ તો હોય  
અને છતાં તારી પાસે ‘સંયમ’ ન હોય.  
સાચે જ આ કરુણાતાનો શિકાર તું જો  
નથી જ બનવા માગતો તો તું એક કામ કર.  
આજે કડકડાટ બની ગમેલા અને  
સડસડાટ ચાલી રહેલા સૂત્ર અને અર્થને તું  
સતત ભાવસભર હૈયે સ્મૃતિપથ પર લાવતો જ જા.  
ચાલુ રહેતું મશીન, કાટથી બચી જાય છે.  
ચાલુ રહેતું સૂત્રાર્થનું સ્મરણ, તારા સાધુપણાંને બચાવી લેશે.

## ગુરુવિત્તં પ્રસાદયન् શિષ્ય: સમ્યક શ્રુતં લભતે ।

વિશેષાવશ્યક ભાષ્ય

— ગા. ૮૩૭

પોતાના સદ્ગૃહીતન દ્વારા જેલરને ખુશ કરી દેતો કેટી કદાચ  
જેલમાંથી વહેલો છૃટકારો મેળવી પણ લે છે  
તો ય એટલા માત્રથી એનું જીવન સમસ્યામુક્ત બની જતું નથી.  
બની શકે એની પત્નીનો સ્વભાવ કર્કશ હોય,  
એના દીકરાનો સ્વભાવ ઉદ્ધત હોય,  
સંપત્તિના ક્ષેત્રે એ કંગાળ હોય,  
મકાનના ક્ષેત્રે એ ઝૂપડામાં રહેતો હોય  
આબરૂના ક્ષેત્રે એ બેઅબરૂ હોય.  
શરીરક્ષેત્રે એ રોગિષ હોય.  
જેલમાંથી છૃટકારો મજ્યા બાદ પણ  
આ બધી સમસ્યાઓ તો એના મસ્તક પર  
તલવારની જેમ લટકતી જ હોય છે.  
શાંતિનો એને અનુભવ ક્યાં ?  
પ્રસન્નતા એની અકબંધ ક્યાં ?  
સ્વસ્થતા એની નિશ્ચિત ક્યાં ?  
પણ મુનિ !  
સદ્ગૃહીતન દ્વારા, સદ્ગૃહીતારના માધ્યમે  
તું જો તારા અનંતોપકારી ગુરુદેવના ચિત્તને પ્રસન્ન રાખી શક્યો  
તો એના ફળ તરીકે તને જે પણ શ્રુત પ્રાપ્ત થાય  
એ શ્રુતને ‘સમ્યક’ નું ગૌરવ મળી જાય  
અને સમ્યક બની જતું એ શ્રુત  
આ જગતના કહેવાતા તમામ લાભોની તને પ્રાપ્તિ કરાવીને જ રહે.

‘સમ્યક શ્રુત’ શું કરે એમ તું પૂછે છે ?  
સાંભળી લે એનો જવાબ.  
પ્રલોભનોની હાજરીમાં એ તને પાપબુદ્ધિનો શિકાર બનવા નથી દેતું,  
તો પ્રતિકૂળતાની હાજરીમાં એ તને  
અસમાવિથી ગ્રસ્ત બનવા નથી દેતું.  
સેવાઈ જતા પાપ પાછળ તારા ચિત્તમાં એ પશ્ચાત્તાપની આગ  
પેઢા કર્યા વિના નથી રહેતું તો  
સુકૃતસેવનના સમાચાર મળવા માત્રથી  
તારા હૃદયને એ આનંદવિભોર બનાવી દીધા વિના રહેતું નથી.  
યાદ રાખજો.  
ગુરુની પ્રસન્નતા છતાં ય  
વિપુલ શ્રુતનું સ્વામિત્વ તારી પાસે ન આવે એ સંભવિત છે.  
કારણ કે શ્રુતની વિપુલતા તો જ્ઞાનાવરણના  
ક્ષ્યોપશમને આભારી છે કે જે કદાચ તારી  
પાસે પ્રબળ ગુરુભક્તિ હોવા છતાં ન પણ હોય  
પણ ગુરુની પ્રસન્નતામાં તું નિમિત્ત બનતો હોય  
અને એ પછી ય સમ્યક શ્રુતનું સ્વામિત્વ તારી  
પાસે ન આવે એ તો સંભવિત જ નથી  
કારણ કે ‘સમ્યક’ ની પ્રાપ્તિ બંધાયેલી છે મોહનીયના ક્ષ્યોપશમને  
અને ગુરુભક્તિ એ મોહનીયને માટે તો  
કાળદૂતનું પ્રતિનિધિત્વ જ ધરાવે છે.  
શીધ તું મુક્તિમાં જવા માગે છે ને ?  
તો ‘સમ્યક’ ને તારા જીવનનું લક્ષ્ય બનાવી દે.  
અને એ ‘સમ્યક’ ગુરુની પ્રસન્નતાને બંધાયેલું છે  
એ સત્યની તારા રોમરોમમાં તું પ્રતિષ્ઠા કરી દે.  
યાદ રાખજો, જમાલિ પાસે ૧૧ અંગનું વિપુલ શ્રુત જરૂર હતું  
પણ સમ્યક શ્રુત તો સામાયિકના અર્થની પણ  
જેમની પાસે જાળકારી નહોતી એ માસ્તુષ મુનિ પાસે જ હતું.  
શું થયું એ બંનેનું એનો તને ઘ્યાલ જ હશે.  
ચાલ્યો આવ, માસ્તુષના માર્ગ. મોક્ષ તારો હાથવેંતમાં જ છે !

## સુબહ્રમપિ શ્રુતમધીતં ચરણવિપ્રહીણસ્ય નિશ્ચયતો અજ્ઞાનમેવ ।

— ગા. ૧૧૫૨

ભોજન હાજર છે, ભોજનનાં દ્રવ્યોના ગુણધર્મની બરાબર જાણકારી છે  
અને છતાં માણસ જો ભોજનનાં એ દ્રવ્યોને આરોગતો નથી તો  
એની પાછળનાં મુખ્ય કારણો ચાર હોઈ શકે.

માણસનું પેટ ભરેલું હોય,  
માણસની ભૂખ મરી ગઈ હોય,  
માણસની હોજરી નરમ હોય અથવા તો માણસ ગાંડો હોય.  
મુનિ !

તારી પાસે આગમોનો બોધ સરસ છે ને ?

હજારો શ્લોકો તને કંઠસ્થ છે ને ?

તારી વિદ્વતાથી સહુ આશ્રયચક્તિ છે ને ?

જવાબ આપ તું.

તારા જીવનમાં એનું આચરણ કેટલું છે ?

પાપ-પ્રમાણના ત્યાગનો તારો પુરુષાર્થ કેવો છે ?

સદ્ગ આચરણક્ષેત્રે સત્ત્વ ફોરવતા રહેવાની તારી તેયારી કેવી છે ?

તું કેવળજ્ઞાન નથી પામી ચૂક્યો એની અમને ખબર છે.

પ્રત-નિયમોના સ્વીકાર માટેનું સત્ત્વ તારી પાસે

સાંદું એવું છે એની ય અમને ખબર છે.

સદ્ગ આચરણની જ જ્યાં બોલબાલા હોય એ

સંયમજીવનનો તું સ્વામી છે એની ય અમને ખબર છે

અને છતાં તું જે કાંઈ ભાડ્યો છે,

કર્મબંધનાં અને કર્મક્ષયનાં કારણોની તારી પાસે જે કાંઈ જાણકારી છે

એ જાણકારીને ઉચિત તારા જીવનમાં જો આચરણ નથી તો

અમારે તને એટલું જ કહેવું છે કે  
તારું જ્ઞાન એ જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે.  
લોહી બનાવી શકતી બદામ તારી સામે જ પડી છે,  
તારા શરીરમાં લોહી ઓછું છે  
અને છતાં તું બદામ ખાવાની બાબતમાં ગત્તવાં-તત્ત્વવાં કરે છે.  
આનો અર્થ તો એટલો જ ને કાં તો તને બદામની  
તાકાતની જાણકારી નથી  
અને કાં તો લોહીની અલ્યુતાની ભયકરતા તારા જ્યાલમાં નથી.  
જનમ-મરણની પરંપરા પર પૂર્ણવિરામ મૂકી  
દેવાની આગવી તાકાત ધરાવતું સમ્યક્ શુત  
તારી પાસે ઉપલબ્ધ છે.  
તારા એક એક આત્મપ્રદેશ પર અનંત અનંત  
કર્મજ્ઞ વર્ગજ્ઞાઓ ચોટેલી છે  
અને છતાં તું સદ્ગ આચારોથી હીન જીવન જીવી રહ્યો છે તો  
એનો અર્થ તો એટલો જ ને કે  
કાં તો તને શુતાધ્યયનમાં પડેલ અનંત અનંત  
કર્માનો સફાયો બોલાવી દેવાની પ્રયંક ક્ષમતા પર  
શ્રદ્ધા નથી અને કાં તો  
આત્માના ચાલુ રહેલા ભવભ્રમજ્ઞાની ખતરનાકતા તને સમજાઈ નથી.  
એ સિવાય આવી ભૂલ તું કરી જ શી રીતે શકે ?  
મુનિ !

થોડોક ડાહ્યો થા.  
સત્ત્વશીલ થા. સ્વચ્છંદમતિથી મનને અને  
સુખશીલવૃત્તિથી શરીરને થોડુંક મુક્ત કરતો જા.  
પ્રભુનાં જે પણ વચ્ચનોને તેં કંઠસ્થ કર્યા છે એ તમામ વચ્ચનોને  
આચરણમાં ઉતારીને એ વચ્ચનોને તું  
'જ્ઞાનરૂપ' પુરવાર કરતો જા. બાકી,  
'અમૃત પીધું' પણ અમર ન થયા, પીવાની રીત ના જાણી !  
કાં પેટમાં ગયું નહીં ને, કાં ગયું તે પાણી' આવું  
તારા અધ્યયન માટે ન બને એનું ખાસ ધ્યાન રાખજો.

**ચક્રવર્તિપદલાભાદિક પુણ્યફળં નિશ્વયતો દુઃખમેવ,  
કર્મદયજન્યત્વાત्, નરકત્વાદિપાપફળવત् ।**  
**વિશેષાવશ્યક ભાષ્ય**  
**- ગા. ૨૦૦૪**

તૃણ ધીપાવવા સરબત મળે પણ  
 એ સરબત આપનાર જો દુશ્મન હોય  
 તો માણસ એ સરબત પેટમાં પદ્ધરાવતા પહેલાં  
 લાખ વાર વિચાર કરે જ ને ?  
 મુનિ !  
 જવાબ આપ તું.  
 જગત જેને પણ ‘સુખ’ માને છે એ  
 રૂપવતી સ્ત્રી, વિપુલ સંપત્તિ,  
 પ્રચંડ સત્તા, આકર્ષક રૂપ,  
 કોકિલ કંઠ,  
 ધારદાર વક્તૃત્વ વગેરે સુખો પ્રત્યે તારા મનમાં ઘ્યાલ કર્યો ?  
 એ તમામ પ્રત્યે તારા મનમાં કૂણી લાગણી કે  
 વિકારની લાગણી ?  
 એ તમામ પ્રત્યે તારા મનમાં આદરભાવ કે  
 નફરતનો ભાવ ?  
 આ પ્રશ્ન અમારે તને એટલા માટે પૂછ્યો પડે છે કે  
 આ સંસારમાં થઈ રહેલ તારી રખડપણી એક જ પરિબળને આભારી છે  
 અને એ પરિબળનું નામ છે ‘કર્મસત્તા.’  
 એણે તને માત્ર દુઃખો જ નથી આપ્યા, સુખો પણ આપ્યા છે.  
 એણે તને માત્ર નરકાદિ દુર્ગતિઓનો મહેમાન જ નથી બનાવ્યો,  
 સ્વર્ગાદિ સુખો પણ તને એણે જ આપ્યા છે.  
 એણે તારા મુખ પર માત્ર વેદના જ નથી મીકી,

હાસ્ય પણ તારા મુખ પર એણે જ પ્રગતાવ્યું છે.  
 અને કરુણતાની વાત એ છે કે  
 એની આ ચાલબાળાં જ તને પરમાત્મા બનતો રોક્યો છે.  
 સદ્ગુણોના સૌંદર્યની મજા એણે જ તને માણવા દીધી નથી.  
 સમાધિના અને સમતાના શ્રેષ્ઠતમ સુખથી  
 એણે જ તને વંચિત રાખી દીધો છે.  
 ચાલાક રાજા દુશ્મન રાજા તરફથી અપાતા ઐરને તો  
 પેટમાં નથી જ પદ્ધરાવતો પણ  
 સરબતને ય પોતાના પેટમાં પદ્ધરાવતા  
 લાખ વાર વિચાર કરે છે.  
 અમારે તને એટલું જ યાદ કરાવવું છે કે  
 દુઃખ તને નાપસંદ  
 કારણ કે એ કર્મસત્તા તરફથી તને મળેલી આણગમતી ભેટ છે તો  
 સુખ પણ તને એટલું જ નાપસંદ  
 પડવું જોઈએ કારણ કે એ ય  
 કર્મસત્તા તરફથી જ તને મળેલી ભેટ છે.  
 ભલે એ ભેટ તારા માટે કદાચ મનગમતી છે.  
 પણ એનું મૂળ પોત તો ખતરનાક જ છે.  
 શું કહીએ અમે તને ?  
 જે પણ પરિબળો તારા આત્માને શાશ્વતસ્થાનથી અને  
 શાશ્વતસુખથી દૂર રાખતા હોય  
 એ તમામ પરિબળો -  
 પછી ચાહે એ દુઃખરૂપ હોય કે સુખરૂપ હોય -  
 તારા આત્મા માટે ભયંકર જ છે.  
 આ વાત તું તારા દિલની દીવાલ પર  
 સુવાણાક્ષરે કોતરી રાખજે.  
 પ્રશ્ન દુઃખથી દૂર રહેવાનો કે દુઃખથી બચતા રહેવાનો નથી.  
 પ્રશ્ન સુખથી દૂર રહેવાનો અને સુખથી બચતા રહેવાનો છે.  
 એ બાબતમાં તું સ્પષ્ટ અને સાવધ થઈ ગયો કે  
 મુક્તિસુખનો તું અધિકારી બની ગયો જ સમજ.

## અણુવસંતેણ દુકકરં દમસાગરો તરિઝં

– ઉત્તરાધ્યયન

વજનદાર પથ્થરને હાથમાં રાખીને  
પર્વતના શિખર પર પહોંચી જવામાં  
સફળતા મેળવવાનું શક્ય જ ક્યાં છે ?  
બૂટ કે ચંપલ પહેર્યા વિના ખુલ્લા પગે  
કાંટાઓથી વ્યાપ એવા જંગલના રસે  
સહીસલામત ચાલતા રહીને  
જંગલ પસાર કરી દેવામાં સફળ બનવાનું શક્ય જ ક્યાં છે ?  
**‘મુનિ !**  
તું ઈન્દ્રિયોનો આ મહાસાગર તરી જવા માગે છે ને ?  
અમે તને એટલું જ પૂછીએ છીએ કે  
તું ઉપશાંત છે ખરો ?  
ચિત્તની સ્થિરતા તારી અકબંધ છે ખરી ?  
મનની સ્વસ્થતા તારે હાથવગી છે ખરી ?  
જો ના, જો તું અનુપશાંત છે.  
આવેશના, અહંકારના અને  
આક્રમકતાના હુમલાઓ જો તારા મન પર  
અવારનવાર થતા જ રહે છે,  
અપેક્ષાભંગમાં કે સ્વાર્થભંગમાં નિમિત્ત બનનાર  
વ્યક્તિઓ પ્રત્યેના દુભર્વિથી તારું અંત:કરણ  
જો વ્યાપ રહ્યા જ કરે છે તો અમે તને કહીએ છીએ કે  
તારા માટે આ ઈન્દ્રિયોનો, ઈન્દ્રિયોના વિષયોનો,  
વિષયો પ્રત્યેના મનના આકર્ષણો મહાસાગર

તરી જવો સર્વથા અશક્ય છે.

કારણ ?

અનુપશાંતતા આખરે તો કષાયનું જ સ્વરૂપ છે ને ?

અને જ્યાં કષાયભાવ છે ત્યાં કર્મબંધ ચાલુ છે.

અને જ્યાં કર્મબંધ ચાલુ છે

ત્યાં સંસાર અકબંધ છે.

એક વાત ખાસ યાદ રાખજે તું કે

જે રાતે ચન્દ્ર વધતો નથી એ રાતે ચન્દ્ર ઘટીને જ રહે છે.

એ હકીકત જો ચન્દ્ર માટે છે

તો એ જ હકીકત મન માટે છે.

મન જ્યારે આત્માના પક્ષમાં નથી હોતું,

આત્મહિતની વિચારણામાં વ્યસ્ત નથી હોતું,

આત્મસ્વરૂપના ચિંતનમાં લીન નથી હોતું

ત્યારે અનિવાર્યરૂપે એ શરીરના પક્ષમાં હોય છે.

ઈન્દ્રિયોના વિષયોમાં એ લીન હોય છે.

ઈન્દ્રિયોના વિષયોની કલ્પનામાં એ વ્યસ્ત હોય છે.

આનો તાત્પર્યથી તને સમજાય છે ?

ઉપશાંતભાવ એ આત્માનો ગુણ છે.

જો એના ઉપયોગમાં રહેવાને બદલે તું અનુપશાંત છે

તો એનો અર્થ એટલો જ છે કે

તારું મન બહિર્ભાવોમાં રમી રહ્યું છે.

બસ, આ બહિર્ભાવોની રમણતા જ તને

સંસારમાં રાખવા માટે

અને રખડાવવા માટે

વાવાજોડાના પવનની ગરજ સારતી રહેવાની છે.

**‘ઉવસમસારો ખુ સામળણ’**

‘ઉપશમભાવ એ જ શ્રમણજીવનનો સાર છે’

આ પંક્તિ તારા વાંચવામાં અનેકવાર આવી જ છે ને ?

તો પછી હવે એ ઉપશમભાવને આત્મસાતુ કરી

લેવામાં તું રાહ કોની જોઈ રહ્યો છે ?

## અમિણવપાવિએ ગુણે, અણાઇભવસંગએ અ અગુણે ।

– પંચસૂત્ર - ૨

તાજું જ જન્મેલું બાળક.

એને જો તમારે જીવતું રાખવું છે

તો કેટકેટલી સાવધગીરી તમારે દાખવવી પડે ?

ભૂખ એને લાગે.

સંડાસ એને જવું હોય, પડખું એને ફેરવવું હોય,

તરસ એને લાગી હોય, સ્તનપાન એને કરવું હોય, પેટ એનું દુઃખતું હોય.

એની તમામ પ્રકારની જરૂરિયાતો અને

તમામ પ્રકારની સુરક્ષાઓ તમારે જ પૂરી પાડવી પડે.

બસ, મુનિ !

કોઈ પણ ગુણ ભલે આજે તારી પાસે ભલે કદાચ વરસોથી છે

છતાં તું ધાદ રાખજે કે

એ ગુણનું પોત જન્મજાત બાળકનું જ છે.

જો એ ગુણને તું જિવાડવા માગે છે

તો એ અંગેની તમામ સાવધગીરી તારે જ દાખવવી પડવાની છે.

બાળકને જિવાડવા જો મમ્મીએ જ સાવધગીરી દાખવવી પડે છે તો

ગુણને જીવાડવા સાધકે જ સાવધગીરી દાખવવી પડે છે.

આ સાવધગીરી બે સ્તરે દાખવવાની છે.

બાળકને મમ્મી દૂધથી પુષ્ટ કરતી રહે છે

અને માટીથી દૂર રાખતી રહે છે.

મંદિરનો પૂજારી દીપકમાં તેલ પૂરતો રહે છે

અને પવનથી એને બચાવતો રહે છે.

બસ, એ જ ન્યાયે ગુણોને તારે સદ્ગુણિતોથી પુષ્ટ કરતા રહેવાના છે

અને કુનિમિત્તોથી દૂર રાખતા રહેવાના છે.

અને તો જ ગુણોને જિવાડવામાં તને સફળતા મળવાની છે.

પણ સબૂર !

દોષની બાબતમાં આખી વાસ્તવિકતા જુદી છે.

એનું મૂળ પોત તો અંધકારનું છે.

કંટકનું છે.

વિષાનું છે.

રોગનું છે.

આમાંના એકને પણ જિવાડવા કોઈને ય કયાં કાંઈ કરવું પડે છે ?

એ બધાય સ્વયં સુરક્ષિત છે.

બસ, દોષ ચાહે વાસનાનો હોય કે કખાયનો હોય,

સુખશીલવૃત્તિનો હોય કે સ્વચ્છંદમતિનો હોય,

પાપનો હોય કે પ્રમાદનો હોય,

એ તમામનો સંગ તારો આજનો નથી, અનાદિકાળનો છે.

એક એક ગતિના એક એક ભવમાં

એ તમામ દોષો પ્રગટ-અપ્રગટરૂપે તારી સાથે રહ્યા છે.

માત્ર સાથે જ રહ્યા છે એવું નથી.

એ તમામ દોષો તને ખૂબ ગમ્યા પણ છે.

તારી તમામ તાકાતથી એ તમામને તેં તગડેબાજ બનાવ્યા છે.

સંયમના આ ટૂકુ જીવનમાં એ તમામનો

તું જો સફાયો બોલાવવા માગે છે તો

કલ્પના કરી જોજે કે એ માટે તારે પુરુષાર્થ કેવો જંગી કરવો પડશે !

એ માટે તારે દોષો પ્રત્યેનો નફરતભાવ

કેવો જાલિમ કેળવવો પડશે ?

એ માટે તારે અનાદિના અવળા સંસ્કારો સામે

બળવો કેવો પોકારવો પડશે ?

ટૂકમાં, ગુણપક્ષપાત અને દોષતિરસ્કાર,

આ બંને ભાવોને પરાકાણ્યાએ લઈ ગયા વિના તું ગુણને

જિવાડી શકે કે દોષોને ખતમ કરી શકે એવી કોઈ જ શક્યતા

નથી આ સત્ય તારા દિલની દીવાલ પર કોતરી જ રાખજે.

## અનુમોદે ઇતિ હર્ષ ગોચરતાં પ્રાપયામि

— પંચસૂત્ર

કોધને તમે જોઈ શકશો.

કઠોર શબ્દોદ્યારણ, આકોશસભર હાવભાવ,  
તનાવસભર મુખમુદ્રા, વિદ્વંસાત્મક પ્રવૃત્તિઓ.  
બસ, આ તમામનાં દર્શને તમે અનુમાન કરી શકશો  
કે અતે કોઈ હાજર છે.

અભિમાનની ઉપસ્થિતિને પકડી પાડતા  
તમને પળની ય વાર નહીં લાગે.

ભારેખમ ચહેરો, વજનદાર શબ્દો.  
'હું' શબ્દનો વારંવાર અને ભરપૂર પ્રયોગ.

બસ, છાતી ઠોકીને તમે કહી શકશો કે  
અભિમાન અહીં હાજર છે

પરંતુ દંભની ઉપસ્થિતિને પકડી પાડવામાં તમને  
સફળતા લગભગ નહીં મળે.

કારણ કે એનું પોત તો ગટર પરના ઢાંકણા જેવું છે.  
ઢાંકણાંને જોઈને તમે અનુમાન કરી શકો ખરા કે

આ ઢાંકણાંની નીચે માથું ફાડી નાખે એવી  
દુર્ગંધને સંધરીને એક ગટર બેઠી છે ?

દંભનું પોત તો ગાદલા પરની ચાદર જેવું છે.  
એકદમ ઉજ્જવળ ચાદર જોઈને તમે અનુમાન કરી શકો ખરા કે

આ ઉજ્જવળ ચાદર પોતાની નીચે એક ગંધું ગાદલું લઈને બેઠી છે !  
મુનિ !

જ્યાં ક્યાંય પણ સુકૃતનું સેવન થાય છે અને એના સમાચાર તારા કાને

આવે છે ત્યારે તારા મોઢામાંથી શબ્દો નીકળી જાય છે ને  
કે એના સુકૃતની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું.

પણ સબૂર !

અનુમોદનાનો સાચો અર્થ તારા જ્યાલમાં છે ખરો ?

અનુમોદનાનો સાચો અર્થ છે

સામાના સુકૃતને જોતા-સાંભળતા તારું ચિત્ત અત્યંત હર્ષને પામે.  
તારું હૈયું આનંદવિભોર બની જાય.

તારું મન પ્રસન્ન પ્રસન્ન બની જાય.

આમાં દંભને કોઈ અવકાશ જ ક્યાં છે ?

ચાર જણને સારું લગડવા શબ્દોના સાથ્યા  
પૂરતા રહેવાની વાત જ ક્યાં છે ?

તારી ખુદની ગુડવિલ વધારતા રહેવા  
મીહું મીહું બોલતા રહેવાની વાત જ ક્યાં છે ?

યાદ રાખજો, સુકૃત પ્રત્યેના પક્ષપાત વિના,  
સુકૃત પ્રત્યેની આંતરિક રૂચિ વિના,  
સુકૃત સેવનની ગરજ ઊભી થઈ ગયા વિના

સુકૃતની અનુમોદનાના સ્વામી બની શકાય એવી કોઈ જ શક્યતા નથી.  
અને તારા જ્યાલમાં ન હોય તો તને જણાવી દઈએ કે

તથાભવ્યત્વના પરિપાક માટેનાં જે ત્રણ સાધન છે  
એમાંનું એક મહાત્વનું સાધન છે સુકૃતની અનુમોદના.

તારી મુક્તિગમનની યોગ્યતાને પક્ષી દેવાની  
તાકાત જે 'અનુમોદના' ના યોગમાં પડી હશે

એ અનુમોદનાનો યોગ કેટલો બધો મહાન હશે  
અને દુર્લભ હશે એનું અનુમાન તું આના પરથી કદાચ કરી શકીશા.

ભૂલીશ નહીં આ વાત કે

સંપત્તિ પ્રયેની રૂચિ ગૃહસ્થના મનમાં અન્ય શ્રીમંત  
પ્રત્યે ઈર્ધ્યા જગાવવાનું કામ ભલે કરતી હશે પરંતુ

સુકૃત પ્રત્યેની રૂચિ તો સાધકના મનમાં અન્ય જીવોના  
સુકૃત સેવનદર્શને અંતરમાં અનુમોદનાનો ભાવ જ પેદા કરતી હોય છે.

આવા 'સાધક'માં તારો નંબર ખરો કે નહીં ?

## ગુરુપરિવાસો ગચ્છ: તત્ત્વ વસ્તાં વિપુલા નિર્જરા ।

— સ્થાનાંગસૂત્ર ૫/૩

માછલાં સાથે આપણી મુલાકાત ભલે થઈ નથી પણ  
વગર મુલાકાતે ય એના માટે આપણે કહી શકીએ કે  
એની સલામતી પણ સાગરમાં,  
એની સમાધિ પણ સાગરમાં અને  
એની મસ્તી પણ સાગરમાં.  
સાગરથી એ અલગ થઈ નથી અને  
એની સલામતી પર ખતરો તોળાયો નથી.  
એની સમાધિ ખંડિત થઈ નથી.  
એની મસ્તીમાં ગરબડ ઊભી થઈ નથી.  
મુનિ !  
તારા મનને તો તું જાણો છે ને ?  
શ્રદ્ધાના ક્ષેત્રે એ કાચું છે તો સત્ત્વના ક્ષેત્રે એ માંદું છે.  
પ્રલોભન આગળ એ જૂકેલું છે તો પ્રતિકૂળના આગળ એ તૂટેલું છે.  
સુધુશીલતા એની નબળી કરી છે તો સ્વરચ્છંદતા એની ગમતી કરી છે.  
આવી સંઘ્યાબંધ નબળાઈઓ લઈને બેઠેલા  
મન સાથે તારે તારા સંયમજીવનની પવિત્રતા ટકાવી રાખવાની છે.  
સાચે જ તું એ બાબતમાં જો સફળ થવા માગે છે  
તો એનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે.  
ગુરુકુલવાસ.  
ગરછવાસ.  
એકદમ સહજરૂપે તું બ્રહ્મયર્થનું પાલન ત્યાં કરી શકીશ.  
તપ અને ત્યાગના આવતા પ્રસંગોમાં તું ત્યાં

સહજરૂપે આગળ વધી શકીશ.  
મનને સંકલ્પ-વિકલ્પોથી ગ્રસિત થવું અટકાવવામાં  
તને ત્યાં સફળતા મળશે.  
શરમે-ધરમે પણ સ્વાધ્યાયાદિ યોગોમાં  
તું ત્યાં જોડાયેલો રહીશ.  
સર્વકર્મના ક્ષયના તારા એક માત્ર લક્ષ્યની  
નજીક પહોંચાડનારી વિપુલ કર્મનિર્જરા તું ત્યાં કરી શકીશ.  
અલબત્ત,  
સાગરમાં રહેતી માછલીને,  
અન્ય માછલીઓ તરફથી અગવડો જેમ  
વેઠવી જ પડતી હોય છે તેમ  
ગર્ભવાસમાં રહેતા મુનિને  
ગર્ભના અન્ય સાધુઓ તરફથી  
તકલીફો વેઠવી જ પડતી હોય છે  
એનો અમને બરાબર ઘ્યાલ છે.  
અને તો ય અમારે તને એટલું જ કહેવું છે કે  
સાગરથી અલગ થઈ જતી માછલી  
માત્ર મૃત્યુના શરણે જ જતી હોય છે  
જ્યારે ગુરુકુલવાસથી  
અલગ થઈ જતો સાધુ તો  
દુર્ગતિઓની અનંતકાળની યાત્રાએ નીકળી જતો હોય છે.  
ના, આ દુર્સાહસ તું જિંદગીમાં ક્યારેય કરીશ નહીં.  
અપમાન,  
અગવડ,  
ઉકળાટ, જે કાંઈ પણ વેઠવું પડે  
એ બધું વેઠી લઈને પણ  
તું રહેજે તો ગુરુકુલવાસમાં જ.  
અનંત સિદ્ધ ભગવંતોના  
સાધર્મિક બની જવાનું તાદું સોણાલું  
શીધાતિશીધ સફળ બનીને જ રહેશે.

## સંસારસુખાનિ હિ દુઃખપ્રતીકારમાત્રત્વાત् સુખાભિમાનજનકત્વાચ્ચ ન સુખં ભવતિ ।

– સ્થાનાંગસૂત્ર ૧૦/૩

દવા આખરે છે શું ?  
રોગનો પ્રતીકાર !  
ગાડી આખરે છે શું ?  
થાકનો પ્રતીકાર !  
સંપત્તિ આખરે છે શું ?  
લોભનો પ્રતીકાર !  
પત્ની આખરે છે શું ?  
વાસનાનો પ્રતીકાર !  
સત્તા આખરે છે શું ?  
લઘુતાગ્રંથિનો પ્રતીકાર !  
મનોરંજન આખરે છે શું ?  
એકલવાયાપણાંનો પ્રતીકાર !  
મુનિ ! સંસારનાં જે પણ સુખો છે  
એ બધાંયની એક જ ઓળખ છે દુઃખ પ્રતીકાર !  
દુઃખ વિનાનું સુખ તો એક માત્ર કર્મમુક્ત અવસ્થામાં જ છે.  
એ કર્મમુક્ત અવસ્થા કષાયમુક્ત જીવનવ્યવસ્થાને બંધાયેલી છે  
અને એ કષાયમુક્ત જીવનવ્યવસ્થા  
અપેક્ષામુક્ત મનોવૃત્તિને બંધાયેલી છે.  
મુનિજીવન પાભ્યા પછી ય તું જો ઉદ્ઘનતાનો કે અપ્રસન્નતાનો શિકાર  
બન્યો રહેતો હોય તો એનું એક માત્ર કારણ આ જ હશે.  
પરની અપેક્ષા. પરની સ્પૂદા.  
શું કહીએ અમે તને ?

ધર્માસ્તિકાયાદિ તમામ દવ્યોની અનેક વિશેષતાઓમાંની  
એક વિશેષતા એ છે કે એ તમામ દવ્યો સ્વતંત્ર છે.  
અર્થાત્ એક દવ્યનો બીજા દવ્યમાં પ્રવેશ નથી.  
અમે તને એટલું જ પૂછીએ છીએ કે  
પુદ્ગલના સહારે સુખનો અનુભવ સંસાર પરિભ્રમણના  
અનંતકાળમાં તે અનંતવાર કર્યો છે ને ?  
ઇતાં એક પણ પુદ્ગલ દવ્ય આજે તારું બની શક્યું છે ખરું ?  
તું પોતે પુદ્ગલ દવ્યનો બની શક્યો છે ખરો ?  
ના.  
તેથી વરસો સુધી ભલેને પડજું રહે છે પાણીમાં.  
એ બંને ક્યારેય એકરૂપ થતા જ નથી.  
બસ, એ જ ન્યાયે આત્મા અને પુદ્ગલ, બંને ભલેને અનંતકાળથી  
એક બીજાને વળગીને રહ્યા છે.  
નથી આત્મા પુદ્ગલને પોતાનું બનાવી શક્યો કે  
નથી પુદ્ગલ આત્માને પોતાનો બનાવી શક્યું !  
જો વાસ્તવિકતા આ જ છે અને શાશ્વતકાળ સુધી આ જ રહેવાની છે તો  
અમારી તને ખાસ સલાહ છે કે તું થોડોક શાંત થા.  
તારા મનને ઉત્તેજનામુક્ત બનાવતો જા.  
કાળા બોર્ડ પર વંચાતા સફેદ અક્ષરોની ચમક  
એ હકીકતમાં જેમ બોર્ડની કાળાશને આભારી હોય છે  
તેમ સંસારના કહેવાતા તમામ પ્રકારનાં સુખોના  
અનુભવો એ હકીકતમાં તો  
તારા મનની અતૃપ્તિના કે અસંતોષના દુઃખને જ આભારી છે.  
આ સત્ય તને શીધ્ય સમજાઈ જાય એમાં જ તારા આત્માનું હિત છે.  
એક અન્ય વાત !  
પુષ્ટ દવાઓનું સેવન કરનારો જો એ બદલ અભિમાન નથી જ કરતો તો  
ઈન્દ્રિય-મનના માધ્યમે સુખનો અનુભવ કરવા માટે  
જેને સંસારની સંખ્યાબંધ સામગ્રીઓ વસાવવી પડે છે  
અને ભોગવવી પડે છે એને ય એ બદલ અભિમાન  
કરવાની કોઈ જરૂર નથી એ વાત સતત આંખ સામે જ રાખજે !

## સ્વસામર્થ્યતः શુભે પ્રવૃત્તિરેવ તીર્થકૃતાં વિષયે બહુમાનલિઙ્ગમ् ।

– યોગવિશિકા ૩૦. ૬

સ્વ-શક્ત્યનુસાર જો હું જ્ઞાનદાન કરું છું,  
જીવોને અભ્યદાન આપું છું,  
પાત્ર જીવોને સમાધિદાન કરું છું,  
પ્રત-નિયમોનું પાલન કરું છું,  
તપ-ત્યાગના માર્ગે આગળ વધતો રહું છું,  
અનિત્યાદિ બાર અને મૈત્રાદિ ચાર ભાવનાઓથી  
ચિત્તને ભાવિત કરતો રહું છું,  
સમિતિ-ગુપ્તિના પાલન માટે સાવધ રહું છું,  
સ્વાધ્યાધિમાં લીન રહું છું તો  
હું સાચે જ પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ ધરાવું છું  
જ્યારથી આ શાસ્ત્રવચન વાંચવામાં આવ્યું છે  
ત્યારથી મનમાં એક અલગ પ્રકારની જ વિચારણા ચાલુ થઈ ગઈ છે.  
સૂર્યને સ્પર્શવાનું માધ્યમ જો સૂર્યનાં કિરણો જ છે,  
ચાંદનીના માધ્યમે જ જો ચન્દ્રને સ્પર્શી શકાય છે તો  
સ્વ-શક્ત્યનુસાર શુભ પ્રવૃત્તિ કરવા રહેવાથી જ  
પ્રભુને સ્પર્શી શકાય છે.  
‘મુનિ !  
તાત્પર્યથી આનો સમજાય છે તને ?  
વિહરમાન તીર્થકર ભગવંતોના દર્શનનું કે  
એમના સાંનિધ્યમાં રહેવાનું સદ્ગ્રાહ્ય તને નથી સાંપર્કયું એ બદલ તારે  
લેશ પણ વ્યથા અનુભવતા રહેવાની કે  
જ્ઞાનિ અનુભવતા રહેવાની જરૂર નથી.

જો તું એમની આજ્ઞાનુસાર સ્વજીવનમાં  
સાધના-આરાધના-ઉપાસના કરી જ રહ્યો છે  
તો તું એ તારકના પાવન સાંનિધ્યમાં જ છે એમ સમજ લેજે.  
અને આનાથી વિપરીત.  
માની લે કે વિહરમાન તીર્થકર ભગવંતના દર્શનનું કે  
એમના પાવન સાંનિધ્યમાં રહેવાનું સદ્ગ્રાહ્ય જ  
તને સાંપર્કયું છે પણ તારા જીવનમાં જો એમની આજ્ઞાઓનું  
શક્તિ છતાં પાલન નથી,  
થઈ રહેલ આજ્ઞાભંગ બદલ કોઈ ઉખ પણ નથી કે વેદના પણ નથી  
તો નિશ્ચિત સમજ રાખજે કે  
તને તીર્થકર ભગવંત પ્રત્યે બહુમાનભાવ જ નથી.  
યાદ રાખજે તું.  
માત્ર એમનું નામસ્મરણ જ કરતા રહેવું કે  
એમનામાં રહેલ ગુણોનું માત્ર કીર્તન જ કરતા રહેવું  
એ કાંઈ એમના પ્રત્યેના બહુમાનભાવનું લિંગ નથી.  
એમના પ્રત્યેના બહુમાનભાવનું આ એક જ લિંગ છે.  
સ્વશક્ત્યનુસાર શુભમાં પ્રવૃત્તિ.  
વાંચી તો છે ને તેં આ પંડિતાઓ ?  
‘પાચ્યા, પામે, પામશે રે, જે કોઈ જ્ઞાનાદિ અનંત;  
તે તુજ આશ લહે થકે રે, માનવિજ્ય ઉત્ત્વસંત’  
વાસ્તવિકતા સ્પષ્ટ છે.  
પિતાજીની આજ્ઞાનું ઉલાણિયું કરતા પુત્રને  
પિતાજી પોતાની સાથેના એના  
પુત્ર તરીકેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીઘાની જાહેરાત જો કરીને જ રહે છે  
તો પ્રભુની આજ્ઞાનું ઉત્ત્વલંઘન કરી રહેલ સાધક,  
પ્રભુ ખુદ જાહેરાત ન પણ કરે તો ય  
આપોઆપ એમની આજ્ઞાની બહાર થઈ જ જાય છે.  
તારા લમણે આવું દુર્ભાગ્ય  
માત્ર આ જીવનમાં જ નહીં, કોઈ પણ જીવનમાં ન  
જીકાય એનું ધ્યાન રાખવાની અમે તને ભલામણ કરીએ છીએ.

**ઉડ્યનસમયે પક્ષી પ્રાયશ પક્ષાતિરેકેણ ન કિઞ્ચદ  
ધારયતિ, તથૈવ સાધોરપિ ધર્મોપકરણાતિરેકેણ  
વસ્તુનોડગ્રહણમ् ।**

— યોગવિશિકા - ૧૩

પક્ષીને ઉડવું છે ધરતી પરથી આકાશ તરફ  
અને એ માટે એને સહારો લેવાનો છે પાંખનો.  
પાંખ પર એ કોઈ પણ પ્રકારનું વજન રાખવા તૈયાર થશે બંધું ?  
હરગિજ નહીં.  
અરે, એનું ચાલે તો એ પાંખનું વજન લેવા પણ તૈયાર ન થાય પણ  
એની પાસે પાંખનો સહારો લેવા સિવાય બીજો કોઈ  
વિકલ્ય જ ન હોવાથી પાંખને તો એ સાથે રાખશે  
જ પણ પાંખ સિવાય તો  
બીજા કોઈને ય એ સાથે નહીં રાખે.  
બીજું કાંઈ પણ એ સાથે નહીં રાખે.  
કારણ ?  
ધરતી વજનને પોતાના તરફ બેંચતી રહે છે જ્યારે  
પક્ષીને ધરતીની વિરુદ્ધ આસમાનની દિશામાં જવું છે.  
વજન સાથે રાખવાનું એને ન જ પરવડે એ બિલકુલ સમજાય તેવી વાત છે.  
મુનિ !  
તું તારા આત્મદ્વયને બેધ્યાભી બનાવવા માગે છે ને ?  
અનંત અનંત કાળથી સંસારના ચારગતિરૂપ જે ક્ષેત્રમાં  
તું બટકી રહ્યો છે એ ક્ષેત્રથી કાયમી છુટકારો  
પામીને તું સિદ્ધશિલામાં પહોંચી જવા માગે છે ને ?  
સમયના સર્કંજામાં રહેલ તારા આત્મદ્વય પર  
સમયની કોઈ જ અસર ન રહે એ સ્તરે તું સમયાતીત બની જવા માગે છે ને ?  
ઔદ્ઘિકભાવ અને ક્ષયોપશમભાવથી મુક્ત બનીને તું

ક્ષાયિકભાવને તારી મૂરી બનાવી દેવા માગે છે ને ?  
તારા આ તમામ પ્રશ્નોનું એક જ સમાધાન છે.  
તું વજન ઘટાડતો જા.  
અલબત્ત, અહીં શરીરના વજનને ઘટાડવાની વાત નથી.  
વાત છે મનના વજનને ઘટાડતા રહેવાની.  
સ્નેહ એ છે મનનું વજન.  
મૂર્ખજી એ છે મનનું વજન.  
પરસ્પૃષ્ઠા એ છે મનનું વજન.  
મનના આ અને આના જેવા જ અન્ય  
આસકિત, આગ્રહ, અપેક્ષા વગેરેના  
વજનને ઘટાડતા રહેવાની તારી તૈયારી છે ખરી ?  
જો હા, તો તાંતું મુક્તિગમન નિશ્ચિત છે અને  
જો ના, તો તાંતું સંસાર પરિબ્રમજા અસંદિગ્ય છે.  
અલબત્ત, પાંખના સહારા વિના પંખીને જેમ  
આકાશ તરફ ઉડવામાં સફળતા મળતી નથી તેમ  
ધર્મોપકરણના સહારા વિના  
આત્મદ્વયને કર્મમુક્ત બનાવવામાં કોઈ પણ  
સાધકને સફળતા મળતી નથી એનો અમને ખ્યાલ છે  
અને એટલે જ અમે તને કહીએ છીએ કે  
ધર્મોપકરણોને સાધનાજીવનમાં સાથે રાખવાં પડે તો જરૂર રાખજે  
પણ એમાં ય બે બાબતની સાવધાની તો ખાસ રાખજે.  
એક : જરૂરિયાત કરતો રહ્યું ઉપકરણ રાખીશ નહીં.  
બે : જરૂરિયાતના ઉપકરણ પ્રત્યે ય મૂર્ખજી રાખીશ નહીં.  
આ બે બાબતમાં સાવધ બનીને જો તું  
સાધના કરતો રહ્યો તો ખાતરી સાથે અમે તને  
કહીએ છીએ કે સિદ્ધશિલામાં બિરાજમાન થઈ જવાનું તાંતું નિશ્ચિત જ છે.  
પ્રશ્ન માત્ર સમયનો જ છે.  
સો વાતની એક વાત.  
સંગ્રહનું અને મૂર્ખજીનું વજન ઘટાડી દે.  
કર્માનું વજન કાયમ માટે ઊતરીને જ રહેશે.

## સંયમ પ્રાપ્ય વિષયેષ નિરપેક્ષેણ ભવિતવ્યમ् ।

— ઈન્ડિયપરાજ્યશતક

જીબ !

એના પર ધી મૂકો કે તેલ,  
ચીકાશને પકડી રાખવાનું એના સ્વભાવમાં જ નહીં.

ડામરની સડક !

એના પર લગ્નના વરદોડા નીકળે કે કોકની સ્મશાનયાત્રા નીકળે,  
એની અસર લેવાનું એના સ્વભાવમાં જ નહીં.

ટપાલ પેટી !

એમાં હર્ષના સમાચારો આપતી પત્રિકાઓ હોય કે  
મરસિયાના સમાચારો આપતા કાગળો હોય,  
એની અસરથી એ સર્વથા અલિપ.

બંકનો કંશિયર !

લાખોની રકમના ચેક બંકમાં જમા થાય કે  
લાખોની રકમની બંકમાંથી ઉપાડ થાય, એને કોઈ જ હરભશોક નહીં.

મુનિ !

કબૂલ, તારી પાસે સંયમજીવન છે.  
કબૂલ, શરીર સામે તેં ખુલ્લો સંગ્રામ માડી દીઘો છે.

કબૂલ, કર્માનો સફાયો બોલાવતા રહેવાનું એક માત્ર લક્ષ્ય તેં નક્કી કરી દીધું છે  
તો પણ અમે તને કહીએ છીએ કે વિષયો વિના સર્વથા તો  
તારે ચાલવાનું નથી જ.

શરીરના માધ્યમે તારે સાધનાઓ કરવાની છે,

શરીરને ટકાવનારો ખોરાક તારે લેવો જ પડશે.

આંખેથી તારે ઈર્યાસમિતિ પાળવાની છે.

જાતજાતનાં ટશ્યો તારી આંખ સામે આવશે જ.

કાનેથી તારે વાચનાઓ સાંભળવાની છે.

વાચનાઓ સિવાયના બીજા અનેક પ્રકારના શબ્દો સાંભળવાનું તારે રહેશે જ.

વસ્ત્ર-પાત્ર-ઉપવિ વગેરે ઉપકરણોનો ઉપયોગ તારે કરવાનો આવશે જ.

ભલે તેં સ્વજનધૂનન કર્યું છે તો ય અનેક પ્રકારની

વક્તિત્વોના પરિચયમાં તારે આવવાનું બનશે જ.

ચેતવણી તો અમારે તને એ આપવાની છે કે વિષયોનો આ સંપર્ક

તારા રાગ-દ્રેષ્ણને વધારનારો ન બની રહે,

તારા અસંતોષને ભડકાવનારો ન બની રહે,

તારી અતૃપ્તિની અનાદિની આગ માટે

ઈંધણકાર્ય કરનારો ન બની રહે એ અંગે તું ખૂબ સાવધ રહેજે.

મીણને આગનો સંપર્ક થાય અને છતાં એને પીગળવા ન દેવું,

અશ્તુ વસંતની હોય અને છતાં કોયલને ટહુકવા ન દેવી,

પવન વાવાજોડાનો હોય અને છતાં રસ્તા પર પેલી ધૂળને ઊડવા ન દેવી,  
પૂર પ્રલયકાળનું હોય અને છતાં ધાસના તણાખલાંને એમાં તણાવા ન દેવું

એ જેટલું પરાકમ માર્ગ છે, એના કરતા અનેકગણું પરાકમ

વિષયોના સંપર્ક છતાં આત્માને રાગ-દ્રેષ્ણથી

બચાવતા રહેવાનામાં દાખવણું પડે છે

આ વાસ્તવિકતાને તારા સંયમજીવનમાં સતત આંખ સામે રાખજે.

શું કહીએ તને અમે ?

શરીર વિષયોથી ટકે છે, મનને વિષયો ગમે છે અને

આત્મહિતમાં આત્માને વિષયો નડે છે.

કલ્પના કરી જોજે તું.

આત્માને માટે ખતરનાક હોવા છતાં મનને ખૂબ ખૂબ ગમી રહેલા

એ વિષયોથી આત્માને અલિપ રાખવાનું કામ,

નિરપેક્ષ રાખવાનું કામ સાચે જ કેટલું બધું કપું હશે ?

અને છતાં આ કામ તારે કરી જ દેખાડવાનું છે.

સંસાર છોડી જાણ્યો છે તો

વિષયો પ્રત્યેની આસક્તિને તોડી જાણ તો અમે માનીએ

કે તું પ્રભુ વીરનો મર્દ સંયમી છે !

## પુણ્યકર્મણિ પ્રવર્તમાનાનાં પુંસાં બહવો અન્તરાયા ઉત્તિષ્ઠન્તિ

— વૈરાગ્યશતક - ૩

ધાસને ઉગાડવા તમે જાઓ.  
કોઈ જ તકલીફ નહીં આવે.  
પુણ્યને તમે ઉગાડવા જાઓ.  
પાર વિનાની તકલીફો આવશે.  
વિઘ્નાને સાચવવાની મહેનત તમે નહીં કરો તો ય એ સચવાઈ જશે.  
અતારની બોટલને સાચવવા તમારે પુરુષાર્થ કરવો જ પડશે.  
મુનિ !  
તું સત્કાર્યો કરવાનો માત્ર સંકલ્પ કરી છો.  
તપ શરૂ કરવો જ છે.  
સ્વાધ્યાયમાં હવે તો લાગી જ પડવું છે.  
સમિતિ-ગુપ્તિના પાલનમાં હવે તો બેદરકારી નથી જ દાખવવી.  
વિજ્ઞાતીયપાત્રને મનમાં એક પળ માટે ય સ્થાન હવે તો નથી જ આપવું.  
કિયા ચાહે પ્રતિલેખનની હોય કે પ્રતિકમણાની હોય,  
પૂર્ણ અહોભાવ સાથે અને એકાગ્રતા સાથે જ કરવી છે,  
આ સંકલ્પને અમલી બનાવવાનો પુરુષાર્થ તું જેવો શરૂ કરીશ,  
તે નહીં ધાર્યા હોય એવાં વિન્ધો વચ્ચે આવીને ઊભા જ રહેશે.  
કાં તો પ્રતિકૂળ વાતાવરણ ઊભું થઈ જશે.  
કાં તો શરીરમાં કાંક ગરબડ ઊભી થઈ જશે.  
કાં તો સહવર્તિઓ તરફથી તારા પ્રત્યે વિચિત્ર વર્તિવ થશે.  
કદાચ મન ‘મૂડ’ ગુમાવી બેસશે  
અને એમાંનું કદાચ કાંઈ જ નહીં બને તો  
છેવટે તારું મન ચંચળતાનું શિકાર બનીને

તારા અમલી બનતા આરાધનાના સંકલ્પમાં  
તને આનંદનો અનુભવ નહીં થવા દે.  
ટૂંકમાં, ‘સુખના માર્ગમાં અંતરાય કદાચ નથી પણ આવતા  
તો ય હિતનો માર્ગ તો અંતરાય વિનાનો  
નથી જ હોતો’ એ તે સાંભળેલી વાતનો  
તને પ્રત્યક્ષ અનુભવ થવા લાગશે.  
તું કદાચ પૂછી બેસીશ કે એની પાછળ કારણ શું હશે ?  
તો તારા એ પ્રશ્નનો જવાબ એ છે કે  
તારું આત્મદ્રવ્ય સુવર્ણનું પ્રતિનિધિત્વ જરૂર ધરાવે છે પરંતુ  
ખાણમાં પડેલ સુવર્ણને  
શુદ્ધ બનવા માટે જેમ આગ વગેરેમાંથી  
પસાર થવું જ પડે છે તેમ  
કર્મથી મલિન એવા તારા આત્મદ્રવ્યને  
તું જો વિશુદ્ધ બનાવવા માગે છે તો  
કષ્ટોની ગરમી સ્વીકારી લીધા વિના એમાં  
તને સફળતા મળે તેમ જ નથી.  
શું કહીએ અમે તને ?  
ચાકડા પર તૈયાર થયેલ ઘડાને  
જો મજબૂત બનવું છે તો કુંભાર  
એને નિંભાડાની આગમાં નાખીને જ રહે છે.  
કર્મ, કુસંસ્કારો અને  
કખાયોથી મલિન બની ચૂકેલા  
તારા આત્મદ્રવ્યનો તું એ તમામ પ્રકારની  
મલિનતાઓથી જો છુટકારો કરવા માગે છે  
તો પરિસહ-ઉપસર્ગ-સાધનાદિનાં  
કષ્ટોની આગમાં એને નાખવા તારે સંમત થવું જ પડશે.  
અને એક મહત્વની વાત.  
સાધના માર્ગ પીડા વેઠચા પછી જે પુરસ્કાર મળે છે  
એ પુરસ્કાર, વેઠેલી તમામ પીડાઓને સાર્થક કરીને જ રહે છે.  
પુત્રદર્શનનો આનંદ, સ્ત્રીને પ્રસ્તુતિની પીડા ભુલાવી જ દેતો હોય છે ને ?

## નિબિડકર્મણાં હિતોપદેશો મહાદોષો મહાદ્વેષો વા જાયતે તસ્માત् તાન् પ્રતિ મા બહુ બહુ જલ્પત ।

— વૈરાગ્યશતક - ૭૬

જેના શરીરની પ્રકૃતિ જ કફની છે એને તમે ભલેને હળદર આપો.  
એને કફ જ થવાનો છે.  
મનનો અભિગમ જ જેનો નકારાત્મક બની ગયો છે,  
એને તમે ભલેને કાશ્મીરના સૌંદર્યની વચ્ચે લાવીને  
ગોઠવી દો, એનું મન અપ્રસન્ન જ રહેવાનું છે.  
બિલારીને તમે ભલેને રાજસિંહાસન પર બેસાડી દો,  
ગટરમાં ફરી રહેલ ઉંદર દેખાતાંની સાથે જ  
એ રાજસિંહાસન છોડીને ગટર તરફ ભાગવાની છે.  
મુનિ ! જે આત્મા જ ભારેકર્મી છે, અપ્રશાપનીય છે,  
તુચ્છતાનો અને ક્ષુદ્રતાનો શિકાર બનેલો છે  
એને તું એના હિતની વાતો પણ સંભળાવીશ ને,  
તો એ હિતની પણ વાતો, એના ખુદના દોષને માટે જ થશે અને  
તારા પ્રત્યેના દેખને માટે જ થશે  
એ હકીકતને આંખ સામે રાખીને અમે તને સલાહ  
આપીએ છીએ કે એવા ભારેકર્મી આત્માને તું વધુ પડતી સલાહ ન આપીશ.  
એવા અપાત્ર આત્મા સાથે તું વધુ પડતી વાતચીતો ન કરીશ.  
પણ સબૂર !  
એક જુદા જ સંદર્ભમાં અમે તને એક પ્રશ્ન પૂછવા માગીએ છીએ.  
એનો નિખાલસ દિલે તું જવાબ આપજે.  
તું સામાને હિતશિક્ષા આપવા જાય છે  
અને એ હિતશિક્ષા એને દોષ માટે કે દેખ માટે  
થાય છે એ વાત હમણાં તું એક બાજુ પર રાખ.

તને કોઈ હિતશિક્ષા આપવા આવે છે  
એ હિતશિક્ષા તને કઈ રીતે પરિણામે છે ?  
દોષરૂપે કે ગુણરૂપે ?  
દ્વેષરૂપે કે પ્રેમરૂપે ?  
એ હિતશિક્ષા સાંભળતા તને ‘હું ધન્ય બની ગયો’  
આવી લાગણી ઉત્પન્ન થાય છે ખરી ?  
એ હિતશિક્ષા સાંભળ્યા બાદ એના અમલ માટે  
દફ સંકલ્પ અને પ્રયંક સત્ત્વ ફોરવવાનું તને મન થાય છે ખરું ?  
એ હિતશિક્ષા આપનાર પ્રત્યે તારા મનમાં  
સદ્ગ્ભાવ અને બહુમાનભાવ ટકી રહે છે ખરો ?  
વારંવાર આવી હિતશિક્ષાઓ મળતી રહે તો સારું,  
એવો ભાવ અંતરમાં ઉઠે છે ખરો ?  
જો ના, તો સમજુ રાખજે કે  
તારો આત્મા પણ ભારેકર્મી જ છે.  
તારી સદ્ગતિ પણ મુશ્કેલપ્રાય : જ છે.  
સદ્ગુણોના ઉઘાડની સંભાવના તારા માટે પણ કઠિન છે.  
પરિણાતિની નિર્મણતા તારા માટે પણ મુશ્કેલ છે.  
કેવી કરુણાદશા છે એવા આત્માઓની કે જેઓ છઘસ્થ છે  
અને છતાં પ્રશાપનીય નથી !  
જેઓ સાધક છે અને છતાં સાંભળવા તૈયાર નથી !  
જેઓ માર્ગ પર છે અને છતાં આપ પુરુષોનું માર્ગદર્શન લેવા તૈયાર નથી !  
જેઓ અપૂર્ણ છે અને છતાં પોતાની ખામીઓને સુધારવા તૈયાર નથી !  
અમે બીજાઓની વાત નથી કરતા.  
અમે તો તને ખુદને કહીએ છીએ.  
આવા હીનભાગી આત્માઓમાં તારો નંબર હોય તો  
તું પોતે એમાંથી બહાર નીકળી જાજે.  
બીજાઓને હિતોપદેશ સંભળાવતા રહેવાને બદલે  
તું પોતે અન્યોના હિતોપદેશને એ રીતે સાંભળતો જા કે  
જ હિતોપદેશ તારા ગુણને માટે બનતો જાય અને હિતોપદેશ  
આપનાર પ્રત્યેના પ્રેમભાવને વધારનારો બનતો જાય.

**ચતુર્દશપૂર્વધરા અપિ વિષયાસકતતયા પઠન-પાठનાદિ-  
વ્યાસઙ્ગભાવાત् ચતુર્દશાડપિ પૂર્વાણિ વિસ્મારયન્તિ, તતો  
નિગોડે ભ્રમન્તિ**

- ઈન્ડિયપરાજ્યશતક - ૮૪

પરીક્ષામાં કાયમ પ્રથમ નંબરે જ ઉતીર્ણ થતો હતો એ યુવક.

પણ આ વખતની પરીક્ષાનું પરિણામ એના હાથમાં

આવ્યું અને એ ચોધાર આંસુએ રડી પડ્યો.

કારણ ?

એનો નંબર પાછળ ચાલ્યો ગયો હતો એવું નહોતું બન્યું;

પરંતુ પરીક્ષામાં એ નાપાસ જ થયો હતો !

પોતાની ધારદાર સ્મૃતિ પરના એના ભરોસાએ

એને એક બાજુ અધ્યયન તરફ બેપરવા

બનાવ્યો હતો તો બીજુ બાજુ કિકેટ પાછળ

બેહદ પાગલ બનાવ્યો હતો.

એનું જ આ દુષ્પરિણામ આવ્યું હતું કે

પરીક્ષામાં એ નાપાસ થયો હતો.

મુનિ !

ચૌદ પૂર્વિના જ્ઞાનવૈભવનો તો તને ઘ્યાલ છે ને ?

એ શુનકેવળી કહેવાય છે.

સંખ્યાબંધ લબ્ધિઓ એમના ચરણોમાં આળોટતી હોય છે.

જિનશાસનના એ મહાપ્રભાવક હોય છે.

હજારો-લાખો આત્માઓને એ

સમ્યક્રદર્શન, દેશવિરતિ,

સર્વવિરતિ યાવત્તુ કેવળજ્ઞાન સુધીના ગુણોનું દાન કરી શકતા હોય છે.

આવા મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય

કાળ કરીને નિગોડમાં રવાના થઈ જાય એવું તું કલ્પી શકે છે ખરો ?

પણ, સાંભળી લે તું, એવું બનતું જ હોય છે.

કારણ ?

એક જ, વિષયો પ્રત્યેની જાલિમ આસક્તિ.

પોતે ચૌદ પૂર્વધર હોય એટલે પ્રયંડ પુણ્યના સ્વામી તો હોય જ ને ?

ભક્તવર્ગ ચિક્કાર.

અનુકૂળતાઓ બેસુમાર.

ગોચરી રસભરપૂર.

પ્રશંસા પાર વિનાની.

પ્રતિષ્ઠા ગજબનાક.

પ્રતિભા કલ્પનાતીત.

આદેય નામકર્ણનો ઉદ્ય જોરદાર.

યશ નામ કર્મની બોલબાલા જોરદાર.

આ મદમસ્ત માણોલમાં જીવનમાંથી એ તપ-ત્યાગને આપી દે વિદાય.

સ્વાધ્યાયયોગને એ ચડાવી દે અભરાઈએ.

ન પઠન-પાઠન કે ન અધ્યયન-અધ્યાપન.

બસ, પાંચેય ઈન્ડિયયોના વિષયોમાં બની જાય એ ગુમભાન.

એમના જીવનમાં કરુણતા પાછી એ સર્જય કે

‘હું તો શાસન પ્રભાવક છું.

હજારો આન્ત્માઓનો ઉદ્ધારક છું.

સદ્ગતિ-દુર્ગતિનાં કારણોની મને પૂરી જાણકારી છે.

પ્રમુખચંદ્રો મારા રોમરોમમાં રમી ગયા છે.

બે-ચાર ભવમાં તો મારો મોક્ષ છે.

કર્મસત્તાની શિરજોરીથી હું તો મુક્ત થઈ ગયો છું’

આવી ભમણાના શિકાર બનીને એ લેશ પણ

હિયકિયાટ વિના ભોગવતા રહે છે મળતી તમામ અનુકૂળતાઓને અને

ફળ સ્વરૂપે મરીને રવાના થઈ જાય છે એ નિગોદગતિમાં કે જ્યાં કદાચ

અનંત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી એ કેદ થઈને પડ્યા રહે છે.

મુનિ !

ઈન્ડિયોના વિષયોનું તારા મનમાં આકર્ષણ હોય તો

આ ‘નિગોદ’ નું સરનામું સતત આંખ સામે રાખજો.

## યેન મનુષ્યેણ ધર્મો ન કૃત: તેન મનુષ્યેણ મરણાવસાને હસ્તૌ મૃદિતવ્યો ।

— વૈરાગ્યશતક - ૬૮

ભણવાની ઉમરે રખે એને પરીક્ષાના પરિણામ સમયે લમણે  
રડવાનું જ જીકાય એમાં આશર્ય શું છે ?  
તેજીના સમયે જે ગામ-ગપાટા લગાવતો રહે  
એને તેજીનો સમય પૂરો થઈ ગયા બાદ  
કપાળે હાથ ટેવાનો પ્રસંગ આવે જ એમાં નવાઈ શી છે ?  
શક્તિના સમયમાં મદોન્ભત બનીને જે  
બીજાઓને દબાવતો જ રહે  
એના અશક્તિના સમયમાં  
આજુબાજુવાળા સહુ એની આંખમાંથી  
આંસુ જ પડાવતા રહે એમાં આશર્ય શું છે ?  
મુનિ !  
આજે આંખો તારી તેજસ્વી છે ને ?  
કાન તારા સાખૂત છે ને ?  
હાથ-પગ તારા મજબૂત છે ને ?  
હોજરી તારી મસ્ત છે ને ?  
જીબ તારી સક્ષમ છે ને ?  
મન તારું ઢેકાણું છે ને ?  
જવાબ આપ તું.  
એ તમામને તેં અત્યારે શેમાં વ્યસ્ત રાખ્યા છે ?  
આંખો જીવદ્યામાં, પ્રભુદર્શનમાં, પરગુણદર્શનમાં,  
શાસ્ત્ર વાંચવામાં રોકાયેલી છે કે પછી આડી-અવળી ભટક્યા કરે છે ?  
કાન જિનવાણીશવણમાં, પરગુણ શ્રવણમાં વ્યસ્ત છે કે પછી

નિંદા-કૂઠલી સાંભળવામાં રમમાણ છે ?  
હાથ-પગ પૂંજવા-પ્રમાર્જવામાં વ્યસ્ત છે કે પછી  
એનાથી વિરાધનાઓ જ થઈ રહી છે ?  
મસ્ત હોજરીનો સદ્ગુપ્ત્યોગ તું તપશ્વર્ય કરી લેવામાં કરી રહ્યો છે કે પછી  
મિષ્ટાન્નાદિ વાપરવા દ્વારા એનાથી તું તારા સંયમજીવનને  
મૃતપ્રાય: બનાવી રહ્યો છે ?  
સક્ષમ તારી જીબ ગુણાનુવાદમાં, સ્તવનામાં,  
સ્વાધ્યાયમાં, સમાવિપ્રદાનમાં વ્યસ્ત છે કે  
પરનિંદામાં, બહિર્ભાવોની અંતરમાં સુષુપ્ત  
પડેલ ચિનગારીનું દાવાનળમાં રૂપાંતર કરવામાં વ્યસ્ત છે ?  
સ્વસ્થ દેખાતા તારા મનમાં શુભભાવોની છોળો જ ઉછળી રહી છે ને ?  
આરાધનાના મનોરથો જ સેવાઈ રહ્યા છે ને ?  
'સોહામણા પરલોક' ની ચિંતા જ સેવાઈ રહી છે ને ?  
કે પછી કલ્યાણના સ્તર પર વાસનાના ગંદવાડમાં જ એ આળોટી રહ્યું છે ને ?  
દુર્ધ્યાન અને દુર્ભાવમાં જ એ ગળાબૂડ રહે છે ?  
હતાશા અને નિરાશામાં જ એ ગરકાવ રહે છે ?  
યાદ રાખજે તું.  
તારા શરીર પર જે વેશ છે, દુનિયા વચ્ચે તારી જે ઓળખ છે,  
ચતુર્વિધ સંઘ વચ્ચે તારી જે 'ગુડવિલ' છે  
એને અનુરૂપ જ જો તારું આચરણ છે અને  
એને ગૌરવ આપે એવું જ જો તારી પાસે અંતઃકરણ છે  
તો જ મોત વખતની તારી સમાવિ અકબંધ છે.  
બાકી, એનાથી વિપરીત જો તારું જીવન અને મન છે,  
'બહિર્વિરાગ હૃદિ બદ્રરાગ:'  
આ પંક્તિમાં જો તારો નંબર છે  
તો નિશ્ચિત સમજી રાખજે કે  
મોત વખતે તારા નસીબમાં લોહીનાં આંસુ પાડવાનું જ બચવાનું છે.  
અને એ તો તારા ઝ્યાલમાં જ હશે કે એક જ વખતના  
બગડતા મોતમાં આત્માનાં અનંત મોત બગાડી નાખવાની  
પાશવી તાકાત ધરબાયેલી હોય છે. સાવધાન !

## મુમુક્ષુણાં ક્ષણમપિ નિરમિગ્રહાણામવસ્થાનસ્ય અક્ષમત્વાત् ।

– ઉપદેશપદ - ૪૫૦

તૃણતુર માણસ પાણી માટે વલખાં માર્યા સિવાય રહી શકશે ?

અસંભવ !

દમનો દર્દી પ્રાણવાયુ માટે તહ્યા વિના રહી શકશે ?

અસંભવ !

રોગોથી રિબાઈ રહેલ દર્દી

તંદુરસ્તી માટે પ્રભુને પ્રાર્થના કર્યા વિના રહી શકશે ?

અસંભવ !

દરિદ્રતાનો શિકારી બનેલો દરિદ્રી

પૈસા માટે જાવાં નાખ્યા વિના રહી શકશે ?

અસંભવ !

મુનિ !

તારી જાતને તું જો 'મુમુક્ષુ' માને છે,

તારું અંતઃકરણ જો હુઃખ્યારી કે પાપભીરુ નહીં પડા

આગળ વધીને ભવભીરુ પણ છે એવું જો તું માને છે,

નારકનાં હુઃખો અને સ્વર્ગનાં સુખો વચ્ચે કોઈ જ તફાવત નથી,

સુખ તો એક માત્ર મોક્ષનું જ ઉપાદેય છે

આ શ્રદ્ધા તારા હદ્યમાં સિથર થઈ ગઈ હોવાનું જો તું માને છે

તો એટલું જ કહેવું છે અમારે તને કે

તારી એ માન્યતા સાચી છે એ જાણવા

તારે કસોટીના આ પથર પર એ માન્યતાને

ચકાસી લેવાની જરૂર છે.

આ રહ્યો એ કસોટીનો પથર !

જાતજાતનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના

અભિગ્રહો લેવા તારું મન જો સતત ઉત્સાહિત રહેતું હોય,

તડપતું અને તલસતું રહેતું હોય

તો સમજ રાખજે કે તારું મુમુક્ષુપણું સાચું છે.

ભવભીરુતા તારી પાડી છે.

મુક્તિસુખ માટેનું તારું આકર્ષણ નકર છે.

પડા શકિત હોવા છતાં,

સંયોગો સાનુક્ષુણ હોવા છતાં,

પ્રભુ આજ્ઞાની જ્ઞાનકારી હોવા છતાં,

પ્રભુવચનો કંઠસ્થ હોવા છતાં,

ઉપકારી ગુરુદેવની પ્રેરણા હોવા છતાં

સહવર્તિઓની સુંદર હૂંક હોવા છતાં

દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના કોઈ પડા પ્રકારનો

અભિગ્રહ લેવાનો તારા મનમાં ઉત્સાહ જ જાગતો નથી,

એ માટે જો તને કોઈની શરમ પડા નહતી નથી

તો નિશ્ચિત સમજ રાખજે કે તારું મુમુક્ષુપણું દંભી છે.

તારી ભવભીરુતા પોકળ છે.

સાધુપણાંનો તારો વેશ નિરર્થક છે.

કમાલની કરુણાતા જ કહેવાય ને આ ?

ડષ્યા પર લેખલ 'સાકર'નું હોય

અને એને ખોલો ત્યારે એમાંથી 'ધૂળ' નીકળો

એ એટલી કરુણાતા નથી

પરંતુ શરીર પરનો વેશ 'મુમુક્ષુપડા'ની

જહેરાત કરનારો હોય

અને એ વેશ જેના શરીર પર હોય

એનું અંતઃકરણ 'ભોગસુખો' પ્રયો આકર્ષિત

હોય એ તો જલિમ કરુણાતા છે.

એટલું જ કહીએ છીએ તને કે

તારું મન અને જીવન, આ કરુણાતાના શિકાર

બન્યાં હોય તો વહેલી તકે એમાંથી તું બહાર નીકળી જશે.

अविहिते बीजक्षेपे यथा सुवर्णङ्गपि नैव भवति सस्ये, तथा  
धर्मबीजविरहे (सम्यक्लवादि समुत्पादकानां धर्म  
प्रशंसादिकानां हेतूनां परिहारे) न सुषमायामपि धर्म भवति ।

— ઉપदेशपट - ૨૨૪

જમીન ફળદ્વારા,  
ખાતર તંદુરસ્ત, પાણી સરસ.  
સૂર્યપ્રકાશ બરાબર અને માળી હોશિયાર.  
અને છતાં બન્યું એવું કે એ જમીનમાં પાક ઊગ્યો જ નહીં.  
કારણ ?  
એ જમીનમાં બીજક્ષેપ જ ન થયો.  
બીજક્ષેપ વિના પાક ?  
સર્વથા અસંભવ !  
મુનિ !  
ધાર કે કાળ ચોથા આરાનો છે.  
ધરતી પર સાક્ષાત् તીર્થકર ભગવંત વિચરી રહ્યા છે.  
એમાં જ વરદહસ્તે રહેહરણ સ્વીકારવાનું સદ્ભાગ્ય તને સાંપડ્યું છે.  
સ્થવિર-જીતાર્થ મુનિઓના ગચ્છમાં તારે રહેવાનું બન્યું છે.  
તારા ખુદના જીવનમાં સ્વાધ્યાય-તપ-વૈયાવચ્ચાદિ  
આરાધનાઓની તે વણજાર ઊભી કરી દીધી છે  
અને છતાં જેને ‘ધર્મ’ કહી શકાય એવો ધર્મ તારા  
જીવનમાં હોય નહીં એવું બની શકે છે.  
સદ્ગુણોનો જે ઉધાડ તારા માટે પરમગતિનું કારણ બનવો જોઈએ,  
એવા સદ્ગુણોના ઉધાડનું સદ્ભાગ્ય તને  
સાંપડે જ નહીં એવું બની શકે છે.  
આત્મસ્વરૂપની જે રમણતા તારા અનુભવનો વિષય બનવી જોઈએ  
એ સ્વરૂપરમણતા તારા સ્વર્ણનો વિષય પણ

ન બને એવું બની શકે છે.

પણ ક્યારે ?

ત્યારે જ કે જ્યારે તારી પાસે ધર્મબીજ જ ન હોય.

અન્ય આત્માઓના જીવનમાં

સમ્યક્લત્વાદિ સમુત્પાદક જે પણ ધર્મો હોય,

એની મુક્ત કંઠે પ્રશંસા કરતા રહેવું એ છે ધર્મબીજ.

અને એનો તારા જીવનમાં સર્વથા અત્ભાવ જ હોય.

યાદ રાખજે તું.

તારા ખુદના જીવનમાં રહેલ આરાધનાઓનું

સ્વરૂપ પાણીનું, ખાતરનું કે સૂર્યપ્રકાશનું

હોઈ શકે છે પણ બીજાનું સ્વરૂપ તો

અન્ય આત્માઓનાં સુકૃતોની પ્રશંસા એ જ છે.

જો તારી પાસે એ જ નથી

અને બાકીનું ઘણું બધું છે તો ય તારી મુક્તિ નથી

અને જો તારી પાસે એ છે જ

અને બીજું બધું થોડું ઓછું-વતું છે તો ય તારી મુક્તિ અસંદિંધ છે.

ભૂલીશ નહીં તું આ વાત કે સ્વજીવનમાં સુકૃતોના સેવન માટે તારું

મન જેટલું જલદી તૈયારી થઈ જશે

એટલું જલદી એ અન્યોનાં જીવનમાં

સેવાઈ રહેલ સુકૃતોની પ્રશંસા માટે તૈયાર નહીં થાય.

કારણ ? આ જ કે સ્વજીવનમાં સેવાતાં સુકૃતોથી

અહંને હજી પુષ્ટ કરી શકાય છે પરંતુ

અહંની છાતી પર ચરી જવાની મર્દનગી

દાખ્યા વિના અન્યોનાં જીવનમાં સેવાઈ રહેલાં

સુકૃતોની પ્રશંસા તો નથી જ કરી શકતી.

હકીકત આ હોવા છતાં અમે તને ભારપૂર્વક જજાવીએ છીએ કે

આત્મભૂમિ પર તું જો સદ્ગુણોનો પાક લેવા

માગે જ છે તો ‘બીજાં સત્પ્રશંસાદિ’ આ

વચનના આધારે દિલ દઈને સહુના સુકૃતની પ્રશંસા

કરતો જા. તું ન્યાલ થઈ જઈશ.

**यथा हि शुक्लपक्षप्रवेशात् प्रतिपच्चन्द्रमाः परिपूर्ण  
चन्द्रमण्डल हेतुः सम्पद्यते तथा सर्वज्ञाऽज्ञानुप्रवेशात्  
तुच्छमप्यनुष्ठानं क्रमेण परिपूर्णानुष्ठानहेतुः सम्पद्यते ।**

— ઉપદેશપદ - ૨૨૨

પાણીનું નાનકું બુંદ.

એ કેટલું બધું તકાતહીન !

સૂર્યનાં બે-ચાર કિરણો એનાં પર પડે,  
પવનની બે-ચાર લહેરખી એને સ્પર્શી જાય,  
નાના પણ બાળકનો એના પર પગ પડી જાય  
અને એ હતું-ન હતું થઈ જાય.

પણ સબૂર !

આવું નાનકું અને તાકાતહીન પણ એ બુંદ  
સ્વીકારી લે સાગરનું શરણું અને ભળી જાય સાગરમાં, પછી ?  
ન એને મધ્યાહ્નકાળનો સૂર્ય પણ શોષવી શકે,  
ન એને વાવાજોડાનો પવન પણ સૂક્વી શકે કે  
ન એને કોઈ ચમરબંધીનો સ્પર્શ પણ હતું-ન હતું કરી શકે.

મુનિ !

જોયો તો તે છે ને શુક્લ પક્ષમાં પ્રવેશેલો બીજનો ચન્દ્ર !

આકાશમાં એને નીરખવા માટે કદાચ આંખો જીણી પણ કરવી પડે.

પણ સમય જેમજે પસાર થતો જાય,  
બીજનો એ ચન્દ્ર પૂર્ણિમાનો ચન્દ્ર બનીને જ રહે.

આ જ સંદર્ભમાં અમે તને એક વાતની યાદ કરાવવા માગીએ છીએ.

ભલે તારી પાસેનું સદનુષ્ઠાન નાનું છે,  
ભલે આરાધના તારી પાસે મામૂલી છે,

ભલે સાધનાનું કદ તારું અતિ તુલ્ય છે,  
પરંતુ જો એ અનુષ્ઠાનને, આરાધનાને અને સાધનાને

સર્વજ્ઞની આજાનું પીઠબળ છે તો

અમે તને કહીએ છીએ કે આજે નાનકું દેખાતું

પણ અનુષ્ઠાન આવતી કાલે પરિપૂર્ણ અનુષ્ઠાનનું કારણ  
બનીને તારા આત્માનો મોક્ષ કરી જ દેશે.

એક અતિ મહત્વની બાબત તારા જ્યાલમાં છે ?

પ્રશ્ન ચન્દ્રનો નથી, ચન્દ્રની ઉપસ્થિતિ ક્યા પક્ષમાં છે એનો છે.

ચન્દ્ર તો એનો એ જ હોય છે

પરંતુ જ્યારે એ કૃષ્ણપક્ષમાં હોય છે ત્યારે

એ પરિપૂર્ણ તો નથી બનતો પરંતુ એ સતત ઘટતો જતો જ હોય છે.

અને એ જ ચન્દ્ર જ્યારે શુક્લપક્ષમાં પ્રવેશી જાય છે,

બસ, એ જ દિવસથી એનું પરિપૂર્ણ બનવાનું

નિશ્ચિત થતું જાય છે.

આ જ હકીકત સમજ રાખજે તારી મુક્તિની બાબતમાં.

અનુષ્ઠાનનું પોત જો ચન્દ્રનું છે તો

સર્વજ્ઞની આજાનું પોત શુક્લપક્ષનું છે.

તપ-ત્યાગ અને જાપ,

સ્વાધ્યાય, ભક્તિ અને વૈયાવચ્ચ,

આ બધાં અનુષ્ઠાનો અનંતકાળના સંસાર પરિભ્રમણમાં

તેં એકાદ વાર નહીં પરંતુ અનંતીવાર કર્યા છે અને છિતાં તારી

મુક્તિ થઈ નથી એ હકીકત છે.

ગરબડ ક્યાં થઈ ગઈ ?

અહીં જ.

એ અનુષ્ઠાનોનું પોત સર્વજ્ઞની આજાનું

હોવું જોઈતું હતું એના બદલે કાં તો

એ અનુષ્ઠાનોના કેન્દ્રમાં અસર્વજ્ઞની

આજા રહી અને કાં તો તારી જ ખુદની સ્વચ્છંદમતિ રહી..

અને એણે જ તારાં તમામ અનુષ્ઠાનોને ફળથી વંચિત કરી દીધાં.

એક જ કામ કર તું હવે.

અનુષ્ઠાન નાનું પણ કર. એને સર્વજ્ઞની આજાનું

પીઠબળ આપી દે. તારી મુક્તિ નિશ્ચિત થઈ જશે.

## મિથ્યાત્વોદયકારકશ્ચાડયં દુ:ષમાનામારક:

— દર્શનશુદ્ધિપ્રકરણ ગા. ૧/૨

ચારેય બાજુ ગુંડાઓ જ હોય જ્યાં,  
ત્યાં સંપત્તિને સુરક્ષિત રાખી દેવામાં સફળતા મળે ?

રામ રામ કરો.

કેમિકલની ફુકટરીઓ વધુ ને વધુ હોય જ્યાં,  
ત્યાં તંદુરસ્તીને જાળવી રાખવામાં સફળતા મળે ?

રામ રામ કરો.

ગંધાતા પાણીની ગટરો વહેતી હોય જ્યાં,  
ત્યાં વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવામાં સફળતા મળે ?

રામ રામ કરો.

વેશ્યાઓના વસવાટ વચ્ચે જ રહેવાનું હોય જ્યાં,  
ત્યાં પવિત્રતાને અકંધ રાખવામાં સફળતા મળે ?

રામ રામ કરો.

મુનિ ! અત્યારે તું જે કાળમાં જીવી રહ્યો છે  
એ છે ‘દુષ્પમ’ નામનો પાંચમો આરો.

આ આરાની એક ગજબનાક વિશેષતા તારા ઘ્યાલમાં છે ખરી ?

આ આરો છે મિથ્યાત્વના ઉદ્યને જન્મ આપનારો.

આ આરામાં આચરણને પવિત્ર રાખવું તો મુશ્કેલ છે જ પરંતુ  
સમ્યકું શ્રદ્ધાને ટકાવી રાખવી એ પણ આ આરામાં

જીવી રહેલ વ્યક્તિન માટે મુશ્કેલ છે.

કારણ ? પાર વિનાનાં પ્રલોભનો અને

પાર વિનાની બે-શરમી. આ બે પરિબળોથી વ્યાપ્ત છે આજનો કાળ.

એક બાજુ હોય પાણી અને બીજી બાજુ સર્વત્ર હોય ઢાળ જ ઢાળ.

પાણીને નીચે ઊતરતું અટકાવી શકાય ?

જરાય નહીં.

એક બાજુ મનનું પોત હોય પાણીનું

અને બીજી બાજુ સર્વત્ર હોય પ્રલોભનોની વણાજાર.

જીવનને આચરણબ્રાષ્ટ થતું અને

મનને શ્રદ્ધાબ્રાષ્ટ થતું અટકાવી શકાય ?

બિલકુલ નહીં.

એક વાસ્તવિકતાને તું સતત આંખ સામે રાખજો.

પ્રલોભનો જો જીવનને આચારબ્રાષ્ટ બનાવે છે

તો વારંવારની આચારબ્રાષ્ટતા

મનને શ્રદ્ધાબ્રાષ્ટ બનાવીને જ રહે છે.

જેમ મગજની નસ તૂટી ગયા પછી મોતને ખાસ છેટું હોતું નથી

તેમ સદાચરણથી જીવન બ્રાષ્ટ થઈ ગયા પછી

મનનું સમ્યકું શ્રદ્ધાથી બ્રાષ્ટ થવાનું બહુ દૂર રહેતું નથી.

કારણ ?

આ જ કે આત્માનો અનાદિનો અભ્યાસ એમ

કહે છે કે સુખ ઈન્દ્રિયોના વિષયોમાં જ છે.

જ્યાં વિષયોના માધ્યમે જીવને સુખનો અનુભવ થતો રહે છે ત્યાં  
ધીમેધીમે એ વિષયો પ્રત્યે ઉપાદેયબુદ્ધિ

જાગી જાય એવી પૂરી સંભાવના છે.

અમે કહીએ છીએ, વિષયો હેય છે.

તારું મન બોલવા લાગે છે, વિષયો ઉપાદેય છે.

મિથ્યાત્વ આખરે છે શું ?

હેય તત્ત્વો ઉપાદેય લાગવા માંડે.

ઉપાદેય તત્ત્વો હેય લાગવા માંડે.

આ જ તો મિથ્યાત્વ છે.

તું સાચે જ તારા આત્માને શ્રદ્ધાબ્રાષ્ટ થતો

બચાવી લેવા જો માગે છે તો એક જ કામ કરતો જા.

આચરણને બ્રાષ્ટ થતું બચાવતો જા અને એમાં સફળતા મેળવવા

પ્રલોભનોથી તારી જાતને દૂર રાખતો જા. ફાવી જઈશ.

## એંદંયુગિન: પુમાંસ પ્રાયેણ સ્વીકૃતમહાવતા અપિ ન દૃશ્યન્તે સંયમે રતા:

– દર્શનશુદ્ધિપ્રકરણ ગા. ૧/૨

બધામપાક પેટમાં પદ્મરાષ્ટ્રો.  
મુખ પર ચમક તો ન આવી  
પણ તબિયત બગડી ગઈ.. કારણ ?  
હોજરી જ બગડેલી હતી.  
હથમાં ચાવી આવી ગઈ.  
તાણું ખોલવાની વાત તો ઘેર ગઈ.  
ખુલેલું તાણું બંધ થઈ ગયું. કારણ ?  
ચાવી અવળી બાજુ ફેરવાઈ ગઈ.  
હથમાં છરી આવી તો ગઈ પણ એનાથી શાક ન સુધર્યુ,  
ઉલ્લંઘ, હથમાંથી લોહી નીકળવા લાગ્યું. કારણ ?  
છરી વાપરતાં ન આવડી.  
મુનિ ! તેં સ્વીકારેલાં મહાવતોની મહાનતાનો  
તને કોઈ ખ્યાલ છે ખરો ?  
એના વિશુદ્ધ પાલનમાં આત્માના અનંત અનંત કાળથી ચાલ્યા આવતા  
સંસાર પરિભ્રમણ પર પૂર્ણવિરામ મૂડી દેવાની  
અને જે સુખની આત્માએ ક્યારેય અનુભૂતિ જ  
નથી કરી એની અનુભૂતિ કરાવી દેવાની આગવી તાકાત ધરબાયેલી છે.  
પણ સબૂર !  
જે મહાવતો તેં સ્વીકાર્ય છે  
એના બંગની ખતરનાકતા તારી જાણમાં છે ખરી ?  
કુગતિ, કુકર્માનો બંધ અને  
કુમતિ, આ ત્રણ ‘કુ’ જનમજનમ તારી સાથે ને સાથે જ રહે અને

તને દુઃખી તથા પાપી બનાવતા જ રહે  
એ છે મહાવતભંગના જાલિમ અપાયો.  
પણ તને અમે યાદ કરાવવા માગીએ છીએ કે  
જે પાંચમા આરામાં અત્યારે તું જીવન જીવી  
રહ્યો છે એ પાંચમો આરો આમ તો  
પ્રત્યેક અવસર્પણીમાં આવે જ છે પરંતુ  
આ અવસર્પણીને ‘હુંડા’નું એક કલંકિત વિશેખણ મળ્યું છે.  
અનંતકણે આવે એવી આ અવસર્પણ છે.  
અને એનો જ આ દુષ્ટભાવ છે કે  
સામે ચરીને, સત્ત્વ ફોરવીને સમજણપૂર્વક  
મહાવતોનો સ્વીકાર કરી ચૂકેલા સંયમીઓ પણ  
મહાવતોના પાલનમાં સજાગ નથી દેખાતા,  
સાવધ નથી દેખાતા, આનંદિત નથી દેખાતા.  
અમે બીજાઓની વાત નથી કરતા.  
તને જ પૂછીએ છીએ.  
મહાવતોના વિશુદ્ધ પાલનની બાબતમાં તું સાવધ કેટલો છે ?  
સાપેક્ષ કેટલો છે ?  
જાણી-જોઈને મહાવતોનો બંગ તું નથી જ કરતો એવું નકી ખરું ?  
મહાવતોના બંગમાં તારું અંતઃકરણ રડી જ  
પડે છે એવું નકી ખરું ?  
મહાવતોના પાલનમાં જેઓ અડગ છે એ  
સહુ પ્રત્યે તારા હૈયામાં પ્રચંડ આદરભાવ  
જીવતો જ રહે છે એવું નકી ખરું ?  
જો આ તમામ પ્રશ્નોનો સંતોષજનક  
પ્રત્યુત્તર તારા અંતઃકરણમાંથી ન ઉઠતો હોય  
તો અમારે તને યાદ કરાવવું છે કે તારું ભાવિ ભયંકર છે.  
‘એક મહાવતના બંગમાં પણ આત્માને દુર્ગતિમાં જતો ખુદ પરમાત્મા પણ જો  
બચાવી શકતા નથી તો પાંચે ય મહાવતોના  
લંજક એવા તારા આત્માનું થશે શું ?’ ખૂબ  
ગંભીરતાથી આના પર વિચાર કરજે.

## ઇરાસમિત્યાદ્યાશ્વારિત્રાત્મન: પ્રસૂતિ હેતુત્વેન હિત- કારિત્વેન ચ માતર ઇવ અવશ્યભાવેન ન મોક્તવ્યા:

- ઘોડશક - ૨

જન્મદાતી અને જીવનદાતી માતાને ધોરી દેવાની કે  
એનાથી દૂર રહેવાની ભૂલ નાનકડો બાબો ક્યારેય કરે ખરો ?  
હરગિજ નહીં.

કારણ ?  
એના જીવનની સલામતીનું કેન્દ્ર એક માત્ર અની માતા જ હોય છે.  
મુનિ !

માત્ર શરીરને જન્મ આપતી માતા પ્રત્યે  
બાળકનો જો આ લગાવ હોય છે  
તો અમારે તને એટલું જ કહેવું છે કે  
તારા ચારિત્ર શરીરને જન્મ જેણે આપ્યો છે અને  
તારા આત્માને માટે જે એકાંતે હિતકારી છે  
એ ઈરાસમિતિ આદિ પાંચ સમિતિ અને  
મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ,  
આ અષ્ટ પ્રવચન માતા પ્રત્યે તારો લગાવ તો  
કેઈ ગણો વધુ હોવો જ જોઈએ એ વાત તારા  
મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ છે ખરી ?

યાદ રાખજે,  
બાળકના જીવનમાં આકર્ષક પણ રમકડાં નંબર બે પર જ હોય છે.  
સ્વાદિષ્ટ ચોક્કેટ અને મનપસંદ પણ બિસ્કિટ નંબર બે પર જ હોય છે.  
આકર્ષક અને સુંવાળા પણ કપડાં નંબર બે પર જ હોય છે.  
નંબર એક પર એક માત્ર મમ્મી જ હોય છે.  
બસ, એ જ ન્યાયે તારા જીવનમાં સ્વાધ્યાય નંબર બે પર જ

હોય અનો કોઈ વાંધો નથી.  
તપશ્ચયના કેતે તું શ્રીમંત ન બની શકે  
તો ય એમાં કોઈ તકલીફ નથી.  
પ્રવચનની કળા કે લેખનની કળા એ બંને કેતે તું કાચો પડતો  
હોય તો એ ય તારા જીવનની કોઈ કરુણતા નથી.  
કલાકોનો જાપ તું ન કરી શકતો હોય કે  
લોહી-પાણી એક કરી નાખતો વૈયાવચ્ચનો  
યોગ તારા જીવનમાં પ્રતિષ્ઠિત ન થયો હોય તો  
એ ય તારા માટે કોઈ કરુણ વાસ્તવિકતા નથી  
પરંતુ બાળકના જીવનમાં જેમ  
મમ્મી નંબર એક પર જ હોય છે  
તેમ તારા જીવનમાં અષ્ટ પ્રવચનમાતા  
નંબર એક પર જ હોવી જોઈએ.  
ખેદ છે અમને એ વાતનો કે  
આ હકીકતને તું ગંભીરતાથી સમજ શક્યો નથી.  
નીચે જોયા વિના જ ચાલવાનું,  
મુહૃપત્તિના ઉપયોગ વિના જ બોલવાનું,  
ગોચરીના દોષોની ઉપેક્ષા જ કરતા રહેવાનું,  
પૂંજવા-પ્રમાર્જવાના કેતે આંખમાર્ચિયામણાં જ કરતા રહેવાનું,  
મનમાં ચાલતા વિચારો પર કોઈ નિયંત્રણ જ નહીં,  
શબ્દપ્રયોગમાં વિવેકને હાજર રાખવાની કોઈ તકેદારી જ નહીં,  
કાયાના સ્તરે અયતનાથી બચવાની કોઈ ચોક્કસ જાગૃતિ જ નહીં,  
આ જ જો બની ગઈ હોય તારી જીવન જીવવાની  
પદ્ધતિ તો અમે તને એટલું જ કહીએ છીએ કે તું કૃતધ્ની છે.  
તારા ચારિત્ર શરીરને જન્મ આપી ચૂકેલી  
અષ્ટ પ્રવચન માતાનો તું વિશ્વાસધાતી પુત્ર છે.  
યાદ રાખજે, મમ્મીના મરણ પછી ય ચામડાના શરીરને ધારણ  
કરી રહેલ બાબો જીવી જાય છે પરંતુ અષ્ટ પ્રવચન  
માતાના મરણ પછી ય તારું ચારિત્ર શરીર જીવી જાય  
એવી તો કોઈ જ સંભાવના નથી. સાવધાન !

## પ્રવચનમાતૃસહિતસ્ય સર્વકાળ સાધો: નિયમેન ન ભવભય ભવતિ

- ઘોડશક - ૨

ગતી ભલેને ગુંડાઓની છે  
પરંતુ સાથે જો પૉલીસ કમિશનર છે  
તો પછી ડરવાનું રહે છે જ ક્યાં ?  
વાતાવરણમાં ઠંડી ભલે ને સખત છે  
પરંતુ સાથે ધાર્ભણા-સ્વેટર, મફલર વગેરે જો પર્યાપ્ત પ્રમાણમાં છે  
તો પછી ઠંડીનો ડર રાખવાની જરૂર જ ક્યાં રહે છે ?  
ભૂખ ભલે ને સખત લાગી છે  
પરંતુ રસોઈ જો તૈયાર થયેલી જ પડી છે  
તો પછી ક્ષુધાનો ત્રાસ વેઠવાની જરૂર જ ક્યાં રહે છે ?  
મુનિ !  
ચાર ગતિરૂપ સંસાર અતિ ભયંકર છે  
એનો તને ઘ્યાલ છે જ.  
નરકગતિનાં દુઃખોનું  
વર્ણન સાંભળતા પણ છાતીનાં પાટિયાં બેસી  
જાય તેમ છે એની તને ખખર છે.  
તરિયંગતિમાં  
બંધન-હેદન-ભેદન વગેરેની વેદનાઓ કેવી છે  
એ તેં પોતે તારી સગી આંખે અનેક વખત નિહાયું છે.  
દેવગતિમાં અતૃપ્તિના ત્રાસ કેવા જાલિમ છે  
એ તેં શાસ્ત્રોનાં પાને વાંચ્યા છે.  
પરાધીનદશા-દારિદ્રય-દૌર્ભાગ્ય વગેરેથી  
મનુષ્યગતિ કેવી દુઃખદાયક બની રહે છે એનો ય તને ઘ્યાલ છે.

એકેન્દ્રિયપણાંની અને  
વિકલેન્દ્રિયપણાંની જાલિમ દશા તો તેં આંખ સામે જ જોઈ છે.  
આ બધું જોયા-સાંભળ્યા બાદ તને  
એમ થતું હોય કે આ સંસારમાં મારા આત્માનું થશે શું ?  
દુર્ગતિનાં જાલિમ દુઃખો મારા લમણો  
જીંકાઈ જશે તો મારી સમાધિ ટકશે શી રીતે ?  
આવો ભય જો તારા મનમાં ઘર કરી ગયો  
હોય તો એમે તને એક સલાહ આપીએ છીએ.  
તું એક કામ કર.  
આઠ ય પ્રવચન માતાઓને તું તારી સાથે રાખી લે.  
એક પળ પણ તારા જીવનની એવી ન જવી  
જોઈએ કે જે પળમાં પ્રવચન માતાઓ તારી સાથે ન હોય.  
અલભત, એક બાબતની અમે તને યાદ  
કરાવવા માગીએ છીએ કે  
શરીરને જન્મ આપનારી માતા પોતાનાથી  
બાળક વિખૂટો ન પડી જાય એની ખુદ  
તકેદારી રાખતી હોય છે જ્યારે  
ચારિત્ર શરીરને જન્મ આપતી અષ્ટ પ્રવચન માતાઓ  
તારાથી વિખૂટી ન પડી જાય એની તકેદારી તારે ખુદે રાખવાની છે.  
તારો મામૂલી પણ પ્રમાદ, અલ્પ પણ અસાવધગીરી અને  
એ આઠ ય પ્રવચન માતાઓ તારાથી દૂર !  
લખી રાખજે તારા દિલની દીવાલ પર કે  
જો અષ્ટ પ્રવચન માતાઓ સર્વ સમયમાં તારી સાથે જ છે તો  
આ સંસારનો તારે કોઈ જ ભય રાખવાનો નથી.  
અને જો અષ્ટ પ્રવચન માતાઓને તેં  
છોરી દીધી છે તો આ સંસાર તારી રેવડી દાખાદાણ કરી નાખવાનો છે.  
વાત્સલ્યમયી મમ્મી કમજોર બાળકથી એક પળ માટે ય દૂર રહેતી નથી.  
કમજોર સંયમી એવા તારે  
એક પળ માટે ય અષ્ટ પ્રવચન માતાઓને દૂર  
રાખવાની નથી. તારી મુક્તિ નિશ્ચિત રહે.

## સમ્યકૃત્વામૃતરસજ્ઞજીવ: ચિરકાળાડસેવિતમપિ ન જાતુ બહુમન્યતે પાપમ्

– ઘોડશક - ૩/૧૫

કુપથ્ય સાથે દોસ્તી ભલે ને બહુ જૂની છે  
પરંતુ તંદુરસ્તીજન્ય પ્રસન્નતા જેણે એકાદ વાર  
પણ અનુભવી લીધી છે  
એને પછી કુપથ્યનું આકર્ષણ ઊભું રહે એવી સંભાવના લગભગ નથી.  
બળદગાડીમાં બેસવાનો અનુભવ ભલે ને વરસોનો છે  
પરંતુ વિમાનની મુસાફરીની મજા એકાદવાર પણ જેણે  
લૂટી લીધી છે  
એને પછી બળદગાડીમાં બેસવાનું આકર્ષણ  
ઉભું રહે એવી સંભાવના નહિવતું છે.  
મુનિ !  
તારી પાસે જે જીવન છે એ જીવન સંયમનું છે.  
એ જીવન કંઠો છાંડા ગુણસ્થાનકનું છે  
અથવા તો સાતમા ગુણસ્થાનકનું છે.  
એ જીવન પાપમુક્ત તો છે જ પણ સાથે પ્રસન્નતાયુક્ત પણ છે.  
એ જીવનમાં સંકલેશોની ગેરહાજરી તો છે જ પણ  
સાથે આનંદ પણ ચિક્કાર છે.  
એ જીવનમાં બહિર્ભાવોના આકર્ષણનો અભાવ તો છે જ પરંતુ સાથે  
અંતર્ભતાજન્ય મસ્તીનો અનુભવ પણ ગજબનાક છે.  
આ વાત અમે તને એટલા માટે યાદ કરાવીએ છીએ કે જેની પાસે  
માત્ર ચતુર્થ ગુણસ્થાનકની ગેરન્ટી આપતું સમ્યક્ષુદ્ધન છે  
એ સમકિતિ આત્મા સમ્યક્ષુદ્ધન રૂપી  
અમૃતરસના અનુભવના બળે

સ્વજીવનને પાપમુક્ત બનાવવામાં કદાચ  
સફળ નથી પણ બનતો-  
અવિરતિના ઉદ્યના કારણે અથવા તો અનંત અનંતકાળથી  
પાપસેવનનો અભ્યાસ હોવાના કારણે-  
તો ય પાપના આકર્ષણથી તો એનું મન મુક્ત બની જ ગયું હોય છે.  
પ્રશ્ન અમારે તને એટલો જ પૂછ્યો છે કે સમકિતિ આત્માની  
મનોવૃત્તિ જો આ હોય તો  
સર્વવિરતિધર એવા તારી મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ?  
તું તો એવા મસ્ત જીવનને પામી ગયો છે કે  
જે જીવનમાં એક પણ પાપ કરવું તારા માટે અનિવાર્ય નથી.  
શુભ આલંબનો વચ્ચે જ તારે જીવનભર રહેવાનું છે.  
સત્કિયાઓ અને સદનુષ્ઠાનોના સેવનનું  
સદ્ગ્રાહ્ય જીવનભર માટે તને વરેલું છે.  
શુભ યોગ અને શુભ ઉપયોગ  
એ તો તારા પવિત્ર જીવનની એક માત્ર ઓળખ છે.  
જવાબ આપ તું.  
આંતું પવિત્ર જીવન આજે તારા હાથમાં છે  
એ પછી ય તારા મનમાં વાસનાનાં  
સાપોલિયાં કવચિત્પ પણ આંટા લગાવી જાય છે ખરા ?  
કષાયોની ઉત્કટ્તા  
તારા મનનો કબજો કવચિત્પ પણ જમાવી દે છે ખરી ?  
દુર્ધ્યાન અને દુર્ભાવના ધૂમાડાથી  
તાંકું ચિત્ત અવારનવાર કલુષિત બની જ જાય છે એવું બને છે ખરું ?  
જો હા, તો તું નિશ્ચિત સમજ રાખજે કે  
જગત તને ભલે સંયમી તરીકે ઓળખતું હશે,  
હકીકતમાં તારી પાસે સંયમીનાં કપડાં જરૂર છે  
પરંતુ અમે જેને ‘સંયમ’ કહીએ છીએ એ  
સંયમ તો તારી પાસે નથી જ નથી !  
સાવધાન ! પાપમુક્ત જીવન પામ્યો જ છે તો  
મનને પાપઆકર્ષણથી મુક્ત કરીને જ રહે !

## યત્ર ભાવોડધિકસ્તત્ર ફલમપ્યધિકં ભવતિ ।

– પોડશક - ૭/૧૨

અધિક સંપત્તિ,

અધિક સામગ્રી ખરીદી શકે છે.

અધિક સાકર

મીઠાઈને અધિક સ્વાદિષ્ટ બનાવી શકે છે.

અધિક વૃક્ષો,

અધિક વરસાએને બેંચી લાવે છે.

અધિક સ્થાણી

અધિક લખાણ કરી શકે છે.

પણ મુનિ !

આ તો બહિર્જગતની વાત છે.

આભ્યન્તર જગતની વાત જો તું જાણવા માગતો હોય તો એ છે કે

જે પણ યોગમાં, જે પણ અનુષ્ઠાનમાં,

જે પણ કિયામાં તારો ભાવ અધિક છે

એ યોગનું, એ અનુષ્ઠાનનું, એ કિયાનું ફળ અધિક છે.

પછી ભલે એ યોગ કદાચ મામૂલી છે,

એ અનુષ્ઠાન કદાચ નાનું છે,

એ કિયા કદાચ પ્રારંભિક છે.

ઘ્યાલ તો છે ને તને કે દિવસ દરમ્યાન ઈરિયાવહીની જે કિયા તું

કદાચ ૨૦/૨૫ વાર કરી રહ્યો છે

એ જ ઈરિયાવહીની કિયા કરતા અઈમુતા મુનિવર

કેવળજ્ઞાન પામી ગયા છે.

જે પુંજવા-પ્રમાર્જવાની કિયા આ જીવનમાં

તું ડગલે ને પગલે કરી રહ્યો છે, પુંજવા-પ્રમાર્જવાની

એ જ કિયા કરતા વલ્કલચિરીએ ધનધાતીકર્મોના ભુક્કા બોલાવી દીધા છે.

જે એકાશનનો તપ આ જીવનમાં તને કોઠે પડી ગયો

છે એ જ એકાશનનો તપ કરતા

કુરગડુ મુનિવરે કેવળજ્ઞાન ઉપાર્જ લીધું છે.

જે ગુરુબહુમાનનો ભાવ તું આજે હૃદયમાં સંધરીને બેઠો છે એ જ ગુરુ બહુમાનના ભાવને સહારે જ્ઞાનાવરણના

તીવ્ર ઉદ્યક્તિમાં ય માસ્તુષ્પ મુનિ કેવળજ્ઞાન પામી ચૂક્યા છે.  
તાત્પર્યથી આ બધાં વષાન્તોનો સ્પષ્ટ છે.

આરાધના, અનુષ્ઠાન કે

આલંબન ભલે નાનું છે, મામૂલી છે

એના પ્રત્યેના અહોભાવને

જો તમે પરાકાષ્ટાએ લર્દ જર્દ શકો છો

તો તમને એના અંતિમ ફળ સુધી

પહોંચવામાં કોઈ જ તકલીફ પડે તેમ નથી.

મુનિવર !

વાસ્તવિકતા જ્યારે આ જ છે

ત્યારે અમારી તને એક ખાસ સલાહ છે કે

તું વિશિષ્ટ આરાધના, વિશિષ્ટ અનુષ્ઠાન કે

વિશિષ્ટ આલંબનોની અપેક્ષા રાખવાને બદલે

તને જે પણ આરાધના, અનુષ્ઠાન કે આલંબનો મળ્યા છે

એ તમામ પ્રત્યે તારા હૃદયના ભાવોને

વિશિષ્ટ બનાવતો જા.

શું કહીએ તને ?

ભાવોની વિશિષ્ટતા પામીને જો

ઇન્દ્રસ્થ ગુરુને સહારે ય કેવળજ્ઞાન પામી શકાય છે તો

કેવળજ્ઞાની ગુરુ મળવા છતાં ય ભાવો જો શુષ્ણ જ છે,

હૈયું જો સંવેદનહીન જ છે

તો સદ્ગતિના સ્વામી બનવું ય મુશ્કેલ બની જાય એ સંભવિત છે.

દરો તારી કોઈમાં છે. જીતવું કે હારવું એનો નિર્ણય તારે કરવાનો છે.

## ધર્મશ્રવણે યત્નઃ સતતં કાર્યો બહુશુતસમીપે હિતકાંદ્ધિભર્નસિંહૈઃ ।

– પોડશક - ૧૬

દરિદ્ર માણસ

સંપત્તિ માટે કઈ પળે પ્રયત્નશીલ નથી હોતો એ પ્રશ્ન છે.

રોગી માણસ

ઔષધસેવન માટે કઈ પળે જાગ્રત નથી હોતો એ પ્રશ્ન છે.

ગાઢ જંગલમાં

ભૂલો પડી ગયેલ માણસ કઈ પળે રસ્તો શોધવા

ફાંફાં મારતો નથી હોતો એ પ્રશ્ન છે.

અંધ માણસ

કઈ પળે આંખવાળાનો હાથ પકડવા તૈયાર નથી હોતો એ પ્રશ્ન છે.

મુનિ !

સાચે જ જો તું કર્મમુક્ત બનવા માગે છે,

કષાયમુક્ત બનવા માગે છે, દોષમુક્ત બનવા માગે છે,

તો તારે એક જ કામ કરવા જેવું છે.

ધર્મશ્રવણમાં યત્ન ! કારણ ?

કર્મબંધનાં કારણોની જાણકારી તને ધર્મશ્રવણથી જ મળશે.

કષાયોના જાલિમ વિપાકોની જાણકારી તને ધર્મશ્રવણથી જ મળશે.

દોષોથી સર્જાતી અમૈત્રી, સંકલેશોની હારમાણા

વગેરેની વાસ્તવિક સમજણ તને ધર્મશ્રવણથી જ મળશે.

પણ સબૂર !

દરિદ્ર માણસ સંપત્તિ પ્રાપ્તિના ઉપાયોની જાણકારી

મેળવવા જો શ્રીમંત પાસે જ જાય છે, બિભારી પાસે નહીં

રોગી માણસ ઔષધોની સમજ મેળવવા જો ડૉક્ટર પાસે જ જાય છે,

હજામ પાસે નહીં.

ગુમરાહ માણસ રસ્તાની જાણકારી મેળવવા જો માર્ગજ્ઞને જ શોધે છે.

અલેલટપુને નહીં.

અંધ માણસ પોતાનો હાથ ચક્ષુભ્રાનના હાથમાં મૂકવા જો તૈયાર થાય છે, અંધના હાથમાં નહીં તો એ જ ન્યાયે ધર્મશ્રવણ માટે તારે કોક બહુશુતના

ચરણમાં જ બેસવાનું છે

ગમે તેવા અગીતાર્થના કે પોતાની જાતને વિદ્ધાન માની બેઠેલાના ચરણમાં નહીં.

જવાબ આપ તું.

શ્રવણના ક્ષેત્રે તને સ્વપ્રશંસાશ્રવણમાં,

પરનિંદશ્રવણમાં, વિકથાશ્રવણમાં કે

બહિર્ભવપોષક શ્રવણમાં રસ નથી જ એવું તું

ઇતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં છે ખરો ?

જો આ પ્રશ્નનો તારો જવાબ ‘ના’માં હોય

તો અમારે તને કહેવું છે કે તારું ભાવિ તો અંધકારમય છે જ

પરંતુ તારું વર્તમાન સંયમજીવન પણ

માત્ર સમય પસાર કરનારું જ કે

જવન પૂરું કરનારું જ બની રહેવાનું છે.

કારણ ? કામ વિનાનો સંસારી માણસ જેમ

રખડતો રહીને જ જીવન પૂરું કરી દેતો હોય છે

તેમ સ્વાધ્યાયના રસ વિનાનો સંયમી

સંયમઘાતક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને જ પોતાનું

સંયમજીવન પૂરું કરી દેતો હોય છે.

એટલું જ કહીએ છીએ અમે તને કે પરલોકને બરબાદ કરતા અને

સંયમજીવનને કૂચા બનાવી દેતા આ ગલત રાહેથી

તું અત્યારે ને અત્યારે જ પાછો ફરી જા.

યત્ન ધર્મશ્રવણમાં જ અને એ ય સતત !

અને એ ધર્મશ્રવણ પણ બહુશુત સમીપમાં જ ! તારો બેડો પાર છે !

## ભક્તિવ્ય: નિરાસ્વાદ એવ વાલુકાકવલ: શ્રામણ્યમ् ।

— સમરાઈચ્યકહા

બાળક નાનું, અને દવા કડવી,  
એ પ્રસન્નતાથી દવા લેવા તૈયાર થઈ જાય એવી શક્યતા કેટલી ?  
લગભગ નહીં.  
પગ ખુલ્લા અને રસ્તો કાંઠાથી વ્યાપ્ત,  
એ રસ્તો મદાનગી સાથે પ્રસન્નતાપૂર્વક ચાલવા  
કોઈ યુવક તૈયાર થઈ જાય એ શક્યતા કેટલી ?  
લગભગ નહીં.  
મુનિ ! ભલે તેં કોઈ પણ કારણસર શ્રમણજીવન  
અંગીકાર તો કરી લીધું છે પણ  
સ્પષ્ટ શબ્દોમાં અમે તને કહીએ છીએ કે  
રેતીના કણિયાઓ તો તે જોયા છે ને ?  
એ હોય છે સર્વથા સ્વાદહીન.  
પેટમાં એ રેતીના કણિયાઓ પદ્ધરાવતા રહેવાનું  
જેટલું કઠિન અને ત્રાસદાયક હોય છે,  
તારી પાસે રહેલ સંયમજીવન એટલું જ કઠિન અને કષ્ટદાયક છે.  
જિંદગીભર એ જ ગુરુ,  
એ જ સહવર્તિઓ,  
એ જ સ્વાધ્યાય,  
એ જ કિયા,  
એ જ વિહાર,  
એ જ લોચ,  
એ જ પરિસહો અને એ જ ઉપસગ્નો.

શરીરને બહેકાવતા રહેવાની કોઈ વાત નહીં.  
મનને બહેલાવતા રહેવાની કોઈ આજી નહીં.  
ક્યારેય ન અનુભવેલા આત્મસુખને  
અનુભૂતિનો વિષય બનાવવા જિંદગીભર જ્ઞૂમતા રહેવાનું  
અને જનમજનમ અનુભવેલા શરીરનાં અને મનનાં  
સુખો સામે લાલ આંખ કરતા રહેવાનું.  
અહંને તોડવા રહેવાનું અને  
સમર્પણભાવને જીવનમંત્ર બનાવતા રહેવાનું.  
અનુકૂળતાને તરછોડતા રહેવાનું અને  
પ્રતિકૂળતાને સત્કારતા રહેવાનું.  
શું આ બધું તું બચ્યાનાં ખેલ માને છે ?  
આ બધાયને તું શું સરળ અને આનંદદાયક માને છે ?  
ના, આ બધું ય કઠિન છે,  
કષ્ટદાયક છે અને સાથોસાથ બેસ્વાદ પણ છે.  
પણ સબૂર ! આનો અર્થ એવો ન સમજતો કે  
સંયમજીવનને છોડીને તારે પુનઃ સંસારમાં આવી જવાનું છે કે  
હતાશા સાથે તારે આ જીવન પૂરું કરી દેવાનું છે.  
દર્દની વેદનાથી ત્રાસેલો દર્દી જો દર્દમુક્ત બનવા માટે  
કઠોરમાં કઠોર અને કડકમાં કડક  
નિયંત્રણો પણ જો પ્રસન્નતાપૂર્વક સ્વીકારીને જ રહે છે  
તો દોષોના અને કષાયોના અપાયોથી  
ત્રાહિમામૂ પોકારી ઊઠિલો સાધક એ તમામ અપાયોથી આત્માને મુક્ત કરવા  
કઠિનમાં કઠિન અને કડકમાં કડક પ્રભુઆજ્ઞાજ્ઞન્ય  
નિયંત્રણો સ્વીકારી જ લેતો હોય છે. અમે તને એટલું જ કહીએ છીએ કે  
આવા સાધકમાં તારો નંબર લગાડી દેવામાં તું જો સફળ બની ગયો તો  
રેતીના કણિયાવાળા કોણિયાઓ પેટમાં પદ્ધરાવવા  
જેવું બેસ્વાદ પણ શ્રમણપણું તને જામ્યા વિના નહીં જ રહે.  
અને જામી જતું એ શ્રમણપણું તારા  
જનમજનમના સંસારપરિભ્રમણના થાકને ઉતારી નાખનારું  
બની ગયા વિના નહીં જ રહે.

## આપદ: ઉપકારિણી

— સમરાઈચ્યકહા

ચાકડા પર તૈયાર થયેલ ઘડાને કુંભાર જ્યારે અભિનમાં નાખે છે ત્યારે  
એ અભિન ઘડાને માટે ઉપકારક જ પુરવાર થાય છે ને ?

કારણ કે અભિનમાં ગયા વિના જ  
ઘડો જો સીધો બજારમાં ગયો હોત અથવા તો  
સીધું જ એમાં જો પાણી ભરવામાં આવ્યું હોત તો  
એ ઘડો ગણતરીની પળોમાં જ હતો-ન હતો થઈ ગયો હોત !  
ટાંકણાના માર ખાવાથી પથર જો દૂર જ રહે છે તો એ પથરના  
નરીબમાં રહેલ પ્રતિમા બનવાનું સદ્ગુરીય રોળાઈ જાય છે.  
મુનિ ! આત્માના પ્રદેશ પ્રદેશ પર ચોટેલી  
અનંત અનંત કાર્મણ વર્ગજીથી તારે કાયમી છૃટકારો મેળવવો છે ને ?  
એક જ શાસમાં અઠાર વાર જન્મ લેવો પડે અને સતત વાર મરવું પડે  
એવી નિગોદગતિની મુલાકાત લેતા રહેવાના દુર્ભાગ્ય પર  
તારે કાયમનું પૂર્ણવિરામ મૂકી દેવું છે ને ?  
જ ગતિનાં દુઃખોનું વર્ણન સાંભળવા માત્રથી  
તારા જાડા-પેશાબ છૂટી જાય તેમ છે  
એ નરકગતિની મુલાકાતે જવાનું તારે કાયમ માટે સ્થગિત કરી દેવું છે ને ?  
સમરીના જડબામાં ચવાઈ જતો સર્પ,  
બિલારીના જડબામાં ચવાઈ જતો ઉદર,  
કૂતરાના જડબામાં ચવાઈ જતું કબૂતર,  
સિંહના જડબામાં ચવાઈ જતું હરણ અને  
કસાઈની છરી નીચે કપાઈ જતા ગાય-બળદ-ભેંસ-બકરા-પાડા અને વાંદરા.  
આમાંના એક પણ અવતારમાં તારે જન્મ ક્યારેય ન જ

લેવો પડે એ સ્થિતિનું નિર્માણ કરવું છે ને ?  
જ્યાં જન્મ લઈને સંડાસો સાફ કરવા પડે,  
શેઠિયાઓની ગાળો ખાવી પડે,  
બટકું રોટલા માટે ટળવળતા રહેવું પડે, અપમાનો વેઠતા રહેવું પડે,  
મરવાની આશામાં જ જીવન વીતાવતા રહેવું પડે  
એવા માનવના અવતારો પર પણ તું કાયમની  
ચોકડી લાગી જાય એવું ઈચ્છે છે ને ?  
તો એનો એક માત્ર ઉપાય તું જાણી લે.

તારી પાસે જે સંયમજીવન છે એ સંયમજીવનમાં  
જેટલી પણ પ્રતિકૂળતાઓ આવતી રહે વાતાવરણની,  
જે પણ વસ્તુઓ પડતી રહે વિપરીત અને  
જે પણ કષ્ટો આવતા રહે વ્યક્તિઓ તરફથી  
એ તમામને તારી તમામ તાકાતથી તું સહન કરતો જ રહે.  
એ તમામ તકલીફી-આપત્તિઓ-કષ્ટો અને  
પ્રતિકૂળતાઓ એકાંતે તારા માટે ઉપકારક જ બન્યા રહેવાના છે.  
તારા જ્યાલમાં તો છે ને તત્ત્વાર્થસૂત્રની આ પંડિત ?  
'માર્ગાચ્ચયવન-નિર્જરાર્થ પરિષોઢવ્યા પરિસહા:'  
મોક્ષમાર્ગ પર તું જો ટકી જવા માગે છે,  
અનંત અનંત કર્માની તું જો નિર્જરા કરવા માગે છે,  
કર્માથી જો તું હળવો કૂલ થઈ જવા માગે છે  
તો એના માટે 'સહન કરી લેવા' સિવાય  
તારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.'  
શું કહીએ તને ? ભૂતકાળના અનંત ભવોમાં તેં દુઃખો ઓછા સહન  
નથી કર્યા. પણ ભાવિ અનંતકાળને તું જો એવો જ  
બિદામણો ન બનાવવા માગતો હોય તો  
તારા વર્તમાનને તું કષ્ટસભર રાખતો જા.  
કાટવાળું લોખંડ ઑસિડમાં જેટલો વધુ સમય પડ્યું  
રહે છે, એ શીધ કાટમુકત થતું જાય છે.  
પ્રસન્નતાપૂર્વક તું જેટલાં વધુ કષ્ટો વેઠતો રહીશ  
તું એટલો શીધ કર્મમુક્ત બનતો જઈશ.

## સર્વદુ:ખાના મૂલમ સ્નેહ: ।

— સમરાઈચ્યકહા

રોગનું મૂળ છે પેટનો બગાડો.  
તકલીફોનું મૂળ છે દરિક્રિતા.  
કલેશ-કંકાસનું મૂળ છે  
બરદ્ધટ ભાપાપ્રયોગ.  
મૂર્ખતાનું મૂળ છે બુદ્ધિની જડતા.  
પાગલતાનું મૂળ છે બુદ્ધિની મંદતા પણ  
મુનિ !  
સઘળાં ય દુઃખોનું કોઈ એક જ ઉદ્ગમસ્થાન હોય તો એ છે સ્નેહ.  
આ સ્નેહને તું રાગનું નામ આપતો હોય કે  
આકર્ષણું નામ આપતો હોય,  
વાસનાનું નામ આપતો હોય કે  
આવેગનું નામ આપતો હોય,  
એની સામે અમારો કોઈ જ વાંધો નથી.  
અમે તો તને એટલું જ કહેવા માગીએ છીએ કે  
કપડાં પર લાગી ગયેલ ધીનો ડાધ  
દૂર થતાંની સાથે જ એ કપડું જેમ  
વાતાવરણમાંની ધૂળને પોતાના તરફ ખેંચવાનું  
બંધ કરી દે છે તેમ  
તારા મનને સ્નેહમુક્ત બનાવવામાં તું જેવો સફળ બનતો જઈશ,  
એ જ પણે તારા આત્મા પર  
વાતાવરણમાં રહેલ કાર્મણ વર્ગણાઓ ચોંટવાની બંધ થવા લાગશે.  
દુઃખની વાત છે કે આ જગતના જીવો દુઃખમુક્ત બનવા માગે છે

પણ રાગમુક્ત બનવા નથી માગતા.  
આગની નજીક રહેવું છે અને ગરમીથી બચી જવું છે ?  
ગટરની બાજુમાં રહેવું છે અને દુર્ગધથી બચી જવું છે ?  
ધુમાડાવાળા વાતાવરણમાં રહેવું છે  
અને શાસની તકલીફથી બચી જવું છે ?  
એ બધું ય જો અસંભવ છે તો મનને રાગભાવમાં રમતું રાખીને  
આત્માને દુઃખોનો શિકાર બનતો અટકાવવો  
એ ય સર્વથા અસંભવિત જ છે.  
યાદ રાખજે તું.  
વીતરાગ બન્યા વિના સર્વજ બની શકતું નથી અને  
કખાયભાવથી મુક્ત બન્યા વિના  
વીતરાગ બની શકતું નથી.  
સ્વરૂપની ઓળખાણ વિના  
કખાયસેવનથી બચી શકતું નથી અને  
બહિર્ભવોમાંથી મનને બહાર લાવ્યા વિના  
સ્વરૂપની ઓળખ શક્ય નથી.  
પ્રલોભનોથી બચતા રહ્યા વિના  
મનને બહિર્ભવોના આકર્ષણથી મુક્ત રાખવું શક્ય નથી અને  
મન સાથે સંધર્ષ ખેલતા રહ્યા વિના  
પ્રલોભનોથી ભાગતા રહેવા મનને તૈયાર કરવું શક્ય નથી.  
સો વાતની એક વાત.  
વિષયુક્ત મોદક સ્વાદમાં ગમે તેટલો મીઠો હોય  
તો ય મોતથી બચવા માટે એ મોદકથી દૂર રહેવું જરૂરી જ છે તો  
સ્નેહભાવ મનને ગમે તેટલો મીઠો લાગતો હોય  
તો ય આત્માને દુઃખોથી બચાવતો રહેવા માટે,  
દુર્ગતિની યાત્રાએ જતો રોકવા માટે  
મનને સ્નેહભાવનું શિકાર બનતું રોકવા જેવું જ છે.  
યાદ રાખજે તું. દેખના અનિથી મનને મુક્ત રાખવામાં  
કોઈ જ તકલીફ પડવાની નથી. રાગના હિમથી  
મનને દૂર રાખતાં નવનેજાં પાણી ઊતરી જવાનું છે.

## સિદ્ધિવધૂનિર્ભાડનુરાગસમાગમચિન્તાદુર્બલ: સાધુ: ।

— સમરાઈચ્યકહા

કાળજાળ મોંઘવારી,  
દૂંકી આવક, પરિવાર મોટો.  
ચિંતામાં ને ચિંતામાં એનું શરીર સુકાતું ચાલ્યું.  
વરસોથી જે યુવતી પ્રત્યે એને લગાવ હતો  
એ યુવતી બે વરસ માટે અમેરિકા ચાલી ગઈ.  
એની સ્મૃતિમાં ને સ્મૃતિમાં એનું શરીર ઘસાતું ચાલ્યું.  
એક બાજુ સામે લીલુછિમ ધાસ અને બીજી બાજુ સામે વાધ.  
ધાસ ખાતા રહેવા છતાં બકરીનું શરીર સુકાતું જ ચાલ્યું.  
મુનિ !  
તું અને નિશ્ચિત ?  
તું અને મસ્ત ?  
તું અને બળવાન ?  
એ બની જ શકે કેવી રીતે ?  
સિદ્ધિવધૂ સાથે વિવાહ કરવા તો તું સંસાર સમસ્તનો  
ત્યાગ કરીને નીકળી પડ્યો છે સાધના માર્ગે.  
માતા-પિતાદિ સ્વજનોને તો તો છોડ્યા જ છે  
પરંતુ પાંચે ય ઠિન્દ્યોના વિષયોને પણ તેં તરછોડ્યા છે.  
શરીરની સુખશીલતા સામે તો તો બળવો પોકાર્યો જ છે  
પરંતુ મનની સ્વચ્છંદવૃત્તિ સામે ય તું જંગે ચડ્યો છે.  
એક જ ખ્વાબ છે તારું.  
હું ક્યારે સિદ્ધિવધૂને વરી લઈ ?  
જ્યાં સુધી તારું એ ખ્વાબ સફળ થતું નથી

ત્યાં સુધી તારા શિરે કેટકેટલી મુશ્કેલીઓ  
ગ્રાટકવાની સંભાવના ઊભી છે  
એનો તને બરાબર ખ્યાલ છે જ.  
મુક્તિ નથી મળતી ત્યાં સુધી આત્માને સંસારમાં રહેવું પડે છે અને  
સંસારમાં રહેવું પડે છે એનો અર્થ ?  
સંસારની ચારેય ગતિઓમાં રખડતા રહેવું પડે છે.  
દુઃખપ્રધાન નરકગતિ,  
વિવેકહીન તિર્યંગતિ,  
મૂઢપ્રધાન દેવગતિ અને પુણ્યહીન માનવગતિ.  
આ ચારે ય ગતિઓમાં આત્માને સતત ભટક્યા જ કરવું પડે છે.  
છે શું આ ચારેય ગતિઓમાં ?  
કાં તો દુઃખો અને  
કાં તો દુઃખોનું રિઝર્વેશન કરી આપે તેવાં સુખો !  
ક્યાંય સ્વસ્થતા નથી,  
ક્યાંય સ્થિરતા નથી અને ક્યાંય શાંતિ નથી.  
આવા દુઃખમય સંસારમાં રહેવા છતાં ય તું જો સ્વસ્થ હોય,  
તારી તબિયત મસ્ત હોય,  
તારા શરીરની સાતે ય ધાતુઓ જો સતેજ હોય  
તો એનો અર્થ એટલો જ છે કે  
કાં તો તને સંસારની ભયંકરતાનો કોઈ અંદાજ નથી  
અને કાં તો મુક્તિસુખની ભદ્રકરતા તારી નજરમાં નથી.  
શું કહીએ તને ?  
મોહવિજેતા પરમાત્માની તું ઉપાસના કરતો જ.  
એ તારકની મોહનાશક આજ્ઞાઓનું તું પાલન કરતો જા.  
સુખના અનંતકાળના તારા બોગસ અનુભવોને  
એક બાજુ રાખી દઈને  
મુક્તિસુખના અનુભવને આત્મસાત્ કરી લેવા તું કટિબદ્ધ બનતો જ.  
અમે તને ખાતરી સાથે કહીએ છીએ કે  
એ સુખનું આકર્ષણ તારા મનમાં ઊભું થઈ ગયા પછી  
તું શાંતિથી સૂર્ય નહીં શકે.

## સ્તુત્યા સ્મયો ન કાર્ય: ।

— અધ્યાત્મસાર

બું પોતાને પાણીથી ભરી દેવા બદલ  
નળની ભલેને ગમે તેટલી પ્રશંસા કરે છે  
પરંતુ નળ એ પ્રશંસામાં જરાય લેવાઈ જતો નથી  
કારણ કે એને બરાબર ખ્યાલ હોય છે કે બેડાને પાણી ભલે  
મારાથી મળ્યું છે પરંતુ  
મને તો પાણી ટાંકી તરફથી જ મળ્યું છે.  
જો ટાંકીએ મારામાં પાણી વહાવવાની  
ઉદારતા ન કરી હોત તો બેડાને  
મારા તરફથી પાણી ક્યાંથી મળી શક્યું હોત ?  
મુનિ !  
બની શકે કે તારી પાસે તપશ્ચર્યાની પ્રચંડ મૂડી હોય,  
સ્વાધ્યાયનો જબરદસ્ત વૈભવ હોય,  
મસ્ત લેખનકળા હોય,  
આકર્ષક વકૃતૃત્વકળા હોય,  
હૃદય તારું પ્રેમાળ હોય,  
મન તારું સરળ હોય,  
સ્વભાવ તારો શીતળ હોય  
અને એના કારણે તારા પસ્તિયમાં  
આવનારા સહુ તારી દિલ દઈને પ્રશંસા કરતા હોય  
તો ય અમારે તને એટલું જ કહેવું છે કે  
એ પ્રશંસાથી તું તારા આહંને પુષ્ટ ન કરતો.  
એ સુતિના શષ્ઠોથી તું કુલાઈ ન જતો.

આદર-સત્કાર અને બહુમાનને તું  
તારી તાકાત કે તારી પાત્રતા સમજ ન બેસતો.

કારણ ?

તારી પાસે જે પણ શક્તિ કે સદ્ગુણો છે  
એ બધાય દેખાતા હોય ભલે તારામાં  
પણ એ બધા ય તને મળ્યા છે પ્રભુની અનંત  
કરુણાના પ્રભાવે !

તારામાં રહેલ શક્તિ કે સદ્ગુણો એ છે પાણીના સ્થાને.  
તું પોતે છે નળના સ્થાને.

જ્યારે ટાંકીના સ્થાને પ્રભુ છે.

તારું અલ્ય પણ પુણ્ય કે મામૂલી પણ ગુણ  
એ પ્રભુની જ કરુણાનું ફળ છે એ બાબતમાં  
તું લેશ પણ શંકા ન કરતો.

વાંચી તો છે ને શક્તિ-સદ્ગુણના કેન્દ્રમાં

રહેલ પ્રભુની જ કરુણાને વર્ણવતી આ બધી પંક્તિઓ તેં ?

‘ઈતની ભૂમિ તુમહી આઙ્યો’

આ વાત કરી છે પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજ મહારાજે.

‘એકોડપિ શુભમાવ: ભગવત્પ્રસાદ લભ્યત્વાત’

આ વાત કરી છે ઉપમિતિભવ પ્રપંચ ગ્રંથમાં  
શ્રી સિદ્ધનિઃ ગણિ મહારાજે.

‘ભગવત્પ્રસાદેવાહં ઇયતીં પ્રાપિતો ભુવમ्’

આ વાત જજાવી છે વિતરાગસ્તોત્રમાં

કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે.

આ તમામ વાતોનો સૂર એક જ છે.

તારા જીવનમાં દુઃખ-દોષ કે દુર્ભુદ્ધિનો

જે પણ ઉકરડો છે એ તારું જ પોતાનું સર્જન છે

તો તારા જીવનમાં સુખ-સદ્ગુણ-સદ્ભુદ્ધિનો

જે પણ બગીયો છે એ પ્રભુ તરફથી તને મળેલ ઉત્તમ ઉપહાર છે.

કરવા દે બેડાને [જગતને] નળની [તારી] પ્રશંસા

નળે [તારે] પોતાની ખોપરી ડેકાણો જ રાખવાની છે.

## આલાપૈ: દુર્જનસ્ય ન દ્વેષમ् ।

— અધ્યાત્મસાર

પવનનો સહારો લઈને

પોતાના તરફ આવી રહેલ ઘૂળને જોઈને સૂર્ય એના તરફ દ્વેષ કરશે ?

અસંભવ !

પવનની પીઠ પર સવાર થઈને

ભલેને ગટરની દુર્ગધ ઝૂલ પર હુમલો કરે છે.

ઝૂલ લેશ સ્વસ્થતા ગુમાવ્યા વિના

પોતાની સુવાસ પ્રસરાવવાની યોગ્યતા જાળવી જ રાખે છે.

મુનિ ! આ તો સંસાર છે.

અહીં સંત-શોતાન, સજજન-દુર્જન, પુણ્યવાન-પાપી બધા જ છે.

કોકને સામી વ્યક્તિત્વમાં રહેલ સદ્ગુણો જ

દેખાતા હોય છે તો કોકને સામી વ્યક્તિત્વમાં ધુપાઈને

રહેલા દુર્ગુણો જ શોધતા રહેવામાં રસ હોય છે.

કોક સાંદું જોવા માટે અંધ હોય છે તો

કોક ખરાબ સાંભળવા માટે બધિર હોય છે.

કોકને સદ્ગુણની સુવાસની એલજી હોય છે તો

કોકને દુર્ગુણની દુર્ગધ વિના ચેન પડતું નથી હોતું.

આવી વિચિત્ર અને વિપરીત સ્વભાવ ધરાવતી

વ્યક્તિત્વો વચ્ચે રહેતા તારે ક્યારેક

દુર્જનોનાં વચ્ચો સાંભળવાના આવે પણ ખરા,

દુર્જનોની ટીકાના શિકાર તારે ક્યારેક બનવું પણ પડે.

અમે તને એટલું જ કહીએ છીએ કે એવા પ્રસંગે ય

તું એ દુર્જનો પર દ્વેષ ન કરી બેસતો.

તારા મનને એ દુર્જનો પ્રત્યેના દુર્ભાવથી ગ્રસિત ન બનાવી બેસતો.

એક વાતનો તને ઘ્યાલ છે ખરો કે

ધરને આગ લાગી હોય છે ત્યારે એ આગને

દારવા દુશ્મન માણસ પણ જો પાણી લઈને

આવે છે તો ડાહો માણસ એ દુશ્મનને પણ આવકારતો હોય છે.

કારણ ? એને પોતાનું ધર બચાવવું હોય છે.

એને પોતાનું ધર ગમતું હોય છે.

અમે તને આ જ વાત કરીએ છીએ.

તારો આત્મા તને ખૂબ ગમે છે ને ?

શરીર કરતા ય વધુ ગમે છે ને ?

મન કરતા ય વધુ ગમે છે ને ?

તું એને દુર્ગતિમાં ઘકેલવા નથી માગતો ને ?

તું એને દુઃખોનો શિકાર બનાવવા નથી માગતો ને

તું એનું સંસાર પરિભ્રમણ અકબંધ રાખવા નથી માગતો ને ?

તો એક જ કામ કર. તે જે સંયમજીવન અંગીકાર કર્યું છે

એ જીવનમાં જે પણ તકલીફો આવે,

અગવડો આવે, અપમાનો વેઠવાં પડે

એ તમામનો તું પ્રસનાતાપૂર્વક સ્વીકાર કરતો જા.

એ અપમાનો જેમના પણ તરફથી થતાં હોય

એ તમામ પ્રત્યેના સદ્ભાવને અકબંધ રાખતો જા.

આખરે તું તો મુનિ છે ને ?

જીવમાત્રનો કેવળ રક્ષક જ નહીં, ચાહક પણ !

જીવમાત્રનો તું ઉપકારી જ નહીં, સહકારી પણ !

એક માતા બનેલ સ્ત્રી પોતાના બાળકના તમામ અપરાધોને ભૂલી જઈને

પણ જો એના પ્રત્યેના સ્નેહભાવને ટકાવી રાખે છે

તો જગતના જીવમાત્રની માતા બનવાની જવાબદારી સ્વીકારી બેઠેલો તું અને

અષ્ટપ્રવચન માતાના ખોળામાં ઉછરી રહેલો તું

કોઈ પણ જીવના, ગમે તેવા કટુ વ્યવહાર પછી ય

એના પ્રત્યેના સદ્ભાવને અકબંધ રાખી બેસતો હોય

તો એમાં તું કાંઈ ‘નવું’ નથી કરતો કારણ કે મુનિનો એ જ સ્વભાવ હોય છે !

## ન વિશ્વાસ્યો પ્રમાદરિપુઃ ।

— અધ્યાત્મસાર

પાણી ઢાળનો વિશ્વાસ કરશે ?  
 પેટ્રોલ આગનો વિશ્વાસ કરશે ?  
 દેડકો સર્પનો વિશ્વાસ કરશે ?  
 સંગ્રહણીનો દર્દી દૂધનો વિશ્વાસ કરશે ?  
 કરોડપતિ શ્રીમંત એક નંબરના ગુંડાનો વિશ્વાસ કરશે ?  
 હરગિજ નહીં. કારણ ?  
 પાણી ઢાળને પામીને નીચે ઉતરી જશે.  
 પેટ્રોલ આગને પામીને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશે.  
 દેડકો સાપને પામીને જીવનને હાથથી ગુમાવી બેસશે.  
 સંગ્રહણીનો દર્દી દૂધના શરણે જઈને પોતાનું સ્વાસ્થ્ય  
 વધુ બગાડી બેસશે.  
 કરોડપતિ શ્રીમંત ગુંડાના સકંજામાં આવીને પોતાની  
 સંપત્તિ ગુમાવી બેસશે.  
 મુનિ !  
 સદ્ગુણોનો ચાહક તું, સમાધિનો ઈચ્છુક તું,  
 સદ્ગતિનો પ્રેમી તું, પરમગતિનો આશક તું,  
 સંયમજીવનનો ધારક તું  
 પ્રમાદરૂપી શત્રુનો જો વિશ્વાસ કરે છે  
 તો અમે તને કહીએ છીએ કે  
 તું આત્મધાતના રસ્તે કદમ માંડી ચૂક્યો છે.  
 તારા સદ્ગુણોની સ્મરણયાત્રા નીકળી જ ચૂકી છે.  
 સદ્ગતિગમનની તારી શક્યતા પર સામે ચડીને

ચોકડી મૂકી દેવા તેં હાથ ઉઠાવી જ લીધા છે.  
 પરમગતિની પ્રાપ્તિના તારા સ્વભને તેં ચકનાચુર  
 કરી દેવા દઢ નિશ્ચય કરી લીધો છે.  
 જે પ્રમાદ ચૌદ પૂર્વાઓને પણ નિગોદમાં ઘકેલી દીધા છે,  
 લભ્યધરોને માટે પણ નરકગતિના દરવાજા ખોલી દીધા છે,  
 પ્રભાવક પ્રવચનકારોને અને મહાક્ષાણીઓને પણ,  
 ધોર તપસ્વીઓને અને લાખો શ્વોકોના સર્જકોને પણ  
 દુર્ગતિમાં ઘકેલી દીધા છે એ પ્રમાદને  
 તું જો મામૂલી માની બેઠો હોય કે તુચ્છ માની બેઠો હોય તો  
 નિશ્ચિત સમજી રાખજે કે તારા સંયમજીવનને તું હારી જ ચૂક્યો છે.  
 અને એક વાતનો તો તું જવાબ આપ.  
 ચૌદ પૂર્વધરોના જ્ઞાનની સામે  
 તારી પાસે જ્ઞાનનો વૈભવ કેટલો છે ?  
 લભ્યધરોની લભ્યાઓની સામે તારી પાસે લભ્યના નામે છે શું ?  
 ધોર તપસ્વીઓની સામે તારી પાસે તપ કેટલો છે ?  
 ધુરંધર પ્રવચનકારોની પ્રયંડ પ્રવચનશક્તિ સામે  
 તારી પાસે રહેલ પ્રવચનશક્તિ કેવી છે ?  
 વિશુદ્ધ સંયમીઓની જાગૃતિ સામે તારી પાસે જાગૃતિ છે કેવી ?  
 એક જ વાક્યમાં અમે તને અનો જવાબ આપી  
 દઈએ તો સંયમક્ષેત્રે એ સહુનાં નામો  
 જો કરોડપતિમાં ગોઠવી શકાય તો  
 તારું નામ તો બિખારીમાં જ આવી શકે.  
 પ્રમાદરૂપી શત્રુએ એ કરોડપતિઓને પણ જો  
 ચીથરેહાલ બનાવીને પરલોકમાં રવાના કરી દીધા  
 તો એ પ્રમાદશત્રુ તારા જેવા  
 બિખારીની તો કેવી રેવરી દાણાદાણ કરી નાખશે  
 એની તું પોતે જ કલ્પના કરી જોજે.  
 એટલું જ કહીએ છીએ તને. હારની બાળને જતમાં  
 પલટાવી નાખવી હજ્ય તારા હાથમાં છે.  
 પ્રમાદશત્રુને જીવનમાંથી દેશવટો આપી દે.

## ન હિ હેતુવિનાશં વિના ફલવિનાશः ।

— શ્રાવકધર્મવિધિ પ્રકરણ

દહીં ખાતા રહેવું છે અને  
છાતીને કફુક્ત રાખવામાં સફળતા મેળવવી છે ?  
સંભવ જ નથી.  
તેજ ગતિથી દોડતા રહેવું છે અને  
હંફ ચે જ નહીં એ સ્થિતિ અનુભવતા રહેવું છે ?  
સંભવિત જ નથી.  
બારી-બારણાં બધા જ ખુલ્લાં રાખવા છે અને  
ધૂળને ધરમાં પ્રવેશતા અટકાવવામાં સફળ બનવું છે ?  
શક્ય જ નથી.  
પુષ્પ હાજર છે અને સુવાસની અનુભૂતિથી વંચિત રહેવું પડશે ?  
નહીં જ બને.  
હાથમાં લાખ રૂપિયા છે અને  
વેપારી પાસેથી માલ ખરીદવામાં ફાવટ નહીં આવે ?  
નહીં જ બને.  
આનો અર્થ ?  
આ જ કે જ્યાં સુધી કારણ હાજર રહેશે ત્યાં સુધી કાર્ય બનતું જ રહેશે.  
ગલત કારણ હાજર હશે તો ગલત કાર્ય બનતું રહેશે.  
અને સમ્યક્ કારણ હાજર હશે તો સમ્યક્ કાર્ય બનતું રહેશે.  
મુનિ ! તું સર્વકર્મ ક્ષયના કાર્યને અનુભવવા માગે છે ને ?  
તને ઘ્યાલ છે ખરો કે કર્મબંધના કારણભૂત કષાયથી દૂર થયા વિના તું  
સર્વકર્મક્ષયના એ કાર્યને અનુભવનો વિષય  
બનાવવામાં સફળ નથી જ બનવાનો !

ધર્મરાધનાના ફળની બાબતમાં તારું મન શંકાશીલ રહ્યા કરે છે ને ?  
જો તારા જીવનમાં ધર્મરાધના ચાલુ છે જ તો  
એનું ફળ તને મળીને રહેવાનું જ છે.  
ટૂકમાં, ગલત કાર્યથી જાતને બચાવી લેવાનો,  
ગલત ફળથી તારી જાતને દૂર રાખવાનો એક જ વિકલ્પ છે.  
તું ગલત કારણથી દૂર થઈ જા.  
સારા કાર્યને અનુભવનો વિષય બનાવવાનો એક જ વિકલ્પ છે.  
તું સમ્યક્ કારણોનું સેવન કરતો જા.  
પણ સબૂર ! તારી પાસે કર્મબંધનાં અને કર્મક્ષયનાં  
કારણોની સમ્યક્ જાણકારી છે ખરી ?  
વ્યવહારનય અને નિશ્ચયનય,  
દ્રવ્ય સમ્યક્તવ અને ભાવસમ્યક્તવ,  
આચરણ અને અંતકરણ,  
દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા  
આ તમામના વાસ્તવિક સ્વરૂપની તારી પાસે જાણકારી છે ખરી ?  
જો ના, તો તારા લાખ પ્રયાસો પઢી ય તું  
તારા આત્માને કર્મબંધનો શિકાર બનતા  
અટકાવી શકવાનો નથી.  
વાંચી તો છે ને તેં આ પંક્તિ ?  
'પરપરિણાતિ અપની કર જાને,  
વરતે આરત ધ્યાને રે;  
બંધ-મોક્ષ કારણ ન પહ્યાને  
તે પહેલે ગુણાધોરે'  
શું કહીએ અમે તને ?  
આખું ય પ્રભુનું શાસન એ 'કારણ' જ છે !  
સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે.  
માર્ગનો અર્થ ?  
જે મંજિલે પહોંચાડવામાં સહાયક બને એ માર્ગ !  
તું મુક્તિની મંજિલે પહોંચવા માગે છે ને ?  
મોક્ષમાર્ગ પર કદમ રાખતો જા. ફાવી જઈશ.

## સાધવ: મહાવતોચ્ચારણ પ્રત્યહમુભયકાલ વિશેષસ્તુ પક્ષાન્તાદિષુ કુર્વન્તિ ।

— પદ્મીસૂત્ર

હોશિયાર વેપારી રોજ સરવૈયું નહીં મેળવે ?  
કુશળ ડૉક્ટર દઈને રોજ નહીં તપાસે ?  
યુવાન માણસ બહાર નીકળતા પહેલાં  
દર્પણમાં પોતાનું મુખ નહીં તપાસે ?  
મુનિ ! અપે તને પૂછીએ છીએ.  
જિંદગીભરને માટે જે મહાવતોનું પાલન કરવાનું તે  
અરિહંતાદિ પાંચની સાક્ષીએ હજારોની મેદની વચ્ચે કબૂલ કર્યું છે  
એ મહાવતોને તું રોજ સ્મૃતિપથ પર લાવે છે ખરો ?  
એ મહાવતોના ગંભીર અર્થોને તું તારી અનુપ્રેક્ષાના વિષય રોજ  
બનાવે છે ખરો ?  
જો ના, તો તુંમહાવતોના વિશુદ્ધ પાલનમાં  
સફળ બનીશ જ શી રીતે ?  
એક પણ જીવની વિરાધના મારે કયારેય કરવાની નથી  
આ પ્રતિજ્ઞા સ્મૃતિપથમાં રાખ્યા વિના  
સમિતિ-ગુપ્તિના પાલનમાં તને સફળતા મળશે  
કેવી રીતે ?  
અજાશતાં ય મારે જૂઠ બોલવાનું નથી  
આ પ્રતિજ્ઞાને યાદ રાખ્યા વિના  
તારી જાતને અસત્યોચ્ચારણથી બચાવવામાં તું  
સફળ બનીશ શી રીતે ?  
એક પણ પ્રકારનું અદત, મારે લેવાનું જ નથી  
આ પ્રતિજ્ઞાને સ્મૃતિનો વિષય બનાવતા રહ્યા વિના

આધાકમી ગોચરીના સ્વીકારથી કે ગુર્વજ્ઞાભંગથી,  
તારી જાતને તું બચાવી શકે એ વાતમાં કોઈ માલ નથી.  
અબ્રહના સેવનથી તો મારે દૂર રહેવાનું જ છે  
પરંતુ મનને અબ્રહના વિચારથી પણ મારે મુક્ત  
રાખવાનું છે આ પ્રતિજ્ઞાના સતત સ્મરણ વિના  
વિજાતીયના દર્શન માટે જાંવા નાખતી તારી આંખોને તું નિયંત્રણમાં  
રાખી શકીશ શી રીતે ?

વિજાતીયના દર્શન થઈ ગયા બાદ અથવા તો કરી લીધા બાદ  
મન ગંદી કલ્પનાઓમાં વિહરવા ન લાગે  
એ અંગે તું સાવધ રહી શકીશ શી રીતે ?

‘અધિક ઉપકરણો મારે રાખવાના નથી  
અને અલ્ય પણ ઉપકરણોમાં મારે મૂર્ખા રાખવાની  
નથી’ આ પ્રતિજ્ઞાના સતત સ્મરણ વિના તું સ્વજીવનને  
અધિક ઉપકરણના બોજાથી અને  
સ્વ-મનને મૂર્ખાના ધુમાડાથી મુક્ત શી રીતે રાખી શકીશ ?

યાદ છે તને ?  
રોજ તું સર્વપાપના ત્યાગને સૂચવતા  
‘કરેમિ ભંતે’ ને નવ વાર યાદ કરે છે.

કારણ ?  
‘પાપ મારે એક પણ કરવાનું નથી’  
એ તને સતત યાદ રહે એ માટે !  
તો હવે એક કામ કર.

રોજ સવાર-સાંજ પાંચેય મહાવતોનું ઉચ્ચારણ કરતો જા.  
કરેમિ ભંતે નવ વાર અને મહાવતોનું ઉચ્ચારણ બે વાર.  
અલબંત, આ બધું ય માત્ર જીબેશી જ ન કરી જતો.  
મનને પણ એમાં ભેળવજે.

અંત:કરણને પણ પાંચ મહાવતોની પચીસ ભાવનાઓથી વાસિત બનાવતો જાય.  
ચંદનથી વાસિત થઈ જતી લાકડાની પેટી જો દુર્ગધનો  
અનુભવ નથી જ કરાવી શકતી તો મહાવતોચ્ચારણથી  
ભાવિત થઈ જતું તારું અંત:કરણ પાપવાસનાને જન્મ નહીં જ આપી શકે !

## સર્વશુભાનુષ્ઠાન ગુરુતન્ત્રતા પ્રતિપાદનાર્થ ગુર્વમન્ત્રણમ् ।

— પદ્મીસૂત્ર

નોકરને શેઠની આજ્ઞામાં રહેવું પડે છે.  
સૈનિકને સેનાધિપતિની આજ્ઞા સ્વીકારવી પડે છે.  
ગયેડાને કુંભારની આજ્ઞા માનવી પડે છે.  
ખેલાડીને કોચની આજ્ઞા શિરોધાર્ય કરવી પડે છે.  
શિક્ષકની આજ્ઞામાં રહ્યા વિના વિદ્યાર્થીનો વિકાસ સંભવિત નથી.  
૧૪૪ મી કલમ અમલમાં હોય એ વખતે  
પોલીસની આજ્ઞામાં રહ્યા વિના પ્રજાજનની સલામતી નથી પણ  
મુનિ ! તારી તો આખી વાત જ ન્યારી છે.  
ગુરુની આજ્ઞામાં રહ્યા વિના તને ચેન જ નથી પડતું.  
ગુરુ તારા પર અધિકાર જમાવવા નથી પણ માગતા  
તો ય તારા જીવનના બધા જ અધિકારો ગુરુને  
સોંપી દીઘા વિના તારું મન પ્રસન્નતા નથી અનુભવતું.  
તારા પર અનુશાસન ચલાવવાનો ગુરુને કોઈ જ  
રસ નથી અને છતાં ગુરુ પ્રત્યેના પ્રબળ પ્રેમના  
કારણે તે સામે ચડીને પ્રસન્નતાપૂર્વક એમનું  
અનુશાસન સ્વીકારી લીધું છે અને એમાં જ તું આનંદિત છે.  
અમે ઓળખીએ છીએ તને.  
તારું ચાલે તો તું શાસ પણ ગુરુને પૂછીને જ  
લેવા માગે છે અને બગાસું ખાવા માટે પણ ગુરુની રજા જ લેવા માગે છે.  
કારણ ?  
એક જ. તું તારી જાતને અંધ માની રહ્યો છે.  
ગુરુના માર્ગદર્શન વિના તને ચેન શેનું પડે ?

તું તારી જાતને અસહાય માની રહ્યો છે.  
ગુરુનો આધાર લીધા વિના તને ચેન શેનું પડે ?  
તું તારી જાતને અંગ માની રહ્યો છે.  
ગુરુનો ટેકો લીધા વિના તને ચેન શેનું પડે ?  
શું કહીએ તને ?  
તારા હદ્યમાં ગુરુ પ્રત્યે જાગી ગયેલા સર્વોત્કૃષ્ણ  
બહુમાનભાવે તને ગુરુ પ્રત્યે એ હટે  
સમર્પિત બનાવી દીઘો છે કે તને આ જીવનમાં  
ગુરુ સિવાય બીજું કાઈ જ દેખાતું નથી  
અને બીજું કોઈ જ દેખાતું નથી.  
અને માત્ર તારા માટે જ નહીં,  
આ જીવનમાં પ્રવેશ કરતા પ્રત્યેક સાધક માટે આ જ કર્તવ્ય છે.  
આ જીવનના પ્રત્યેક શુભ અનુષ્ઠાનો ગુરુને જ આધીન છે.  
અને એટલે જ અનુષ્ઠાનના પ્રારંભમાં,  
મધ્યમાં અને અંતમાં વારંવાર  
ગુરુને સાધક આમંત્રણ આપતો જ રહે છે.  
એક વાતની અમે તને યાદ આપવા માગીએ છીએ  
કે આ જીવનમાં ગલત ઈચ્છાને પણ જ્યાં  
તારે સ્થાન આપવાનું નથી ત્યાં એ ઈચ્છાના  
અમલ માટે તો પ્રવૃત્ત થવાનો તારે પ્રશ્ન જ રહેતો નથી પરંતુ  
શુભ ઈચ્છાને સ્થાન આપ્યા પછી ય તારે એ  
ઈચ્છાને ગુરુચરણમાં મૂકી દેવાની છે.  
એમની પ્રસન્નતાપૂર્વકની અનુમતિ મળે  
તો જ એના અમલ માટે તારે પ્રવૃત્ત થવાનું છે,  
અન્યથા નહીં.  
ટૂકમાં, જીવન તારું છે, તારે જ જીવવાનું છે  
પણ એને કઈ રીતે જીવનું એનો નિર્ણય તારે ગુરુને સોંપી દેવાનો છે.  
અને આ સમર્પણ તારા જીવનમાં એટલા માટે સરળ છે કે  
ગુરુ પર તને ખૂબ જ પ્રેમ છે અને જ્યાં  
પ્રેમ હોય છે ત્યાં સમર્પણ તો આવાને જ રહે છે.

## એકામેવ હિ યતનાં સંસેવ્ય વિલીનકર્મમલપટલા: પ્રાપુરનન્તા: સત્ત્વા: શિવમક્ષયમવ્યાબાધમ् સ્થાનમ् ।

– સંબોધસિતરી

સમસ્ત ઓરડામાં વરસોથી વ્યાપ્ત અંધકારને  
ચીરી નાખવાનું કામ પ્રકાશનું એક કિરણ પણ કરી શકે છે.  
વરસોથી દરિદ્રતાજન્ય અગવડોને વેઠવાના  
ચાલી રહેલા દુઃખીય પર  
કાયમ માટે પૂર્વવિરામ મૂકી દેવાનો ચમત્કાર  
એક જ રૂપિયાની લૉટરીની એક ટિકિટ પણ કરી શકે છે.  
સંબંધોમાં પેદા થઈ ગયેલ વરસોની  
કડવાશની સ્મશાનયાત્રા કાઢી નાખવાનું કામ  
એક જ વખતનો મધુરો શબ્દપ્રયોગ કરી શકે છે.  
મુનિ !  
અનંત અનંત પુદ્ગલ પરાવર્ત તો તે અનાદિ નિગોદમાં વીતાવ્યા.  
ભવિતવ્યતાના યોગે એમાંથી તું બહાર નીકળ્યો  
એ પણી ય અસંખ્ય અસંખ્ય વરસો  
તે બાદર એકેન્દ્રિયમાં વીતાવ્યા.  
સંખ્યાતકાળ વિકલેન્દ્રિયમાં પસાર કર્યો.  
નરકાદિ ચારેય ગતિઓમાં તે જે કાળ વીતાવ્યો એ તો વધારામાં.  
આ કાળ દરમ્યાન તે બે જ કામો કર્યા છે.  
આત્માને કુસંસ્કારોથી ભારે કર્યો છે અને કર્માના બંધથી વ્યાપ કર્યો છે.  
આ બંનેને નામશોષ કરીને મુક્તિગતિમાં પહોંચી  
જવું આજે તો તારા માટે અશક્ય જેવું તને લાગતું  
હોય તો એમાં કોઈ નવાઈ નથી.  
કારણ ? પરમાત્મા મહાવીરદેવે કરેલ તપશ્ચયર્થોનો

સ્કોર તારી આંખ સામે છે.  
સાડા બાર વરસના સાધનાકાળમાં એ તારકે  
સાડા અગ્નિયાર વરસથી અધિક દિવસો તો  
અન્ન-જળ વિનાના પસાર કર્યા છે.  
લાગટ બે દિવસ એ તારકે ક્યારેય વાપર્યું નથી  
તો એક દિવસમાં બે વાર પણ એ તારકે ક્યારેય વાપર્યું નથી.  
આ તો થયો એમનો તપશ્ચયર્થનો સ્કોર પણ  
આ સિવાય એમણે વેઠેલ પરિસહ-ઉપસર્ગોની તો કોઈ વાત થાય એમ નથી.  
એમણે ટકાવી રાખેલ અપ્રમત્તાનું અને  
એમણે જાળવી રાખેલ ઉપશમભાવનું તો કોઈ વર્ણન થાય તેમ નથી.  
'જો તદ્દ્ભવ મુક્તિગામી એ તારકને પણ  
ઘાતીકર્માંથી છુટકારો મેળવવા આટાટલી  
જંગી સાધનાઓ કરવી પડી હોય તો  
સત્ત્વક્ષેત્રે લગભગ દેવાણું ફૂકી ચૂકેલા અને  
જગૃતક્ષેત્રે કંગાલિયત ભોગવી રહેલા  
મારા જેવા માટે તો એ સમ્યક્ પરિણામ અનુભવવું સર્વથા અશક્ય જ છે'  
એવું તને જો લાગતું હોય અને એના કારણે  
તું હતાશાનો શિકાર બની ગયો હોય તો  
અમે તને કહીએ છીએ કે એ ગલત માન્યતામાંથી અને હતાશામાંથી  
તું આજે ને આજે જ બહાર આવી જા.  
કારણ કે, એક માત્ર 'યતના' નો યોગ પણ જો તારી પાસે છે  
તો તું અધ્યાત્મજગતનો રાજી છે.  
અનંતા આત્માઓ આજસુધીમાં એક માત્ર  
યતનાના સહારે પોતાના આત્માને કર્મમુક્ત  
બનાવવામાં સફળતાને વરીને મુક્તિપદને પામી ચૂક્યા છે.  
આ વાસ્તવિકતા તું સતત આંખ સામે રાખજે.  
તપશ્ચયર્થિ અન્ય યોગોના ક્ષેત્રની દરિદ્રતા છીતાં તારી  
મુક્તિ સંભવિત છે જ જો યતના યોગની શ્રીમંતાઈનો તું માલિક છે તો !  
દશવૈકાલિક સૂત્રની આ પંક્તિ...જય ચરે....ને  
અમલી બનાવતો જા. તારો બેડો પાર થઈ જશે.

## કલેશવશનિર્મિતં ચ સુકૃતમપિ દુષ્કૃતાયતે ।

– સંદેહ દોલાવલી

લગડી સોનાની પણ એને ગરમ કરીને સામાને ભેટ આપવા તમે ગયા.

સામો માણસ એ લગડી સ્વીકારશે ખરો ?

હરગિજ નહીં.

થાળીમાં તમે એને મીઠાઈ પીરસી પણ

એ પીરસતાં ‘લો, બાળો તમારું પેટ’ એવા શબ્દો તમે મુખમાંથી ઉચ્ચાર્યો.

જમવા બેઠેલ મહેમાન એ મીઠાઈ ખાશે ખરા ?

હરગિજ નહીં.

મુનિ !

તારા સહવર્તિ મુનિએ એક જ દિવસમાં

૧૦૦ ગાથા કંઠસ્થ કરી.

એના પ્રત્યેની ઈર્ઘાથી પ્રેરાઈને તેં એક જ દિવસમાં

૨૦૦ ગાથા કંઠસ્થ કરી દીધી.

તારા સ્વાધ્યાયક્ષેત્રના એ પુરુષાર્થને

‘સુકૃત’નું લેબલ લાગી શકશે ખરું ?

હરગિજ નહીં.

ભૂલ તારી નાની હતી પણ ગુરુએ ઠપકી તને ખૂબ મોટો આયો.

તને રીસ ચરી ગઈ.

રીસમાં ને રીસમાં તેં અફમનું પચ્યક્ખખાણ કરી લીધું.

તપક્ષેત્રના તારા આ પરાક્રમ પર અનંતજ્ઞાનીઓ

‘સુકૃત’ની મહોરછાપ લગાવશે ખરા ?

હરગિજ નહીં.

કારણ ? સુકૃત તારું સોનાની લગડી જેવું

પણ એના પ્રાહુર્ભાવના મૂળમાં

ન સુકૃતનો કોઈ પક્ષપાત કે ન સુકૃત પ્રત્યે કોઈ સદ્ભાવ,

બલ્કે, કોકના પ્રત્યેનો ઈર્ઘાભાવ કે

કોકના પ્રત્યેનો દ્વેષભાવ.

દૂધ સારું પણ સર્પના પેટમાં જઈને એ જેમ

ઝેરમાં રૂપાંતરિત થઈ જાય છે તેમ દૂધ જેવું સુંદર મજેનું સુકૃત પણ

એના ગર્ભમાં જો ઈર્ઘા-કલેશાદિ મલિન ભાવો

હોય છે તો દુષ્કૃતમાં રૂપાંતરિત થઈ જાય છે.

આનો તાત્પર્યર્થ ?

આ જ કે દૂધને સ્વીકારનારનું પેટ જો

‘પાત્ર’ હોવું જરૂરી છે તો સુકૃતને આચરનારનું

અંતઃકરણ સ્વચ્છ અને પવિત્ર હોવું જરૂરી છે.

કરુણાતાની પરાકાદ્યા તો આ છે કે

તેં ભૂતકાળના અનંતભોમાં એકાદ-બે સુકૃતો જ નથી સેવ્યા,

સુકૃતોની જેને ખાણ કહી શકાય એવાં

સંયમજીવનો અંગીકાર કર્યા છે અને

એ સંયમજીવનો પણ એકાદ-બે નહીં પણ

અનંત અનંત અંગીકાર કર્યા છે અને છતાં આજે ય

તારી સંસારમાં રખડપદી ચાલુ છે.

જે સંયમજીવન વધુમાં વધુ સાત-આઠ ભવમાં

આસાને મોક્ષમાં મોકલી દેવાની ક્ષમતા ધરાવી રહ્યું છે

એ સંયમજીવન તેં અનંતવાર અંગીકાર કરવા છતાં

તારો મોક્ષ નથી થયો એ વાસ્તવિકતા એટલું જ સૂચયે છે કે

તું ક્યાંક થાપ ખાઈ ગયો છે.

સંયમજીવનને સુકૃતનું લેબલ લાગી શકે

એવી પાત્રતા વિકસાવવામાં તું ક્યાંક ઊણો ઊતર્યો છે.

એટલું જ કહીએ છીએ અમે તને.

તું ગાયનું પ્રતિનિધિત્વ ધરાવતો થઈ જા.

ગાય ધાસનું રૂપાંતરણ પણ દૂધમાં કરી નાખે છે.

તું બાધ્યથી દેખાતા દુષ્કૃતનું પણ સુકૃતમાં રૂપાંતરણ કરી નાખ.

## આઉસસ્સ ન વીસાસો કજ્જમ્મિ બહૂળિ અંતરાયાળિ તમ્હા હવઙ્ગ સાહૂણ વદ્વમાણજોગેણ વવહારો ।

— મહાનિશીથ

યુદ્ધ ચાલુ છે અને તોપના નાળચામાં ચકલીએ માળો બનાવીને  
એમાં ઈડાં મૂક્યાં છે.  
ઈડાંનું ભાવિ શું ?  
આગ લાગી ચૂકી છે.  
મકાન લાકડાનું છે.  
અંદર પલંગ પર સૂતેલા દાઢાને લકવાનું દઈ છે.  
એ દાઢાનું ભાવિ શું ?  
હાથમાં કરવત છે.  
જે ડાળ પર માણસ બેઠો છે એ ડાળને એ માણસ  
કરવત વડે કાપી રહ્યો છે.  
એ માણસનું ભાવિ શું ?  
મુનિ ! જે આયુષ્યકર્મના આધારે અત્યારે તું જીવી રહ્યો છે  
એ આયુષ્યકર્મનું પોત પાણીના પરપોટા જેવું છે,  
વીજળીના જબકારા જેવું છે, મેઘ ધનુષ્યના રંગો જેવું છે.  
ક્યાં સુધી તારું આયુષ્ય ટકી રહેશે એની કોઈ જ  
નિશ્ચિત આગાહી કરી શકાય તેમ નથી.  
એક બાજુ આયુષ્યકર્મ આવું ક્ષણબંગુર છે  
તો બીજી બાજુ તું કોઈ પણ કાર્ય કરવા માગતો  
હોય તો એમાં અંતરાય આવવાની સંભાવના ધણી છે.  
શરીર અચાનક રોગગ્રસ્ત બની જાય,  
સંયોગો અચાનક વિપરીત ઊભા થઈ જાય,  
વિકિતનો અભિપ્રાય અચાનક બદલાઈ જાય,

અરે, તારું ખુદનું મન જ અચાનક બદલાઈ જાય.  
આ સ્થિતિમાં તું કોઈ પણ ચોક્કસ કાર્ય માટે  
કોઈને આવતી કાલનું કે ભાવિના સમયનું વચ્ચન આપી બેસે  
એ કેમ ચાલે ?  
પળ પછીની જ્યાં ખબર નથી ત્યાં કલાકો, દિવસો  
કે મહિનાઓ પછીનાં આયોજનો તું અત્યારથી જ નક્કી કરી દે એ શેં ચાલે ?  
અરે, ગોચરી વહોરવા તેં કદમ ઉપાડી લીધા છે.  
જેના ધરે તું ગોચરી જવા ઈચ્છી રહ્યો છે એ  
ધરની વિકિત ખુદ તને પોતાને ત્યાં ગોચરીનો લાભ  
આપવાની વિનંતિ કરી રહી છે  
અને છતાં તારે એને એમ નથી કહેવાનું કે  
'ચાલો, હું તમારા જ ધરે આવી રહ્યો છું'  
તારે એને માત્ર 'વર્તમાન જોગ' એટલું જ કહેવાનું છે.  
કારણ ? બને કે કોક કારણસર ગુરુદેવ તને પાછો બોલાવી લે.  
બને કે જેના ધરે તું ગોચરી જઈ રહ્યો છે એના  
ધરે આક્સિમિક કોક માઠો પ્રસંગ બની જાય.  
બને કે તારા ખુદનું જીવન જોખમાઈ જાય એવા રોગનો તું પોતે શિકાર બની જાય.  
ટૂકમાં, આ સિવાય બીજું પણ કંઈક બની શકે  
કે જેના કારણે તું એના ધર સુધી ગોચરી જ ન પહોંચી શકે.  
આ શક્યતાઓ વચ્ચે તારે 'વર્તમાન જોગ'  
સિવાય બીજું કાંઈ જ બોલવાનું રહેતું નથી.  
પણ સબૂર !  
ગોચરી-પાણી પૂરતી જ આ વાસ્તવિકતા છે એમ તું સમજ ન બેસતો.  
તપ કે સ્વાધ્યાય, વૈયાવચ્ચ કે ભક્તિ,  
જીપ કે ધ્યાન, જે કોઈ પણ શુભ યોગનું સેવન તું કરવા  
માગતો હોય એ તમામ માટે પણ આ જ વાસ્તવિકતા છે  
આયુષ્યનો કોઈ ભરોસો નથી અને કાર્યસેવનમાં અંતરાયો ધણાં છે.  
જે પણ શુભ-સુંદર-શ્રેયોકારી તું કરવા માગતો  
હોય એને તું વર્તમાનમાં જ કરી લેજે.  
આવતી કાલનો તો નહીં પણ આવતી પળનો ય કોઈ જ ભરોસો નથી.

## ઉસ્સગે અવવાયં કરેમાણો અવવાદે ચ ઉસ્સગં કરેમાણો અરહંતાણ આસાયણાએ વહૃઝ ।

– સંબોધ સિતારી

પરીક્ષામાં પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ  
થઈ જવાની પ્રયંડ ક્ષમતા ધરાવતો યુવક  
પરીક્ષામાં માત્ર ‘પાસ’ થઈ જવાની  
ગણતરી રાખીને ભાષવાની બાબતમાં બેદરકારી  
દાખવવા લાગે તો એના ઉજ્જવળ ભાવિ પર  
પૂર્ણવિરામ મુકાઈ જ જાય ને ?  
એક કલાકના માત્ર પાંચ કિલોમીટર જ ચાલી  
શકવાની ક્ષમતા ધરાવતો યુવક,  
કલાકના વીસ કિલોમીટર કાપી નાખવાની  
શરત લગાવી બેસે અને એના આધારે એ  
દોડવા લાગે તો શરીર અને સંપત્તિ,  
બને ક્ષેત્રે એ નુકસાનીનો જ શિકાર બને ને ?  
મુનિ ! તારી પાસે જે જીવન છે એ પાટા પર દોડતી ગાડી જેવું નથી પરંતુ  
સાગર તરફ આગળ વધી રહેલી નદી જેવું છે.  
ગાડીને તો કાયમ પાટા પર જ દોડવાનું હોય છે  
એટલે એને રસ્તા પર કોઈ સંઘર્ષ કરવાનો આવતો નથી  
પરંતુ નદીની તો આખી વાત જ ન્યારી હોય છે.  
ક્યારેક એને જંગલમાંથી વહેવાનું હોય છે  
તો ક્યારેક એને રણપ્રદેશમાંથી આગળ ધપવાનું હોય છે.  
ક્યારેક ખડકાળ રસ્તેથી તો  
ક્યારેક સૂકા પ્રદેશ પરથી એને આગળ ધપવાનું હોય છે.  
આ સ્થિતિમાં પોતાની વહેવાની ગતિમાં એને

અવારનવાર ફેરફારો કરતા જ રહેવું પડે છે.  
ક્યારેક શાંતિથી તો ક્યારેક આવેગપૂર્વક એને વહેવું પડે છે.  
ક્યારેક અવાજ કરતા તો ક્યારે બિલકુલ ધીમી ગતિએ એને વહેતા રહેવું પડે છે.  
બસ, મુક્તિ સુધી સહીસલામત પહોંચી જવા  
તારે પણ આ નદી જેવા બનીને જ તારા સંયમજીવનની  
યાત્રાને આગળ ધપવવાની છે.  
ઉત્સર્ગસેવનની જો તારામાં પૂરેપૂરી ક્ષમતા છે જ  
તો ત્યાં તારે અપવાદનું સેવન નથી જ કરવાનું  
અને જ્યાં અપવાદનું સેવન કરવું જરૂરી જ છે ત્યાં ઉત્સર્ગસેવન માટે આગ્રહ રાખીને  
તારા સંયમજીવનને મુશ્કેલીમાં મૂકી દેવાની ભૂલ તારે નથી જ કરવાની.  
શરીર તાંતું સશક્ત છે.  
કુદા પરિસહને વેઠી લેવાનું તારી પાસે પ્રબળ સામર્થ્ય છે.  
તપશ્ચયાનો તને વરસોનો અભ્યાસ છે.  
અન્ય સંયોગો પણ બધી જ રીતે અનુકૂળ છે.  
આ સ્થિતિમાં તારે દોષિત ગોચરીનું સેવન નથી જ કરવાનું પણ  
તારા શરીરમાં તાવ છે.  
બેસવાના પણ તને હોશ નથી.  
તપશ્ચયાનો તને અભ્યાસ નથી.  
ભૂખ વેઠી શકે એવું તારી પાસે શરીર સામર્થ્ય નથી.  
નિર્દોષ અનુપાન મળી શકે એવી કોઈ જ શક્યતા નથી  
આ સ્થિતિમાં તારે લાંબા ગાળાના લાભને આંખ સામે રાખીને  
અલ્ય સમયનું નુકસાન કહી શકાય એવું એકદમ  
નિર્દોષ નહીં તો છેવટે અલ્ય દોષવાળું  
અનુપાન પણ વાપરી લેવું હિતાવહ છે.  
અલબત્ત, ઉત્સર્ગસેવનની તાકાત અને શક્યતા તથા  
અપવાદ સેવનની જરૂરિયાત અને સંયોગાધીનતા  
આ બધું તારે તારા અંતઃકરણની સાક્ષીએ જ નક્કી કરવાનું છે.  
તું જો ભવભીરુ છે અને પાપભીરુ પણ છે તો  
અમને પૂર્ણ વિશાસ છે કે ઉત્સર્ગ-અપવાદ સેવનમાં  
વિવેકને હાજર રાખવામાં તું થાપ નહીં જ ખાય.

## દેવ હિ દુર્મતિં દત્તે ચપેટાં ન કપાલયો: ।

– જૈન કથાર્ષવ

એમ કહેવાય છે કે કોઈ માણસને જીવતા જ ખતમ કરી દેવો હોય તો  
અને દારુના, જુગારના,  
વેશ્યાગમનના,  
દાણાચોરીના કે ઝુંસના રવાડે ચડાવી દેવો.  
એ સામે ચડીને પોતને આમંત્રણ આપતો રહીને  
વહેલી તકે સ્મરણનો મહેમાન બની જશે.  
મુનિ !  
ખૂબ ગંભીરતાથી તું યાદ રાખજે આ વાત કે  
કુદરત જ્યારે કોકને દુઃખી દુઃખી કરી દેવા માગે છે,  
અના ભાવિને અંધકારમય બનાવી દેવા માગે છે,  
જગતના ચોગાન વચ્ચે એની રેવડી દાણાદાણ કરી નાખવા  
માગે છે ત્યારે જરૂરી નથી કે  
અના શરીરને એ રોગગ્રસ્ત બનાવી દે કે  
એની પ્રતિષ્ઠાને એ ધૂળધાણી કરી નાખે.  
એની આબરુને એ બંદો લગાવી દે કે  
અના ગાલ પર એ બે-ચાર તમાચા લગાવી દે.  
ના. કુદરત એને દુર્ભુદ્ધિનો શિકાર બનાવી દે છે.  
એની મતિને દુષ્ટ બનાવી દે છે.  
બસ, દુર્મતિનો શિકાર બની જતો એ પછી એવાં  
એવાં અકાર્યો કરવા લાગે છે કે જેના ફળસ્વરૂપે  
એ પોતાનો આલોક અને પરલોક બંને બરબાદ કરી બેસે છે.  
તપાસજે તારા ખુદના જીવનને.

પુષ્ટ કારણ વિના જો તું દોષિત ગોચરી વાપરી રહ્યો છે,  
માત્ર સુખશીલતાને પોષવા જો તું દિવસે નિદ્રા લઈ રહ્યો છે,  
શરીર સશક્ત હોવા છતાં  
જો તું વિગર્ધપ્રચુર દ્રવ્યો પેટમાં પદ્ધરાવી રહ્યો છે.  
સુંદર કષ્યોપશમ અને સાનુકૂળ સંયોગો હોવા છતાં  
જો તું સ્વાધ્યાયક્ષેત્રે ભારે પ્રમાદ સેવી રહ્યો છે.  
પાંચે ય ઈન્દ્રિયો સંપૂર્ણ સ્વર્થ હોવા છતાં  
અને પ્રભુવચનોની સમ્યક્ સમજ હોવા છતાં  
જો તું જાણી જોઈને સમિતિ-ગુપ્તિના પાલનમાં  
બેદરકારી દાખવી રહ્યો છે,  
વિરાધનાઓની વણજાર પછી ય તારા મનમાં જો  
'એમાં શું થઈ ગયું ?' એવા ભાવો ઉઠી રહ્યા છે,  
સુકૃતસેવનના સમાચારો કાને આવ્યા પછી ય  
તારા હેયામાં જો હર્ષનાં કોઈ સંવેદનો ઉઠતા જ નથી,  
ઉપકારીઓના દર્શન પછી ય  
તારા મનમાં એમના પ્રત્યે જો કોઈ અહોભાવ જાગતો જ નથી.  
પુષ્યના ઉદ્યકાળમાં સદ્ગુણોનો ઉઘાડ કરી લેવાનો પુરુષાર્થ  
દાખવી લેવાનો જો તારા મનમાં કોઈ ઉમજકો જાગતો જ નથી  
તો અમે તને કહીએ છીએ કે તારે અતંત  
સાવધ બનીને તારી મતિને તપાસી લેવાની જરૂર છે.  
બની શકે કે કુદરતે પોતાના સર્કણમાં તને લઈ લીધો હોય અને  
તને દુર્મતિનો શિકાર બનાવી દીધો હોય.  
અહોભાવશૂન્ય ધર્મરાધના,  
વેદનાશૂન્ય પાપસેવન,  
સંવેદનહીન ઉપકારીદર્શન, ડંખવિહીન પ્રમાદસેવન  
આ બધાં દુર્મતિનાં અથવા તો દુર્ભુદ્ધિનાં જ સંતાનો છે.  
સમરીના મુખમાં સપડાઈ ચૂકેલા  
સર્પને જીવનદાન હજુ મળી શકે છે પણ  
દુર્મતિના શિકાર બનેલાને સદ્ગુણ કે સદ્ગતિ પ્રાપ્તિ સર્વથા અસંભવિત છે.  
સાવધાન !

## સર્વસ્યાપિ પ્રવ્રજ્યાયા: ભવદ્વયકૃતકર્મપ્રાયશ્રિત્તરૂપાયા: તત્ત્ર તત્ત્ર વ્યવસ્થિતત્વાદ ।

– પ્રતિમાશતક

દવાનું સેવન એટલું જ સૂચવે છે કે  
શરીર રોગગ્રસ્ત છે.

સાબૂનો ઉપયોગ એટલું જ સૂચવે છે કે  
કફડાં મેલાં છે.

ભોજનનું સેવન એટલું જ સૂચવે છે કે  
શરીર કુધાગ્રસ્ત છે.

સંપત્તિનો સંગ્રહ એટલું જ સૂચવે છે કે  
મન ચિંતાગ્રસ્ત છે.

શસ્ત્રોનો ઉપયોગ એટલું જ સૂચવે છે કે  
મન ભયભીત છે.

મુનિ!

તારા હાથમાં સંયમજીવન છે ને ?

તપના માર્ગ તું દિલ દર્દને દોડી રહ્યો છે ને ?

સ્વાધ્યાયક્ષેત્રે તું લોહી-પાણી એક કરી રહ્યો છે ને ?

વૈયાવચ્ચની બાબતમાં

તું શરીરની સુખશીલતા સામે બળવો પોકારી રહ્યો છે ને ?

પરિસહ-ઉપસર્ગો સહી લેવાની બાબતમાં

તું મન સામે યુદ્ધે ચડ્યો છે ને ?

ગુર્વાણને શિરસાવંદ્ય કરી લેવાની બાબતમાં

સ્વચ્છંદમતિની તું હોળી સળગાવી રહ્યો છે ને ?

ખૂબ ખૂબ ધન્યવાદ અમે તને આપીએ છીએ

તારા આ ભવ્યતમ પરાક્રમ બદલ પણ,

યાદ રાખજે કે તારી આ તમામ આરાધના કે સાધના એ  
ગતજન્મોમાં અને આ જન્મમાં જે પણ પાપો તે  
કર્યા છે એના પ્રાયશ્રિતરૂપ છે.

સ્વાધ્યાય એ પરભાવરમણતાના પાપનું પ્રાયશ્રિત છે તો  
તપશ્ચયા એ આદારસંજ્ઞાની કરેલ પુષ્ટિના પાપનું પ્રાયશ્રિત છે.  
વૈયાવચ્ચ એ સુખશીલવૃત્તિ પોષણના પાપનું પ્રાયશ્રિત છે તો  
પરિસહસહન એ શરીરરાગના પાપનું પ્રાયશ્રિત છે  
ગુર્વાણાધીનતા એ સ્વચ્છંદમતિના પાપનું પ્રાયશ્રિત છે તો  
પ્રભુ આજ્ઞાનો સ્વીકાર

એ પુષ્ટ કરેલ આપમતિના પાપનું પ્રાયશ્રિત છે.

સ્પષ્ટ શબ્દોમાં તને કહીએ તો  
તાંતું સંપૂર્ણ ચારિત્રજીવન એ બીજું કાંઈ જ નથી.  
માત્ર તે સેવેલાં પાપોનું શુદ્ધીકરણ કરવા માટે  
તે સ્વીકારેલ પ્રાયશ્રિતરૂપ છે.

આ વાત અમે તને એટલા માટે યાદ કરાવવા માગીએ છીએ કે  
તારા હાથમાં રહેલ સંયમજીવન અને  
એ જીવનમાં તું જે કાંઈ આરાધના કરી રહ્યો છે  
એ બદલ તારા મનમાં ક્યારેય અહં પેદા જ ન થાય.  
જવાબ આપ તું.

પુષ્કળ દવાઓનું સેવન કરનારો દર્દી  
ક્યારેય એ દવાઓના સેવન બદલ  
પોતાના પરિચિતો વચ્ચે અહં કરે છે ખરો ?  
જો ના,

તો તે પોતે જ રાચી માચીને કરેલાં પાપોના  
પ્રાયશ્રિત સ્વરૂપ આ જીવનમાં તું જે પણ  
આરાધનાઓ કરી રહ્યો છે એ બદલ  
તારે ય અહંકાર કરવાનો કયાં રહે છે ?  
યાદ રાખજે, વર્તમાનનું પ્રાયશ્રિત વહન  
એટલું જ સૂચવી રહ્યું છે કે  
ભૂતકાળ પાપસભર હતો !

## આત્મન: પ્રતિપ્રદેશે સલગ્નાન् માયાજન્યકુસંસ્કારાન् દૂરીકરોતીતિ વિનય: ।

— પ્રશ્નવ્યાકરણ

દર્પણ પર લાગેલ ધૂળ કપડાંથી દૂર કરી શકાય છે.  
ઓરડામાં પહેલ ધૂળ જાહુથી દૂર કરી શકાય છે.  
કપડાં પર ચોંટી ગયેલ ધૂળ  
સાબુથી દૂર કરી શકાય છે.  
પણ મુનિ !  
આત્માના પ્રદેશ પ્રદેશ પર  
લાગેલ કર્માની ધૂળને જો તું દૂર કરવા માગે છે  
તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે, તું વિનયના શરણો ચાલ્યો જા.  
તું વિનયવાન બની જા.  
આ વિનય બહુમાનભાવરુપ પણ છે,  
મધુર વચનરુપ પણ છે તો ભક્તિરુપ પણ છે.  
જે ઉપકારી છે એના પ્રત્યે ય વિનય અને  
જે ઉપકરણ છે એના પ્રત્યે ય વિનય  
જવાબ આપ તું.  
આ તમામ પ્રત્યેના બહુમાનભાવથી તારું હદ્ય વ્યાપ્ત ખરું ?  
આ તમામ સાથેના વચનવ્યવહારમાં તારું  
માધ્યર્થ છલકતું જ હોય એવું અનુભવાય ખરું ?  
એ તમામની ભક્તિ કરવાની  
મળતી તકને તું જડપતો જ રહે એવું ખરું ?  
અલબંત, ‘વિનય’ નું ક્ષેત્ર માત્ર આટલું જ નથી.  
‘ભગતિ બાધ પ્રતિપત્તિધીજ,  
હદ્યપ્રેમ બહુમાન, ગુણસુત્તિ અવગુણ ઢાંકવાળ આશાતનની હાણ’

આ તમામનો સમાવેશ વિનયમાં થાય છે.  
ઉપકારી અને શ્રેયસ્કારી પરિબળો-સાધનો અને વ્યક્તિઓ વગેરે તમામની  
બાધથી સત્કાર-સન્માન-પરિચયરૂપ ભક્તિ,  
હદ્યમાં પ્રેમસ્વરૂપ બહુમાન, ગુણોની સ્તવના,  
અવગુણોનું આચ્છાદન અને આશાતનનો ત્યાગ,  
આ બધાયનો સમાવેશ પણ વિનયમાં જ થાય છે.  
પોતાનો ચહેરો વ્યવસ્થિત જોવા માગતો માણસ  
દર્પણ પરની ધૂળ જો હટાવીને જ રહે છે,  
પોતાના રહેવાના ઓરડાને સ્વચ્છ રાખવા ઈચ્છાઓ  
માણસ ઓરડામાંની ધૂળ જો દૂર કરીને જ રહે છે,  
સ્વચ્છ વસ્ત્રોના પરિધાનને જંખતો માણસ જો  
વસ્તો પર ચોંટી ગયેલ ધૂળ દૂર કરીને રહે છે  
તો અનંત અનંત કાળથી  
આત્માના પ્રત્યેક પ્રદેશ પર લાગતી રહેલી  
કર્માની અને કુસંસ્કારોની ધૂળને દૂર કરવા  
તું વિનયના શરણો જતો જ રહેતો હોય તો એમાં આશર્ય શું છે ?  
યાદ રાખજે તું,  
ભક્તિ સરળ છે,  
બહુમાન મુશ્કેલ છે.  
ગુણસુત્તિ સરળ છે,  
અવગુણ આચ્છાદન મુશ્કેલ છે.  
ઉપાસના સરળ છે,  
આશાતનનો ત્યાગ મુશ્કેલ છે.  
કારણ ?  
ભક્તિ, ગુણ સુત્તિ, ઉપાસનામાં હજુ દંભ હાજર રહી શકે છે પણ  
બહુમાનભાવ, અવગુણાચ્છાદન અને આશાતના ત્યાગ  
તો દંભત્યાગ વિના શક્ય જ નથી.  
અપેક્ષા રાખીએ છીએ અમે તારી પાસે કે  
તું આ તમામ પ્રકારના વિનયને આત્મસાત્ત કરવા  
દ્વારા તારા આત્માને કર્મમુક્ત બનાવવામાં સફળતા હાંસલ કરીને જ રહે.

## જાહેરાના ચક્રખૂઆલોએ ય પણામં ન કરેઝ પાયચ્છિત્તં વિસંભોગો વા ।

—પંચકલ્યભાષ્યયુદ્ધિ

તૃષ્ણાતુર માણસની આંખમાં, નિર્મળ જળ દેખાયા પછી ય ચમક નહીં આવે ?  
અસંભવ !

દરિદ્રાવસ્થાનાં જાલિમ દુઃખોને ભૂતકાળમાં  
અનુભવી ચૂકેલા અને કોક શ્રીમંતના સહારે  
આજે કરોડપતિ બની ચૂકેલા એ શ્રીમંતના હૈયામાં  
પોતાના એક વખતના ઉપકારી શ્રીમંતના દર્શને  
અહોભાવનાં પૂર નહીં ઉમટે ?

અસંભવ !

શિલ્પીની કરામતથી આજે પ્રતિમા બનીને  
લાખોનાં વંદન-નમસ્કારને જીલી રહેલ એક વખતનો  
પથર શિલ્પીના દર્શને  
પાગલ પાગલ બની ગયા વિના રહેશે ?

અસંભવ !

મુનિ !  
આજે તારા હાથમાં નિષ્યાપ સંયમજીવન છે,  
કર્મનાશક અને પાપઘાતક તપશ્ચર્યા અને સ્વાધ્યાયાદિ યોગોથી  
તારું જીવન આજે સુશોભિત છે.  
શુભ યોગ અને શુભ ઉપયોગ આજે તારા જીવનમાં અને મનમાં  
સ્થાન જમાવીને બેઠા છે.  
શુભ અધ્યવસાયોની છોળો તારા અંતરમાં  
આજે નિરંતર ઉછળી રહી છે.  
પ્રતિકૂળ પરિસ્થિતિમાં ય મનની સમાધિ તું અકબંધ રાખી શકે છે.

થઈ જતાં પાપો બદલ આજે તું રડી શકે છે.  
સદ્ગતિગમનની સંભાવનાને તું આજે લગભગ નિશ્ચિત કરી બેઠો છે.  
કર્મબંધ-કર્મક્ષયનાં  
કારણોની વ્યવસ્થિત જાણકારીનો તું આજે સ્વામી બની શક્યો છે.  
તારા જીવનની આટલી બધી  
'જ્મા' બાજુઓનો યશ કોઈ એક જ પરિબળને ફાળે જતો હોય તો  
એ પરિબળનું નામ છે, તારા અનંતોપકારી 'ગુરુદેવ'.  
એમણે જો તને સંયમજીવન માટે યોગ્ય ન માન્યો હોત,  
સંયમજીવન આયા પછી ય એમણે જો  
તને વાત્સલ્ય-વાચનાદિ આપવા દ્વારા  
સંયમજીવનમાં સ્થિર ન કર્યો હોત, તારી સ્ખલનાઓને  
ભૂલતા રહીને ય એમણે તને  
આગળ વધારતા રહેવાના પ્રયાસો ન કર્યો હોત,  
તારા હિતને જ આંખ સામે રાખીને  
એમણે ક્યારેક તારા સુખ પ્રત્યે ય જો લાલ આંખ ન કરી હોત  
તો આજે તારી પાસે જે ઉત્તમ જીવન છે,  
ઉત્તમ અધ્યવસાયો છે,  
ઉત્તમ આલંબનો છે,  
ઉત્તમ અનુષ્ઠાનો છે અને  
ઉત્તમ યોગો છે, તું શું એમ માને છે ખરો કે  
એમાંનું કાંઈ પણ તારી પાસે હોત ખરું ?  
જો ના, તો જવાબ આપ.  
એ ઉપકારી ગુરુદેવના દર્શન માત્રથી  
તારું મસ્તક અહોભાવથી જૂકી જાય છે ખરું ?  
એમના સમરણ માત્રથી તારા હૈયામાં સ્પંદનો ઊંઠવા લાગે છે ખરાં ?  
જો સંતોષજનક પ્રત્યુત્તર  
આ પ્રશ્નોનો તારા અંતઃકરણમાંથી ન ઊંઠતો હોય  
તો અમે તને કહીએ છીએ કે અધ્યાત્મજગતનો  
તું ગુનેગાર છે. કર્મસત્તા તારા લમણો સજા જીંકીને  
જ રહેવાની છે. સાવધાન !

## ભગવચ્ચિત્તાવસ્થાન કિલષ્કર્મણો વિરોધાત् ।

— ધર્મબિંદુ

પ્રકાશ અને અંધકાર,  
બંને એક જ જગાએ અને એક જ સમયે ?  
અસંભવ !  
શ્રીમંતાઈ અને દરિદ્રતા,  
બંને એક જ વ્યક્તિમાં અને એક જ સમયે ?  
અસંભવ !  
પર્યાપ્ત ભોજન પેટમાં અને એ પછી ય અતૃપ્તિ ?  
અસંભવ !  
પર્યાપ્ત અતાર હાથમાં અને પછી ય નાક સંવેદનહીન ?  
અસંભવ !  
મુનિ !  
આ બધું ય એક વાર કદાચ સંભવિત કે શક્ય બની જતું હશે,  
એક જ ભ્યાનમાં બે તલવાર રહી જતી હશે,  
સતી અને વેશયા વચ્ચે કોક કારણ વિશેષે મૈત્રી જામી જતી હશે,  
સિંહ અને બકરા વચ્ચે મેળા પડી જતો હશે  
પરંતુ જે ચિત્તમાં પ્રભુ બિરાજમાન હોય છે,  
એ જ ચિત્તમાં  
કિલષ્ટ કર્મોની હાજરી પણ હોય એ તો સર્વથા અસંભવિત છે.  
આનો તાત્પર્યથી ?  
આ જ કે પ્રભુની હાજરીવાળું ચિત્ત  
નથી તો કિલષ્ટ કર્મો અર્થાત્ ચીકણાં પાપો કરી શકતું કે નથી તો  
કિલષ્ટ કર્મોનો બંધ કરી શકતું.

અમે તને એટલું જ કહીએ છીએ કે  
તારા મનને અને જીવનને તું આ સમ્યક્  
પરિણામના આધારે તપાસી જોજે.  
જો તારા મનમાં એવા અશુભ અધ્યવસાયો પેદા થતા જ હોય કે જે  
ચીકણાં કર્મબંધનું કારણ બની રહેતા હોય તો  
નિશ્ચિત સમજ રાખજે કે  
તારા ચિત્તમાં પ્રભુનું અવસ્થાન નથી.  
પ્રભુનું અવસ્થાન એટલે ?  
પ્રભુ વચ્ચનોનું અવસ્થાન !  
પ્રભુના સમ્યક્દર્શનનું અવસ્થાન !  
એની ઉપરિથિત છતાં અશુભ કર્મબંધ ચાલુ રહે એ હજ બને પણ  
જે કર્મબંધને ‘કિલષ્ટ’ કહી શકાય  
એવો અશુભ કર્મબંધ તો સ્થગિત થઈને જ રહે.  
સમાપ્ત થઈને જ રહે.  
ગંભીરતાથી આ વાસ્તવિકતાને તું  
વિચારીશ તો તને ખ્યાલ આવી જશે કે ભૂતકાળના ભવોમાં  
તેં કરેલાં કિલષ્ટ કર્મો અને  
તેં બાંધેલાં કિલષ્ટ કર્મો  
એ પ્રભુની તારા ચિત્તમાં ગેરહાજરી હતી એને જ આભારી હતા.  
હવે આ ભવમાં તું એ બંને પ્રકારનાં  
ગલત પરિબળોથી તારા આભાને જો  
બચાવી લેવા માગે છે તો એનો શ્રેષ્ઠ અને  
ક્યારેય નિષ્ફળ ન જાય એવો એક માત્ર વિકલ્ય આ જ છે.  
‘ભગવદ્ધિત્તાવસ્થાન’  
શું કહીએ તને ?  
ભારે વજનદાર પણ લાકું  
એની નીચે પાણી આવી જવાથી હલકું ફૂલ બની જાય છે.  
ચીકણાં પણ કર્મો ચિત્તમાં પ્રભુની પ્રતિષ્ઠા થઈ જવા માત્રથી  
નષ્ટપ્રાયઃ થઈ જાય છે.  
લાવી દે ચિત્તમાં પ્રભુ, તારું પ્રભુ થવાનું નિશ્ચિત થઈને જ રહેશે.

## ક્રોધાદીનામનુદિનં ત્યાગો જિનવચનભાવનાશ્ચ ભાવેનોનોદરિકા ।

—પ્રવચનસારોદ્ધાર

ભૂખ કરતાં ભોજન ઓછું,  
શરીર તો એનાથી તંદુરસ્ત રહે જ છે  
પરંતુ ‘ઉણોદરી’નામના પ્રભુએ ફરમાવેલા બાધતપની પણ  
એનાથી આરાધના થાય છે.

પણ મુનિ !  
એક વાત અમે તારા ધ્યાન પર લાવવા માણીએ  
છીએ કે પેટમાં ભૂખ કરતાં ઓછું ભોજન પદ્ધરાવવા માત્રથી  
તારી મુક્તિ નજીક આવી જાય,  
તારી સદ્ગતિ નિશ્ચિત થઈ જાય,  
તારી સમાધિ અકબંધ થઈ જાય કે  
સમતા તને આત્મસાત્ર થવા લાગે  
એવું તું ભૂલે-ચૂકે માની ન બેસતો કારણ કે  
ભૂખ કરતાં ઓછું ભોજન એ ઉણોદરી જરૂર છે પણ એ  
ઉણોદરીનો સમાવેશ ‘દ્રવ્ય ઉણોદરી’માં થાય છે.

જેમ દ્રવ્ય ચારિત્ર કે  
દ્રવ્યક્રિયા મુક્તિનું કારણ બનીને જ રહે એવું નિશ્ચિત  
નથી તેમ દ્રવ્ય ઉણોદરી પણ મુક્તિનું કારણ  
બનીને જ રહે એવું નિશ્ચિત નથી.  
મુક્તિનું કારણ તો બની શકે છે ભાવ ચારિત્ર અને ભાવક્રિયા.  
બસ, એ જ ન્યાયે મુક્તિનું કારણ બનવાની  
ક્ષમતા તો ધરાવે છે ભાવ ઉણોદરી.  
અને સાંભળી લે તું ભાવ ઉણોદરી કોને કહેવાય છે તે ?

ક્રોધાદિ ક્ષાયોની માત્રામાં રોજ કડાકો બોલાવતા જવું એને કહેવાય છે  
ભાવ ઉણોદરી અને જિનવચનનોથી ચિત્તને ભાવિત કરતા રહેવું  
એને કહેવાય છે ભાવ ઉણોદરી.

જવાબ આપ.

તારા જીવનમાં આ બંને પરિબળોનો સતત અમલ ખરો ?  
જોઈ તો છે ને તેં ગેંસ પરથી તુઠારી લીધેલી પાણીની તપેલી ?  
એ તપેલીમાંનું પાણી જેમ સતત ઠંકું જ થતું  
જાય છે તેમ તારા મનમાં પણ

ક્ષાયોનું જે જોર છે એ રોજેરોજ ઘટતું જ જવું જોઈએ.

ક્ષાયોની માત્રા જે ગઈકાલે હતી એ આજે ન જોઈએ  
અને આજે જે માત્રા છે એ આવતી કાલે ન જોઈએ.

અને આ પરિણામ અનુભવવા માટે તારી  
પાસે હોવી જોઈએ જિનવચનનોની ભાવિતતા.

ક્ષાયોનું સ્વરૂપ,  
ક્ષાયોના હેતુ અને  
ક્ષાયોનું ફળ.

આ ત્રણેયની સમજણ મેળવવા માટે અને  
એ સમજણ પ્રત્યેની શ્રદ્ધાને સ્થિર કરી દેવા માટે  
જિનવચનનોની ભાવિતતા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.

યાદ રાખજે સમ્યક્ક લક્ષ્ય  
અને એ લક્ષ્યને આંબવા માટેની સાચી લગન,

આ બેના સ્વામી બની ગયા વિના  
નહીં તો તને ક્ષાયોની માત્રામાં કડાકો  
બોલાવવામાં સફળતા મળે કે  
નહીં તો ચિત્તને જિનવચનનોથી ભાવિત  
કરતા રહેવામાં તને સફળતા મળે.

દ્રવ્ય ચારિત્ર, દ્રવ્યક્રિયા અને  
દ્રવ્ય ઉણોદરી તો અનંતકાળમાં અનંતીવાર કર્યા.  
ચાલ્યો આવ હવે ભાવચારિત્ર, ભાવક્રિયા અને  
ભાવ ઉણોદરીના માર્ગો. મુક્તિ તારી હાથવેંતમાં છે.

## જો ણિગહસમત્થો ન ભવતિ તસ્સ કિં કહિએણ ?

– નિશીથ

હાથમાંથી છૂટી ગયેલા પથરને પાછો વાળવાના  
ગમે તેટલા પ્રયાસો કરો,  
લમણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ રીકાવાનું નથી.  
મુખમાંથી નીકળી ગયેલ શાઢોને પાછા વાળવાના  
લાખ પ્રયાસો કરો,  
હાથમાં નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ આવવાનું નથી.  
મુનિ !  
તું તારી જાતને સંયમી માને છે ને ?  
તારા આ જીવનમાં સ્વાધ્યાય અને વૈયાવચ્ચ,  
પ્રતિલેખન અને પ્રતિક્રમણ, લોચ અને વિહાર  
આ બધું ય નિયમિતતાના સ્તરે ગોઠવાઈ ગયું છે ને ?  
એક જવાબ આપ તું.  
તારું જીવન નિયમિત તો છે જ પરંતુ તારી ઈન્દ્રિયો અને તારું મન  
જિનવચનોથી નિયંત્રિત ખાડું ?  
આંખને એના વિષયો તરફ મોકલતા પહેલાં  
તું અને જિનવચનોથી નિયંત્રિત કરી શકે છે ખરો ?  
જભ પર દ્રવ્યો મૂકતા પહેલાં કે  
કાનમાં શાઢોને પ્રવેશ આપતાં પહેલાં,  
મુખમાંથી શાઢો ઉચ્ચારતા પહેલાં કે  
મનને વિચારોમાં વ્યસ્ત રાખતા પહેલાં  
એ તમામ પર જિનવચનોનું નિયંત્રણ મૂકી  
દેવાની તારામાં ક્ષમતા છે ખરી ?

જો ના, તો અમે તને કહીએ છીએ કે તને  
હવે હિતશિક્ષા આપવાનો કોઈ જ અર્થ રહેતો નથી.

જેની પાસે ઈન્દ્રિય-મનનો નિગ્રહ કરવાનું સામર્થ્ય જ નથી  
એને ઈન્દ્રિયો-મન પર નિગ્રહ કરવાનું  
સૂચવતાં પ્રભુવચનો કહેવાથી વળવાનું છે શું ?  
કાંઈ જ નહીં.

યાદ રાખજે, વિષયોને નિમંત્રણ આપવાના ભવો તો  
વિરાટ અનંતકાળમાં તે અનંતા પસાર કર્યા છે

અને એના ફળસ્વરૂપે તું અનંતીવાર  
દુર્ગતિઓની મુલાકાત લઈ આવ્યો છે.

માનવભવ અને એમાં ય સંયમનું જીવન,  
એની જ આ તાકાત છે કે જ્યાં  
વિષયોને નિયંત્રણમાં રાખી શકાય છે  
અને તારું એ પરમ સદ્ગ્રાહ્ય છે કે  
આજે તારા હાથમાં એ સંયમજીવન છે.

હાથમાં રિવોલ્વર હોવા છિતાં ગુડાનો પ્રતીકાર ન કરી શકનાર જો  
સંસારના ક્ષેત્રમાં કમજોર અને મૂર્ખ મનાય છે  
તો જીવન હાથમાં સંયમનું હોવા છિતાં  
જે સંયમી ઈન્દ્રિયોને નિયંત્રિત કરી શકતો નથી  
અને મનને નિયંત્રણમાં રાખી શકતો નથી  
એ સંયમી કમજોર અને મૂર્ખ તો મનાય જ છે

પરંતુ સાથોસાથ દુર્ભાગી પણ મનાય છે.  
દુર્ભાગી એટલા માટે કે અનંત સંસાર પર કાયમનું પૂર્ણવિરામ  
મૂકી દેવાનું સંયમજીવન હાથમાં હતું અને એ  
પછી ય એ અનંત સંસાર વધારી બેઠો !

એક બીજી મહત્વની વાત.

નિગ્રહ સામર્થ્ય જો તારી પાસે છે તો જ તું  
જેમ જિનવચન શ્રવજાને યોગ્ય છે તેમ જેની પાસે  
નિગ્રહ સામર્થ્ય હોય એને જ તારે જિનવચનોનું  
શ્રવજા કરાવતા રહેવાનું છે. ગમે તેને તું જિનવચનો સંભળાવવા ન લાગતો !

## અલ વિરોહેણ અપંડિએહિં ।

— બૃહત્કલ્ય

સૂર્યનો તાપ અસદ્ય લાગતો પણ હોય  
તો ય એની સામે ધૂળ ઉડાડવાની ચેષ્ટા  
કરવા જેવી નથી કારણ કે  
એમાં સરવાળે આપણે જ થાકવાનું હોય છે.  
ધૂંધળું વાતાવરણ મનને અકળાવતું હોય તો પણ  
એની સામે બળાપો કાઢતા રહેવાની જરૂર નથી  
કારણ કે એમાં આખરે તો આપણે જ નારીપાસ થવું પડતું હોય છે.  
મુનિ !  
અમારી એક સલાહ તું દિલની દીવાલ પર  
કોતરી રાખ કે જે વ્યક્તિ મૂર્ખ છે,  
અપ્રજ્ઞાપનીય છે, તુચ્છ છે અને  
કુશ છે એની ક્રોઈ પ્રવૃત્તિ તને માન્ય ન પણ  
હોય તો ય તું એની સામે દુશ્મનાવટ ન કરી બેસતો  
કે તું એના વિરોધમાં ન પડતો.  
આનો અર્થ એવો નથી કે તું એના સહકારમાં રહેજે.  
ના. તારે એની ઉપેક્ષા કરતા રહેવું.  
એની હાજરીની પરવા ન કરવી.  
એના વક્તવ્યની નાંદ ન લેવી.  
એની સાથે આમાંથી તને ટીક લાગે એ અભિગમો  
તારે અપનાવતા રહેવું પણ એની સાથે દુશ્મનાવટ ?  
એની સાથે વિરોધ ?  
હરગિજ નહીં.

કારણ ?

એનું પોત 'સર્પ' નું હોય છે.  
'વિષા' નું હોય છે.  
'કંટક' નું હોય છે.  
'ઉકરડા' નું હોય છે.  
'કચરા' નું હોય છે.  
આ તમામ સાથે ડાખ્યો માણસ શું કરે છે ?  
સર્પ નીકળે છે, માણસ ત્યાંથી દૂર થઈ જાય છે.  
વિષા દેખાય છે, માણસ ત્યાંથી દૂર હટી જાય છે.  
કંટકની ઉપસ્થિતિનો ઘ્યાલ આવે છે,  
માણસ ત્યાં સાવધ બની જાય છે.  
ઉકરડો આંખ સામે આવી જાય છે,  
માણસ નાક આડે કપું રાખીને આગળ નીકળી જાય છે.  
કચરાનો ઢેર દેખાય છે,  
માણસ એની ઉપેક્ષા કરીને આગળ ચાલતો થઈ જાય છે.  
બસ, આ જ કામ તારે કરવાનું છે,  
મૂર્ખાઓ પ્રત્યે, અપ્રજ્ઞાપનીય, કુદ્ર અને તુચ્છ પ્રત્યે !  
તું એમ ન માનતો કે  
એમની સામે પડવાથી કે એમની સાથે દુશ્મનાવટ કેળવવાથી  
તું એમને ડાખ્યા બનાવી શકીશ કે સુધારી શકીશ.  
ના. દરિયાની રેતીમાંથી ઘડો બનાવવામાં  
કુશળ કુંભારને ય જેમ સફળતા નથી મળતી  
તેમ મૂર્ખાઓને અને અપ્રજ્ઞાપનીયોને સમજાવવામાં કે સુધારવામાં  
ખુદ તીર્થકર પરમાત્માને ય સફળતા નથી મળતી.  
જો અનંતખલી પ્રભુ પણ  
મૂર્ખાઓ સામે કમજોર [?] પુરવાર થતા હોય તો  
અથ્વ બળવાળા, મંદ પુષ્યવાળા અને  
નબળા ક્ષયોપશમવાળા તારા જેવા માટે તો પૂછવાનું  
જ શું ? ના.  
મૂર્ખ સામે મૌન, એ જ શ્રેષ્ઠ જવાબ.

## नास्ति काचिदसौ क्रिया यया साधूनां ध्यानं न भवति ।

— आवश्यक निर्युक्ति

भोजन, पाणी,  
धधो, चालवानुं,  
बेसवानुं,  
सूवानुं अने आना जेवी ज अन्य क्रियाओ  
अमुक समये ज थती होय ए तो समजाय छे  
पण शासोऽथवासनी क्रिया ?

ए तो क्रिया समये चालु नथी होती ए प्रश्न छे.  
मुनि !

तारा हाथमां आજे जे संयमज्जवन छे  
ए ज्ञवननी शी ताकात छे ए तारा ध्यालमां छे खरुं ?  
भवे ने तुं रस्ता पर चाली रहो छे,  
भवे ने तुं कोकनी साथे वातो करी रहो छे,  
भवे ने तुं गोचरी वहोरवा जई रहो छे,  
भवे ने तुं उपकरण लेवा-मूकवानी क्रिया करी रहो छे,  
भवे ने तुं स्थंडिल-मानु जई रहो छे,  
भवे ने तुं प्रतिलेखन के प्रतिक्रिया करी रहो छे,  
भवे ने तुं स्वाध्याय के ध्यान करी रहो छे,  
तारी प्रत्येक क्रिया ध्यानरुप ज छे.

तारे ध्यान लगाववा स्वतंत्र समय काढवानी जड़े नथी.  
शुं कहीओ तने ?  
आर्तध्यान अने रौद्रध्यान,  
आ बे दुर्ध्यन छे के जे तारा माटे वजर्य छे.

धर्मध्यान अने शुक्लध्यान  
आ बे शुभध्यान छे के जे तारा माटे उपादेय छे.  
चालवानी तारी क्रिया जो ईर्यासमिति रुप छे तो  
बोलवानी तारी क्रिया भाषासमिति रुप छे.  
गोचरी वहोरतां दोषोनी गवेषणा करता  
रहेवानी तारी क्रिया जो ऐषांशासमिति रुप छे,  
तो वस्तु लेता-मूकता थती पुंजवाप्रमार्जवानी  
तारी क्रिया आदान-भंडमत्तनिक्षेपणासमिति रुप छे  
अने स्थंडिल-मानु जवा-परठववानी तारी क्रिया  
पारिष्ठापनिका समिति रुप छे.

आ दरेक क्रियामां रहेती अप्रमताता,  
ज्ञवरक्षानो परिष्ठाम, आशासापेक्षता,  
अध्यवसाय विशुद्धि, निर्भण विचारधारा,  
स्वरूपनी जगृति

आ बधायनुं पोत कां तो धर्मध्यानरुप छे  
अने कां तो शुक्लध्यानरुप छे.

जो धर्मध्यान अने शुक्लध्यान ए ज शुभ ध्यानरुप छे  
अने तारा ज्ञवननी प्रत्येक क्रियामां जो

आ बे शुभध्यानमांथी ज अन्यतर एक ध्यान छे  
तो पछी जवाब आप तुं,  
तारे हवे बीजुं कल्याण धरवानुं बाकी रहे छे ?

शुभध्यान माटे तारे बीजा कोनी पासे जवानुं बाकी रहे छे ?  
बीज कई क्रिया तारे शुभध्यान माटे करवानी रहे छे ?

आंभ सामे राखजे ढंडण अङगारने.  
मोटकने परठवता परठवता ए मुनिवर केवणज्ञान पामी गया छे  
जो आवी तुस्य अने मामूली देखाती

‘परठववानी’ क्रिया पण केवणज्ञाननुं कारण  
बनी शकती होय तो पछी तारे तो  
पागल बनीने नाचता रहेवानी जड़े छे  
कारण के तारी पासे जे क्रियाओ छे ए तो एक एकथी चिडियाती छे !

## સર્વો અ તો સંયમજીવન જ

હિમાલયને કદાચ  
 ‘સર્વોચ્ચ’નું વિશેષજ્ઞ આપી શકાય છે.  
 કોહિનૂર હીરાને કદાચ  
 ‘સર્વોત્કૃષ્ણ’નું વિશેષજ્ઞ આપી શકાય છે  
 પરંતુ  
 ‘સર્વોત્તમ’નું વિશેષજ્ઞ તો  
 સંયમજીવનને જ આપી શકાય છે.  
 આ સંયમજીવન અનંતકાળે હાથમાં  
 આવે છે અને એ જીવનને પામીને ય  
 જો પ્રમાણનું સેવન કરવામાં આવે છે  
 તો અનંતકાળે ય એ હાથમાં આવે કે કેમ  
 એમાં શંકા છે.  
 શાસ્ત્રનાં પાને પાને આ જીવનની  
 પ્રાપ્તિને સાર્થક કરી દેવા માટે જાતજાતની  
 પ્રેરણાઓ અને ચેતવણીઓ આપવામાં આવી છે.  
 એ તમામનો મારા મંદક્ષયોપશમાનુસાર  
 અગ્રે મારા શબ્દોમાં થોડોક વિસ્તાર કર્યો તો છે  
 પરંતુ એમ કરવા જવામાં  
 અજ્ઞાતાંય જો હું જિનાજ્ઞાવિદુષ  
 અર્થધટન કરી બેઠો હોઉં તો એનું  
 અંતઃકરણપૂર્વક ત્રિવિધે ત્રિવિધે  
 મિથ્યા મિ દુક્કડ માગું છું.

ગુમ થઈ ગયેલ હીરો,  
 ખોવાઈ ગયેલ લાખોની થઘી,  
 આહું-અવળું થઈ ગયેલ  
 કરોડોની કિંમતનું ઝવેરાત  
 પાછું મળી શકે છે;  
 પરંતુ  
 એક વાર હાથમાંથી  
 ચાલ્યું ગયેલ સંયમજીવન ?  
 કદાચ અનંતકાળે પણ મળે કે  
 કેમ એમાં શંકા છે.  
 એ દુર્ભાગ્ય આપણાં લમણે ન જીંકાય  
 એ અંગેની કેટલીક યુક્તિઓ બતાવતું  
 પુસ્તક એટલે જ  
 ‘ફરી કયારે મળશે આ જીવન ?’